



**બાળચુદી-માર્ચ ૨૦૧૨**

### પ્રત્યક્ષીય

હાથવગો નકશો – પછી ? પ્રાપ્તિઓ કે રહ્યાં હોય ? ૩

### સમીક્ષા

પોત-પોતપોતાનું (કવિતા : પ્રાણજીવન મહેતા) રાહીશયામ શર્મા ૭

કવિનો અવાજ (કવિતા : પ્રવીણ ગઢવી) વિનોદ ગાંધી ૮

સામા કાંઈની વસ્તી (વાર્તા : નવનીત જાની) ગુણવંત વ્યાસ ૧૨

આ લે, વાર્તા ! (વાર્તા : ગુણવંત વ્યાસ) ઠલા નાયક ૧૬

કાન્તના પત્રો (ચરિત્ર : સંપા. દર્શના ધોળકિયા) કિશોર વ્યાસ ૧૮

મરમી શબ્દનો મેળો (વિવેચન-સંશોધન : નિર્ંજન રાજ્યગુરુ) નરોતમ પલાણ ૨૬

ગુજરાતનો સમૃદ્ધ વાર્ષિક્ય-વારસો (વિવેચન-સંશોધન : નિર્ંજન રાજ્યગુરુ) નરોતમ પલાણ ૨૬

૨૪x૭ = મુંબઈ (સંદર્ભ : અમૃત ગંગર) વિનીત શુક્રલ ૩૦

### વર્દેણ્ય

આધ્યાત્મિક કાંતિનાં ફૂલો (કવિતા : અનુ. પ્રદીપ ખાંડવાલા) ચન્દ્રકાન્ત ટોપીવાળા ૩૩

### સંદર્ભવિશેષ

ગાંધીજીની દિનવારી (ચંદુલાલ ભ. દલાલ) રાજેન્દ્ર પટેલ ૩૭

### સામયિક લેખ સૂચિ : ૨૦૧૧

‘કવિતા : આસવાદ’થી ‘કવિતા : અભ્યાસ’ સુધી કિશોર વ્યાસ ૪૧

### પત્રચારી

દીપક મહેતા, હેમંત દવે, રમણ સોની ૪૮

### પરિચય-મિતાક્ષરી

પ્રાપ્ત પુસ્તકોનો મિતાક્ષરી પરિચય : સંપાદક ૫૧

આ અંકના લેખકો ૫૩

● આ અંકની પ્રકાશન-તારીખ ૧૦-૪-૨૦૧૨

આવરણ શીટોશ્રાફ રોહિત કોઠારી

સંયોજન-પરિકલ્પના : રમણ સોની

તંત્રજ્ઞ-સહયોગ : મનીષ ગજીર

**પ્રકાશક અને મુદ્રક :** શારદા સોની ૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ,  
વડોદરા - ૩૮૦૦૧૫ ફોન : ૦૨૬૫-૨૩૫૭૧૮૭

**મુદ્રણ-અંકન :** શારદા મુદ્રણાલય, ૨૦૧, તિલકરાજ, પંચવતી પહેલી વેન, આંબાવાડી,  
અમદાવાદ - ૩૮૦૦૦૬ ફોન : ૦૭૯-૨૬૫૬૪૨૭૯

**મુદ્રણસ્થાન :** મધુ પ્રિન્ટરી, કારેલીબાગ, ગુજરાત સમાચાર સામે, વડોદરા - ૩૮૦ ૦૧૮ ફોન : ૦૨૬૫-૨૪૬૧૨૪૪

સત્યપદ	<b>વાર્ષિક રૂ. ૨૫૦      દ્વિવાર્ષિક રૂ. ૪૫૦</b> <b>આજીવન સત્યપદ :</b> વ્યક્તિ માટે રૂ. ૨૦૦૦; સંસ્થા : રૂ. ૨૫૦૦ <b>શુલેચ્છક સત્યપદ :</b> (વ્યક્તિ તેમજ સંસ્થા)      રૂ. ૩૦૦૦ <b>વિદેશ માટે :</b> વાર્ષિક : ડોલર ૩૦, પાઉંડ ૨૦; આજીવન : ડોલર ૧૫૦, પાઉંડ ૧૦૦.
--------	--

સત્યપદની રકમ હાથોહાથ, મનીઓર્ડર, ડિરી કે મલ્ટીસિટી ચેકથી મોકલી શકાશે. ચેક/ડ્રાફ્ટ 'શારદા સોની પ્રકાશક પ્રત્યક્ષ' એ નામે લખવા વિનંતી; માત્ર પ્રત્યક્ષ ન લખવું. મનીઓર્ડર મોકલનારે સંદેશાની જગાએ પૂરું નામ-સરનામું અવશ્ય લખવું. એ સિવાય રકમ ગેરવલે કે અન્ય નામે જવા સંભવ છે.

સત્યપદની રકમ મોકલવાનું સરનામું : શારદા સોની/ રમણ સોની ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા-૩૮૦૦૧૫

**સત્યપદની રકમ નીચેનાં સરનામે પણ આપી શકાશે :**

- પ્રસાર : ૧૮૮૮ આતાભાઈ એવન્યૂ ભાવનગર-૩૬૪૦૦૨
- ગ્રંથાગાર : ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, નરીકિનારે, 'થાઈભ્સ ઓફ ઇન્ડિયા' પાછળ,  
આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
- સૌરભ પુસ્તક ભંડાર : બી-૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ્સ, સ્ટર્વિંગ હોસ્પિટલ પાસે, મેમનગર,  
ગુરુકુળ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૨

પ્રત્યક્ષ વર્ષમાં ચાર વાર : માર્ચ, જૂન, સપેમ્બર અને ડિસેમ્બરના અંતે – પ્રગટ થાય છે.  
અંક ન મળ્યાની ફરિયાદ ૧૫ દિવસની અંદર જ કરવી. અંક સિલકમાં હશે તો જરૂર મોકલાશે.

#### સંપાદકીય સંપર્ક :

રમણ સોની ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા-૩૮૦૦૧૫  
ફોન : ૦૨૬૫-૨૭૫૭૧૮૭, ૯૨૨૮૨૧૫૨૭૫, ૮૧૪૧૬૭૭૭૧૦  
email : ramansoni46@gmail.com

પ્રત્યક્ષમાં પ્રગટ થતાં લખાણોમાંના લેખકોના અભિપ્રાયો સાથે સંપાદક/પ્રકાશકની સંમતિ-અસંમતિ અપ્રસ્તુત છે.

## પ્રત્યક્ષીય

### હાથવગો નકશો – પછી ? પ્રાપ્તિઓ કે રજીભાટો ?

કિશોર વ્યાસે સંપાદિત કરેલી સામયિક લેખસૂચિ ૨૦૦૬-૨૦૧૦\*ને નિમિત્તે થોડીક વાત કરવી છે – આ સૂચિ-પ્રવૃત્તિના પ્રદાન વિશે, ને એ પ્રદાન અંગે હવે જાગેલા કેટલાક પ્રશ્નો વિશે, ને એના સંભવિત, ઈષ્ટ-ઇચ્છિત ઉકેલ વિશે.

૧૯૮૮માં વિચાર આવેલો કે આપણાં સામયિકોમાં કેટકેટલી ને કેવીકેવી અભ્યાસ-સામગ્રી એક તેજલિસોયાની જેમ આપણાને અજવાળીને પછી ભૂતકાળ તરફ સરી જાય છે ! એમાંનું કેટલુંક તે તે લેખકોનાં પુસ્તકોમાં સંઘરાશે, બરાબર. પણ એ બધું એક રીતે તો વિભાગેલા-સરખું હશે; તોઈ એક વિષય પર કામ કરવા ઈચ્છાનારે કઈ કેટલીય જગાએ ફિઝીસવું પડે ને રજાવું પડે. તો, એને હાથવગું કરીને, વ્યવસ્થિત રીતે, સુલભ બને એમ વર્ગીકૃત કરીને, મૂકી ન શકાય ? એમાંથી સામયિક લેખસૂચિનો વિચાર આચ્યો. શરૂ કર્યું સીધું ‘પ્રત્યક્ષ’માં જ પ્રગટ કરવા – સામયિકોમાં છપાયું હોય તેની વિગતો તરત, પછીના જ વરસની શરૂઆતથી, મળવા માંડે તો વધુ સારું, એ આશાયથી. તરત બધાંને ઉપયોગી લાગ્યું, પ્રસન્ન પ્રતિભાવો મળ્યા ને અમને (મને ને, પહેલી જ સૂચિથી સંકળાપેલા, કિશોર વ્યાસને) લાગ્યું કે આ તો સામ્રાત વિવેચન-વિવરોનો એક ચહેરો પણ સ્પષ્ટ થતો જાય છે.

પરંતુ કામ કરતાં-કરતાં, ‘ઉપયોગિતા’ વિશે અંદર એક બીજો પ્રશ્ન ડલોળાતો હતો – આ સંચિત કરીએ છીએ એ બધું જ કામનું ખરું ? અહીં તો નબળણું-સબળું બધું એકસાથે રજૂ થાય છે, એનું શું ? પણ સૂચિ કરનારે તરત્તમ જોવાનું ન હોય, દસ્તાવેજકરણ માટે એવું મૂલ્યાંકન અપ્રસ્તુત છે – એવા સ્વીકૃત વિચારથી એ કામ ચાલ્યું. પાંચ વર્ષે સંકલિત સૂચિ કરી (૧૯૮૬-૨૦૦૦નાં વર્ષોની) ત્યારે લાગ્યું કે કેટલો વિસ્તીર્ણ પટ વ્યવસ્થાપૂર્વક સંકલિત થઈને મુકાયો છે ! એ સૂચિગ્રંથને અંતે મૂકેલી સમીક્ષકોની સૂચિ તો બહુ જ ઉપયોગી સાબિત થઈ. લેખકમિત્રો કહે, અમારા પ્રગટ થયેલા લેખ ક્યાં, કેટલા છે એનો હિસાબ અમારી પાસે ન હતો, તે આ સૂચિઅંતર્ગત સૂચિને સહારે મળ્યો.

\* એની વિગતો માટે જુઓ આ અંકમાં ‘પરિચય-મિતાક્ષરી’

કેટલાબધા સૂચિરસિકો તૈયાર થયા – મુજબત્વે તો અમારાં વિદ્યાર્થીઓ. એ કહેવા લાગ્યાં – સંશોધનસિદ્ધાંતોનાં વ્યાખ્યાનો-લેખો હવે બરાબર સમજાયાં, આ સૂચિ કરવામાં જોતરાયાં એ પછી !

પહેલાં પાંચ વર્ષ વિવિધ સૂચિ-કારો હતા. પણ પછી લાગ્યું કે એક હાથે, કિશોર વ્યાસ જેવાને જ હાથે, કામ આગળ ચાલે એ વધારે સારું થશે. એથી, પછીનાં ૧૦ વર્ષ એમનાં થયાં. (ને હજુથી, આ અંકમાં પણ જોશો એમ, એમનો સૂચિ-વશ ચાલે છે.) એમણે બે સૂચિ-ગ્રંથો આપ્યા : પહેલાં ૨૦૦૧-૨૦૦૫ની સૂચિ, હવે આ ૨૦૦૬થી ૨૦૧૦ સુધીની.

વ્યક્તિગત જ્ઞાને તો બાજુએ જ મૂકી દઈએ; પણ કામ પોતે પ્રશસ્ય હતું એટલે પ્રશંસા થઈ – પ્રશંસા કરતાં તો, ઉપયોગિતાના સંતોષમાંથી જન્મેલો આભારભાવ. ૧૫ વર્ષોની, અનેક લેખકોની, અનેક રૂપની – આસ્વાદથી અભ્યાસ સુધીની; સંપાદકીય દસ્તિકોણોથી અહેવાલો સુધીની –; અનેક વિષયવિભાજનોમાં અકારાદિકમે સુલભ થયેલી સામગ્રીનો એક બૃહદ્દ અને છતાં વિગત-જીણવટોવાળો નકશો હાથમાં આવી ગયો એટલે અભ્યારીઓ ને સંશોધકો રાજી રાજી, બલકે રાજા ! એ પ્રદાન કંઈ નાનુંસૂંનું ગણાય ?! પણ...

□

પણ હવે થોડાક પ્રશ્નો પણ થાય છે. એમાંના ઘણાખરા છેલ્લાં બેપાંચ વર્ષોથી થાય છે.

પહેલો પ્રશ્ન નિઃશેષ દસ્તાવેજકરણ સામે. પૂર્ણ શાસ્ત્રબુદ્ધિવાળા કહેવાના – આપણો (સૂચિ કરનારે) આપણો ધર્મ સંભાળવાનો – બધું જ મૂકી આપવાનું. પસંદગી કરનાર કરી લેશો એની જરૂરિયાત પ્રમાણે. પરંતુ જેમ પસંદગીની સંદર્ભગ્રંથસૂચિ હોય એમ પસંદગીની લેખસૂચિ શા માટે ન હોય ? અર્ધા પાનાનાં, પ્રાસંગિકતા નિભાવનારાં, અછડતા ઉલ્લેખોવાળાં, અભ્યાસની ઘણી જ અધ્યુરૂપ-ઓછપવાળાં, અહેવાલો આપતાં લખાણોમાં શા માટે રજાપાટ કરવાનો અભ્યારીને ? સૂચિનો નકશો હાથમાં લઈને એ ભટકે, સામયિક શોધી, ને ફેરો નકામો જાય તો તમે સૂચિકાર તરીકે શોધક-સહાયક (યુઝર ફેન્ડલી) કેટલા રહ્યા ?

પસંદગીની, અલબંત, એક મૂળવણ હોય છે. યાદસ્થિકતાને, યોગ્યાયોગ્યતાની અંગતતાને એમાં અવકાશ રહે છે. પણ એનો સામનો તો દરેકે દરેક સંપાદકને તથા સંચયકારને કરવાનો આવે જ છે – એ કવિતાચયનકાર હોય, વાત્તાચયનકાર હોય કે લેખનિર્દેશચયનકાર હોય. એટલે, ગયા વરસથી, એવો એક પ્રયોગ કર્યો છે : પસંદગી ઘણી જ વ્યાપક, ખાસી ઉદાર રાખવી પણ સર્વસંગ્રહમાંથી બચવું – ને એમ ઉપયોગકર્તાના સમયને બચાવવો. આ પણ એક દસ્તિકોણ છે, બીજાનો બીજો હોઈ શકે. પણ આટલાં વર્ષના અનુભવે એ સમજાયું છે કે વર્ગીકૃત હોય તોપણ સામગ્રી ઢગલારૂપ બની શકે – એટલે રસ્તા બને એટલા ચોખા રાખવા, ગલીકૂંચીઓની વધુ પડતી રજાપાટમાંથી ઉપયોગ-કર્તાને બચાવવો.

એક બીજો પ્રશ્ન હજુથ વળાઉકલ્યો છે. તમે તો સૂચિમાં નિર્દેશ કરી દીધો કે ફ્લાણા સામયિકના, તે વર્ષના, ફ્લાણા અંકમાં આ પૃષ્ઠકમાંકો પર આ એક લેખ પડેલો છે. પણ સામયિકો, જેમ જૂનાં થતાં જાય એમ લગભગ અંતર્ધિન થતાં જાય છે ! પેલા નકશાવાહકે ક્યાં જવું ? સાક્ષાત્કારના માર્ગો બતાવ્યા એટલે સાક્ષાત્કાર થઈ જ ગયો એવું થાંકું છે !

તો હવે પ્રશ્ન થાય કે સૂચિની ઉપયોગિતા આ પાર તો છે પણ ઓ પાર કેટલી રહેવાની ? સામયિકો મળે તો તો તાર સંઘાઈ જવાનો - સૂચિ કરનારનાં પરિશ્રમ ને વ્યવસ્થાસૂઝ લેખે લાગવાનાં જ. પણ બધાં સામયિકો ન મળે કે સાવ દુર્લભ બની જાય ત્યારે ?

એક રસ્તો છે. એ હવે થોડોદાખણો ખૂલતો જાય છે. સામયિકોને વીજાણુમાધ્યમને માર્ગ ઘનાંકિતામાં સંઘરખાં. એવી, થોડાંક સામયિકોની સીરી થવા લાગો છે. 'વીસમી સર્ટી' જેવું ઘણું જૂનું સામયિક ઘનાંકિતા-સુલભ થયું છે. એ જ રીતે 'કુમાર'ની તથા ફાર્બર્સ ગુજરાતી સભાના 'ત્રૈમાસિક'નાં આજલગીનાં ઉપ વર્ષની તેમજ પરબરાનાં છેલ્લાં પાંચ વર્ષ (૨૦૦૭-૨૦૧૧)ની ઘનાંકિતા તૈયાર થઈ છે. દરેક સામયિક, આ રીતે, આવતાં ચાર-પાંચ વર્ષમાં ઘનાંકિતા-સુલભ બનવા લાગે તો સામયિક લેખસૂચિનો નક્શો જળહળવા માંડે - સૂચિકાર ગર્વ અને આનંદથી કહી શકે કે હું હંમેશાં તમારો સાથી છું : મિત્રાણામ્બ સૂચિકારોડસ્ટિમ...

□

કિશોર વ્યાસની આ સૂચિ વર્ગિકરણની અને પદ્ધતિની દાખિએ અગાઉની બે સૂચિઓને, બહુધા, અનુસરે છે. અનુભવે તે વ્યવસ્થાને વધુ સાફ કરતા ગયા છે, કેટલીક મુશ્કેલીઓ પૂરેપૂરી હલ થઈ નથી એ છતાં ચિત્ર સ્પષ્ટ બન્યું છે. વિશેષાંકોની સામયિકીને, મુલાકાત-કેફિયત-વાર્તાલાપોને એ વધુ અવકાશ આપત્તા ગયા છે. 'પ્રત્યક્ષ'માં વર્ષેવર્ષે પ્રગટ થતી સૂચિઓ સંકલિત કરતી વખતે, રહી ગયેલી ક્ષતિઓ નીવારવાની તક રહે, એ પણ એમણે યોગ્ય રીતે લીધી છે. વળી, રોહિત કોઠારીની નજર નીચે એ પુસ્તકરૂપ પામી હોવાથી, એમનાં ચોકસાઈનો ને સાફ મુદ્રણસૂઝનો લાભ પણ એને મળ્યો છે. એટલે સૂચિનાં પાનાંમાંથી પસાર થવું સુખાવહ બની શકે એમ છે.

કિશોર વ્યાસે ૨૧મી સદીના પહેલા દાયકાની બે સૂચિઓ આપી. એ પૂર્વે ગત દાયકાનાં છેલ્લાં પાંચ વર્ષની સૂચિ મેં સંપાદિત કરી હતી. હજુ પાંચ વર્ષ જતાં વળી કિશોર ૨૦૧૫ સુધીની સૂચિ આપવાના છે. આમ, ૨૦ વર્ષની ૪ સૂચિઓ થઈ હશે. ન જો એ વિસે વર્ષની, કોઈ દ્વારા, એક સંકલિત સૂચિ તૈયાર થઈ હશે, ને વળી ત્યારે બધાં સામ્રાત સામયિકો જો વિજાણુયુગમાં જળહળતાં હશે.... તો પછી સંશોધન-અધ્યયનના રસ્તા નિરવરોધ બન્યા હશે.

આપણા હથમાં છે તે સામયિક લેખસૂચિ ૨૦૦૬-૨૦૧૦ આવા લોભામણા અધ્યયન-ભવિષ્યના દ્વારે સ્વાગત કરતી, ને સ્વાગત પામતી ઊભી છે. એ અવસરે કિશોર વ્યાસને અભિનંદન !

અનુભસાની

કિશોર

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ ૫

## રોહિત કોડારી □ જ. ૧૫, જુલાઈ, ૧૯૮૮ : અવ. ૧૫, જાન્યુ. ૨૦૧૨ □ સ્નેહંજલિ

કોઈની શ્રદ્ધાંજલિ લખતાં હથ ઘડીક અટકી જાય એવું કાયમ બન્યું છે પણ મન ઘણા પ્રયત્નેય તૈયાર ન થતું હોય એવું આ પહેલીવાર બને છે. વાસ્તવિકતાનો અસ્વીકાર આટલો લાંબો સમય ચાલ્યા કરશે એ ધાર્યું ન હતું.



જ્યંત કોડારીના પુત્ર તરીકે રોહિત એની કિશોરવયથી પરિચિત. એ જ પરિવારસંબંધ મુદ્રણાયવહાર સંબંધ સાથે જોડાઈને આગળ ચાલતો રહેલો. એનો વિકાસ, મુદ્રકવ્યવસ્થાપક તરીકે એની પોતાની અલગ ને આગવી ઓળખ હું સ્નેહથી જોતો રહેલો. એ પણ, વ્યવહારમાંય આદરભાવે વર્તતો રહેલો. ફોન પર, કે એની સામેની ખુરશી પર બેસીને થતી વાતો ઘણી વાર લંબાઈ જતી. એના આનંદો, એના આગછો, એના જ-કારો, લઘરી હસ્તપતો આપતા લેખકો-સંપાદકો તરફનો એનો સ-આદર છતાં તીવ્ર રોષ, સ્વર ઊંચકાઈ જાય ને પછી ખડખડ હસી પણ પડે – એ બધું હું માણસો જતો એથી, નીકળવાની ઉત્તાવળ હોય તે છતાં વધારે સમય બેસી જવાતું કે કામમાં હોવા છતાં ફોન લંબાઈ જતા.

વત્સલતાથી જોડાયેલો હોય છતાં એનામાંનો વ્યવસ્થાપક ક્યારેક ઊંચકાઈ આવે – ‘પ્રત્યક્ષ’ માટે ક્યારેક મોડું થયું હોય ને હું તાકીદ કરવા કહું ત્યારે, ‘જોઈશું’ – એવી અસ્પષ્ટતા નહીં; ‘હમણાં તો નહીં જ બને, હોં’ એવું એનું બોલ્ડ કરેલું વાક્ય ધસી આવે. એની વ્યસ્તતા ને ભારણ સમજી, ‘ભલે’ એમ કહીને મેં મોડું થવાનું સ્વીકારી લીધું હોય ને ત્યાં જ, બીજે અઠવાડિયે તો એની પાસેથી ‘ઝોઈનલ પ્રૂફ’ આવી ગયાં હોય ! અરે રોહિત, શો ચમત્કાર થથો ? તું તો ના કહેતો હતો ને ? પણ, ત્વરથી ચાલતા એના મગજે કેંક રસ્તો ખોળી કાઢવો હોય. હવે આવી સ્નેહભરી ‘ના’ સાંભળવા નહીં મળે...

સામગ્રીની અનિયામિતતા સાથે, સંપાદન-આયોજનની મારી બધી જ ચીવટ, ચીવટ જ શું ચિકાશ એણે સમજ લીધીલાં. કોઈના પર, કોઈના ભરોસે, જરાય ન છોડનાર હું એના પર છોડી શકતો : ‘તું છે એટલે ચિત્તા નહીં.’ પ્રત્યક્ષ’ને મેં ૨૦ વર્ષથી લાડ કર્યા છે તો એણેય એની એવી જ, એટલી જ, કાળજી લીધી છે. એણે ન એના માર્ગદર્શનમાં કેળવાયેલા સાથીદારોએ. એ સાથીદારો એની કાર્યશૈલીને કેંક અંશે જાળવશે.

પણ રોહિત તો કયાંથી લાવવો ? જોહણી-પૂર્ફવાચનથી શરૂ કર્યું – જ્યંતભાઈના માર્ગદર્શનમાં, પછી મુદ્રણાંકનની, મુદ્રણસજાની, મુદ્રણતંત્રની ને વ્યવહારની – એણી અને અધિકૃત જાગકારી કેળવી, પુસ્તકોનાં નમૂનેદાર ઉપરણાં કર્યાં. એના કાર્યાલયમાં એ વિવિધ-સુંદર ઉપરણાંના નમૂના ચોંટાદેલા – પ્રદર્શિત કરેલા છે. એમાં એની હાજરી વરતાયા કરશે.

રોહિત મુદ્રક હતો એ સાથે એક કાબેલ સંચાલક પણ હતો. વ્યવસ્થાશક્તિ મોટી. બધું એના ધ્યાનમાં, નિયંત્રણમાં હોય. ચુકાયા વિના બધું સરખી રીતે જ થાય – જ્યંત કોડારીનો વારસો. સંપર્કો બહોળા. જ્યંતભાઈ એકાંતપ્રિય, રોહિત મળતાવડો. (મંગળાબહેનનો વારસો ?) એટલે એનામાં મુદ્રણકૌશલ, સંચાલનકૌશલ ને એ ઉપરાંત આ સંપર્કકૌશલ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એણે ફોટોગ્રાફીનું કૌશલ પણ, રસપૂર્વક, કેળવેલું. પૂરો ખીલેલો માણસ. ત્યાં જ...

●

‘પ્રત્યક્ષ’ના હવે પછીના દરેક અંક વખતે એની પરોક્ષ હાજરીનો કપરો સામનો કરવો પડશે.

એને સ્નેહંજલિ.

## સમીક્ષા

પોત-પોતાનું - પ્રાણજીવન મહેતા

ઇમેજ, અમદાવાદ, મુંબઈ ૨૦૧૦ રૂ. ૧૪૩, રૂ. ૧૫૦

“સબદ – કાગજ મેં તો કહીં ન સમાચો”

રાધેશયામ શર્મા

ઓડેને યોગ્ય કથ્યું છે, કવિતામાં સ્વરૂપ અંતર્વસ્તુની શોધમાં રહે અને અંતર્વસ્તુ સ્વરૂપની શોધમાં રહે છે. જ્યારે એ ઉભય સફળતાપૂર્વક એકસાથે થઈ જાય - ત્યારે ખરેખર કવિતા પ્રાપ્ત થાય છે.

કવિ પ્રાણજીવન મહેતાના કાવ્યસંચય “પોત-પોતપોતાનું”માંથી પસાર થતાં સામગ્રી અને સ્વરૂપનું આવું અદ્વૈત ભાવકનો અનુભવવિષ્ય બની શકે છે. ત્યાં સામગ્રીનો ઉલ્લેખ સ્વરૂપથી વિભિન્ન નથી હોતો અને સ્વરૂપની ચર્ચા સામગ્રીથી વિસ્થિન્ન નથી થતી.

ભાવચર્યાની ભાષાકર્મ સાથે એક પ્રકારની પરસ્પર સંપૂર્ણ રૂપ જુગલબંદી યુગપદ્ધ છે.

સંગ્રહનું અભિધાન ‘પોત-પોતપોતાનું’ જોતાં ‘પોત’ શબ્દને વસ્ત્રવણાટ, ટેક્ષાર સાથે જોડી શકાય એવી સુવિધા કળાકાર અતુલ ડેડિયાના આવરણચિત્રોની નોંધમાં વણાઈ છે. આગલા આવરણ એ મોઝિક બસ’માં ‘કોટન શર્ટ’નો ઉલ્લેખ છે તો પાછલા આવરણ ‘રિવર ઓફ બોન્સ’માં પણ સ્કીન પ્રિન્ટિંગ ઇન્ક સાથે કોટન શર્ટની નોંધ છે. તોયે વાત આટલેથી અટકતી નથી. ‘પોત’નો અર્થ, સંસ્કૃતના ‘આત્મત્વ’ અને પ્રાકૃતના ‘અપ્રત્ત’ સાથે સાંકળી પોતાના

ખરા સ્વરૂપ, પોતાપણા સાથે વિસ્તરે છે. ‘પોત’નો અલ્યપરિચિત અન્ય અર્થ આ સંગ્રહના સમગ્ર સંદર્ભમાં લગભગ બંધ બેસે એવો છે તે, ‘ફસ-નસ ખોલવી’ તે - એટલે કે કવિ, ભાષાના શસ્ત્ર-અસ્ત્રથી પોતાના આંતરિક રૂપને ખોતપોતાનુંનું પણ એવું જ. નિજતાનું પોત, પોતપોતાનું પણ એટલા માટે કે માંડોમાંહે એ દરેકમાં પરિવ્યાપ્ત થઈ વિલસ્યું છે. કાવ્યારભેજ નાયકે ફસ ખોલી બતાવી છે :

બધા બનિયા ઉધીરી લીધા

બનિયે બનિયે

સરી જતી જીવત

અંદર ભરાઈ પદેલી (૫. ૬)

પોતાપણાની ખોજ, ‘પિણાણ’, વિષ શાની ? અંતે ‘ફેસલેસ’ અહેસાસમાં પરિણમે છે. પોત-પણાની શું પિણાણ ? / ચહેરા વગરના ચહેરાને / શું પૂછું - ક્યાં છે ચહેરો ? (ફેસલેસ હ્યાતીનું પોત ‘બ્યગ્ર ચિત્તને વીંધું’ સુધી પહોંચ્યું છે)

પૂરા સંગ્રહની શિરાએ શિરામાં વર્થત્વ લગભગ પ્રસરી વળ્યું છે. પૂ. ૨૨ ઉપરની રચના ‘વર્થના અર્થ

સંગ્રહ

જાન્માર્ય-માર્ય ૨૦૧૨ ૭

અધૂરા' આગળ ઉપર પૃ. ૧૧૯ ઉપર 'વર્થબોધ', ૧૧૮ ઉપર 'અ-નર્થ બોધ'ને સંકલિત કરે છે. નરસિંહ મહેતાની રગમાં જાગ્રણે જોવાનું શરૂ કરતાં વર્થતાની વથા કેવી અધૂરી જેવી દશામાં ધક્કેલે છે : અરથ વગરના વરથ / અનરથ સઘળા / રણેરગ ફેલાતા જાય, / ફણીધર ફુલારે પૂઠ પછવાડે - / વારેઘડીએ વીજીવીજી / ફોલી ખાઉ બેસી ફુલકાર-ફીતરાં. અરથને અનરથનો ચેપ લાગે તારે પાગલપણાની કરાડ પર અસ્તિત્વ ટિંગાઈ જાય. ફણીધર, ફુલકાર-ફુલકાર-ફીતરાં જેવા સમાન શબ્દોના સાહચર્યો કર્તાના બહુસંખ્ય ભાષાકર્ણનો અંદાજ આપે છે. ત્યાં 'અર્થબોધ' પણ 'અનર્થબોધ'નો અંચળો ઓળી લેતો લાગશે. 'વર્થબોધ'ની અંતિમ પરિણાત્મિ, નાયકની સ્વાનુભૂતિને લોકાં-સ્પર્શ સાંપડ્યો હોવાનો મધુર ભ્રમ ઉત્પન્ન કરી ગઈ, આ ભાવકને.

ચટકા ભરતી, ઊર્ઝ ગીતરતી  
લયબદ્ધ લબકારા ને  
કીરી કોતરતી કીરી જોઈ જાંખપ-જરૂરે બેસી  
હવાતિયાં જરૂર. (પૃ. ૧૧૯)

કવિનો અરથ પામવા માટે એમના અનરથ પાસે પણ જરૂરું પડે. જહેન રસ્કિને સાચું કહેલું : 'બી સ્યોર ધેટ યુ ગો ટુ ધ ઓંથર ટુ ગેટ ઓંટ ડિઝ મિનીંગ, નોટ ટુ ફાઈન્ડ યોર્સ.' અનરથની અન્ધાર રચિમાંથી ગુજરી જઈને જ અરથના પ્રભાતમાં પ્રવેશી શકાશે. આને દ્રાવિડી પ્રાણાયામ માનો તો માની શકો.

'પીડા-નામે એક પારિભાષિક શબ્દકોશ' (પૃ. ૩૮)  
'કણ્ણસ-નામે જપમાણ જરૂર' (૫૮) કંઠકળતર (૮૮)  
દાહપર્વ (૧૦૫) જેવી રચનાઓ વાર્દક્યની અસહ્ય વેદનાનો શંખનાદ સુણાવે એવી છે. દા. ત.,  
છાતી ડેકાણો છિદ્રો પારી  
છેદો દેખ્યું ને છાણી મરું  
દોટ મૂકું અસ્કાર રણ વચાળ  
ભીની રેતમાં ખોદું જળ-મૃગ-વીરડી.  
...  
પાંસળી-ઢગ વચાળ ઊભો રહી વિચારું -  
આ ભારો માથે ઊચકી  
ઉચક જીવે પ્રશ્ન-વિષાદ ભર્યું (પૃ. ૪૨)

કંઠકળતરની 'પીડા'માંથી કાવ્યરચના પાણા 'વર્થને તારવી અર્થ અવાજને વર્ઝું' કહી અભિલાષ કરે છે :

ઉકેલું અવળસવળ પડચા અવાજને  
અર્ઝુ ધનિ સમેત ધન્યાતોકને (પૃ. ૧૦૨)

સભરતા હોય ત્યાં સ-અર્થકતા સ્વાભાવિક છે. પરંતુ વર્થતા તો 'ખેલ ખાલીપાનો' (૭૧) ખેલાતો હોય ત્યાં જ સંભવે. એને સ્વાદ ચાખવા માટે નથી-છે-હરોના હોવાની સંભાવના વિશે' (પૃ. ૭૩)ના વિશમાં વિહરવું પડે :

છેને છેકવો નથી  
નથી ભૂસવો છેને છિક  
છતાં પલકવારમાં છે છટકી જાય છે (પૃ. ૭૪)

વિરલ સર્જક જ 'અંડિત કવિતાના થોડા ટુકડા' લેણા કરી લિન્ન-કાળ બેંકાર (પૃ. ૩૫) તથા 'ભીંત પણીતે આલેખું ભયાવહ બેંકાર' (૮૮) જેવી ફુતિઓ નિર્મી શકે. ઉમાશંકર એમની વિખ્યાત રચનામાં છિન્નભિન્નતાને આત્મલક્ષીલય અર્પી રહ્યા તો મહેતાજી આલેખી રહ્યા : 'છિન્ન-કાળમાં સરું / લિન્ન-વિ-લિન્ન કાળને વર્ઝું' ('વર્ઝું' કર્તાનો ગમતો પ્રયોગ છે)

કળ-ઉદ્ધરમાં ક્ષણ તેમ જ પલને પોણી પાલન કરતા નાયકને નીરખવો હોય તો પૃ. ૧૧૬-૧૧૭ પર 'ક્ષણભર ક્ષણકારે' તથા 'પલભર પલકવારે' વાંચવો. એકેએક શબ્દનો, એની સાચી ગુજરાતીતાનો રસકસ કાઠવામાં પ્રાણજીવનને કદાચ લાભશંકર ઠાકર યા ચન્દ્રકાન્ત હોપીવાળાની પંક્તિમાં માનસ્થાન મળે. સુણો :

બકબક નામે થાળીવાજું  
પડાને મૂકી  
અહીં બેસી સાંભળવાનું  
રોજબરોજનું બખડાંજંતર (પૃ. ૮૮)

ચહેરાવિહોણા ચહેરાની દિશામાં 'વણ પીઠીએ આલેખું ચિત્રો થોડાં'માં ઘાણશ્રૂતિ-દશ્યસંકર-ભાવકલ્પનાનો એક સંવિશીષ ઉપખાર :

ફાનસને ફૂક દેતાં  
ખોરડે ધબ્બ અંધારું  
ઓલવાતી વાટમાં ચોમેર પથરાય  
પમરાટ ભરી  
પસરતી અંધાર-ગંધ (પૃ. ૮૦)

પૃ. ૧૨૧ પર ‘વલવલાટ-નામે વળગણ વળગાડ’, પૃ. ૧૨૫ પર ‘લવારાનો લય’ આ બે ગંદ્ય-સંસિદ્ધ સંરચનાઓ સ્વતંત્ર આસ્ત્વાદ પામે, તદ્દુપરાંત, બાણની શૈલી અને બેકેની જિચોઝિચ ફક્શબદ્ધ નવલની યાદ આપે એવી સઘન સમૃદ્ધ છે. કથનકલા વત્તા કાવ્યરસને આત્મલક્ષીતાનો ઈશ્ત અહેસાસ આપતો એક નાયાબ નમૂનો જોઈએ :

‘કાગળની હસ્તીમાં વસવાટ કરી કરગરવાનું શાને ?  
કાગળને હાંસિયે વસાહ્ત રથાપી વસવું આજ અહીંયાં  
કાગળને ધાવણ કૂટે – ચસચસ ધાવું – કાગળ.’ (પૃ. ૧૨૩)

‘લવારાનો લય’ અહીં ભાષામાં પહેલવહેલી વાર જળક્યો લાગશે :

“સૂનકારને સોય-દોરે સાંધુ, ત્યાં પટ ફાટે સોય પરોવે,  
લીરાલીરા ઉડતા કેંધુ.  
લીરે લીરે દેખું લીવાલડેર. હરખપહૂડા માણસની જેમ  
હરખું વગર કારણો.  
કારણને કોરાણે મૂકી ક્યાં શોધું ? શું શોધું વિના  
કારણો ?

હવે બેસી આકાર ભણું કે પછી વિચારું ?”

(પૃ. ૧૨૮)

કવિશ્રી પ્રાણજીવનની સરસર સરકતી માનસસરિતામાંથી અહીં તો અલપઝલપ અત્યાંજલિઓ વહાવી છે. પોતાનું પોત સુધહુ તો છે જ પણ ડિગ્રોંગ પેટનમાં પ્રવાહિત આત્મમુખ્ય લયનો નિનાદ ગુજરાતી કવિતાક્ષેત્રે ધ્યાનાર્ડ છે. ‘શેઠશઠ સપ્તક’ (પૃ. ૧૩૧), ‘શેઠનાં કાલ્યો’ (પૃ. ૧૩૮)નો જાયકો, ‘ઉંટસવારી’ (૧૪૫) પર ભાવકનેય આરૂઢ કરાવવાની લગામ પણ કવિને હાથવળી છે.

આપણા સુંદરમૂની વેઈનમાં કવિ હિન્દી તરફ વળ્યા છે, પણ પોતાની રીતભાત અને પોત સાથે. સંગ્રહમાંથી નીકળીએ ત્યારે આવી જાતસંડોવતી, હળવી બંગવેધી પંક્તિઓ, પૂરા પુસ્તકની એક નોંધનીય મર્યાદા તે જાબ્જેક્ટિવ મોનોટોનના પ્રલંબ પથારમાંથી તત્કષ્ણ તો ઉંગારી લે છે : સકળ, કવિલોકે આ તથ્ય ના અનુભવ્યું હોય તો જ આશ્રય : ‘ભોપા, સબદ બડો સયાનો, કાગજ મેં તો કહી ન સમાયો, ભોપા, સબદ બડો સયાનો’....

### કવિનો અવાજ - પ્રવીજા ગઢવી

પ્ર. કુણાલ શાહ, અમદાવાદ, ૨૦૦૮ જી. ૮૬. રૂ. ૧૦૦

### વેદના-આકોશ પ્રેરતી કવિતા

વિનોદ ગાંધી

કવિએ કહ્યું છે એ પ્રમાણે આ સંગ્રહની રચનાઓ વિચારની કવિતા છે. સામાજિક વિષમતાઓ સામે પ્રતિભાવરૂપે આ રચનાઓ જન્મેલી હોવાથી સ્વાભાવિકરૂપે જ એમાં પ્રગતિવાદ, દીલિતબ્યથાકથા, રેશનાલિઝમ જેવા વિષયો નિરૂપાયા છે. છતાં સઘળી રચનાઓમાંથી પસાર થતાં લાગ્યું છે કે કવિના આ વિચારોની પડછે માનવીય સંવેદન અંતઃસ્થોતરૂપે રહ્યું છે. એટલે આ રચનાઓ ભાવકને ભીતર સુધી સ્પશ્યા વિના રહેતી નથી. કવિના અગાઉના પાંચ

કાવ્યસંગ્રહોની જેમ જ, અરે, એમના કથાસાહિત્યની જેમ જ, અહીં ‘પ્રતિબદ્ધતા’ છે એવું કહેવાનીયે જરૂર પડતી નથી. પ્રતિબદ્ધતા પોતાની સાથે મર્યાદા-વિશેષતાઓ લઈને જ આવવાની. એ મર્યાદાઓ એની પોતાની જ હોવાની, ખાસ કરીને કવિતાને ભોગેય પ્રતિબદ્ધતા જળવાતી હોય તો જાળવી લેવાનું વણકહું વલણ અહીં પણ દેખાય છે. (જોકે અહીંની રચનાઓનું માધ્યમ ગંદ્ય હોઈ અને કવિતા વિચારની કવિતા હોઈ સહેજેય કવિશ્રી વિધિન પરીખનું

માનવી

જાસ્તિઅસ્થિ-માર્ય ૨૦૧૨ ૯

સુરણ થઈ આવે એ આડવાત પણ અહીં કહી દેવી જોઈએ.) સંગ્રહના પૃષ્ઠ ઉચ્ચરની રચના 'તમારે કારણો'ની અંતિમ બે લીટીમાં કવિ કહે છે :

અમે થયા અભિધા કવિ  
તમારા કારણે.

એ મુજબ પ્રતિબદ્ધતાને અભિધાનો આશરો લેવો પડ્યો છે અને અભિધાથી જન્મતી રચનાઓ કવિતાના કયા પ્રકારમાં બેસે એ જાણકારો જાણે છે, છતાં અહીં સ્તર જળવાય છે એનું કારણ કવિનો હથોટી છે. અહીંની રચનાઓ – કવિતાઓના પક્ષકાર બનવા માટે આપણે સુમન શાહની વિચારણાને ધ્યાને લેવી જોઈએ, અહીંની રચનાઓના તપાસના માપદંડ તરીકે પણ. સુમન શાહે દલિત કવિતામાં સંસ્કૃત કે પણ્ણિમની મીમાંસાની ભૂમિકાએ, એર્થેટિકસની રીતે રસ, આનંદ શોધવો ટીક નથી એ મતલબનું કર્યું છે, અને એનું કારણ પણ બતાવ્યું છે કે દલિતાદિ સાહિત્યનો આશય આનંદનો નથી પણ ચોક્કસ દુઃખો પ્રતિ વાચકને ઢોળવાના અનુનયનો છે અને અનુનયને વરેલા સાહિત્યમાં આનંદ ન જ હોય એવું પણ નથી, એવું વધારામાં ઉમરે છે.

'કવિનો અવાજ'ની મોટા ભાગની રચનાઓ ખોલવી, પચાવવી અધારી નથી. એનું કારણ આ જ સંગ્રહની 'ઉપાલંબ' રચનામાંથી પણ મળી આવશે. ઉપાલંબ કવિ કાલિદાસને છે, જોકે રચના શકુન્તલામુખે કહેવાઈ છે. શકુન્તલાને કવિ સામે ભારે વિરોધ છે. એ કહે છે કે કવિ કાલિદાસે એના દેહસૌંદર્ય વિશે, અંગોપાંગો વિશે ઉત્તમોત્તમ ઉપમાઓ યોજી પણ એના દુઃખના સાતત્યપૂર્ણ અસ્તિત્વની જાણે કે ઉપેક્ષા કરી છે. એ અર્થમાં શું સ્ત્રીનું કે શું દલિતપીડિતનું અસ્તિત્વ દુઃખાર્દ અને દુઃખાન્ત જ છે. 'કવિનો અવાજ'ની કવિતા પણ આ જ સૂરપ્રગટાવે છે. શિષ્ય સમાજની વાત તો શિષ્ય કવિતા કહેશે, પણ પીડિતની વેદના જો કવિ નહીં ગાય તો બીજું કોણ ગાશે ?

દલિત કવિતાનું સીધું અનુસંધાન ગાંધીયુગની સમભાવની કવિતા સાથે હોવાથી સામાજિક સ્તરે સમાનતા લાવવા મથનાર બે મહાનાયકો – ગાંધી અને આંબેડકર – આ પ્રકારની કવિતાના કેન્દ્રસ્થાને છે. દલિતકવિતાના અભ્યાસથી જણાઈ આવ્યું છે કે મોટા ભાગના દલિત કવિઓની રચનાઓમાં ગાંધીપ્રતિની કરીક નફરત વ્યક્ત થતી જોવા મળે છે. પ્રવીશ ગઢવી તટસ્થપણે ગાંધીજની તરફદારી કરે છે.

ટીકા ગાંધીની કરતાં પૂર્વ

પળ એક બનવું પડે ગાંધી (પૃ. ૫૩)

આ સંગ્રહમાં ચારિત્રદેખે ગાંધીજી ઉપર ઘણી રચનાઓ છે 'ભીતે લટકતો ચહેરો ગાંધી', 'ગાંધી', 'કેમ એમ ?', 'તમારી પાછળપાછળ', 'વારસ', 'ગાંધીને પગલે', 'ગાંધી જન્મો', 'ગાંધીવધ', 'ગાંધી', 'ત્રણ ગોળી', 'ગાંધી અને આંબેડકર', 'પયગંબર', 'કેમ જીવ ચાલે ?', 'ગાંધીની ટીકા' વગેરે. અભિધાસ્તરે કાચ્ય સિદ્ધ કરનાર કવિ પણ શબ્દાલંકારોનો આશરો લે. પણ કવિ અહીં એ છોડી, કેટલીક પ્રયુક્તિ-ચયમટ્કાતિનો આધાર લે છે. જુઓ. –

ખોડું કરી કહીએ

ફોટોયાંથી બહાર આવે.

(પૃ. ૩૮, ભીતે લટકતો ચહેરો ગાંધી) 'પયગંબર' રચના પ્રમાણમાં લાંબી છે. કવિ ગાંધીને ઈસુ કરતાં ઊંચે મૂકી આપે છે. ગાંધી પોતે પયગંબર હતા છતાં એ ઈસુની જેમ કબરમાંથી પુનઃ જાગ્યા ન હતા. કવિ ગાંધીએ શું શું નથી કર્યું એની લાંબી યાદી આપે છે, પણ એ યાદીમાંના કેટલાંક કામ તો ન કર્યા તે જ માનવતાના હિતમાં હતું. ન કર્યાની લાંબી યાદી પણ, ગાંધીએ શું કર્યું એની યાદી પણ કવિ મૂકી આપે છે :

પણ સદીઓથી બેકડ વળેલાને

ટકાર કર્યા,

અધિકાર માટે છાતી ખુલ્લી મૂકતાં કર્યા.

ગાંધીએ જીવનભર આચરેલાં વ્રતો અને કબીર, મહાવીર, બુદ્ધ જેવી વિભૂતિઓની પયગંબરી ઊંચાઈઓ પ્રાપ્ત કર્યા પછી પણ એ આજીવન સાદોસીધો જનસામાન્યનો સામાન્ય માણસ બની રહ્યો એવી ગાંધીલાક્ષણિકતાઓ જાણવા આ કાચ્ય જોતું રહ્યું. કર્યું – ના કર્યુંની યાદીઓની તુલનાત્મક સંનિધિની પ્રયુક્તિ રસ જન્માવે એવી છે. ગાંધીકાચ્યોમાં 'વારસ' થોડી વિલક્ષણ રચના છે. ગાંધી, નરસિંહ પોતાની શાતીમાં જન્મા એવું શાતિગૌરવ લેનાર શાતી જ આ મહાપાત્રોને માનવતાવાદી કૃત્યો માટે સામાજિક દંડ દેવાનું ચૂક્તી નથી, 'ગાંધી અને આંબેડકર' રચના બે ચારિત્રો વચ્ચેની

તુલના રજૂ કરે છે, પણ એમનાં કાર્યોનું ધ્યેય તો ‘માનવતા’ છે, ફક્ત માર્ગો જ જુદા છે.

આ સંગ્રહમાં સમકાળીન અને જીવંત બિજીઓ  
વિશે પણ કેટલીક રચનાઓ મળી આવે છે, આવો પ્રયોગ  
કવિ રમેશ પારેખના ‘ધ્યાતિમાં બારસાખ’ નામના  
કાવ્યસંગ્રહમાં પણ મળે છે. અહીં ‘કવિ હરીશ મંગલમુ’  
‘કવિ મનીષી જાની’, ‘કવિ દલપત ચૌહાણ’, ‘કવિ નિરવ  
પટેલ’ જેવી ચારિત્રલક્ષી રચનાઓ તે તે ચારિત્રની  
વ્યક્તિલાક્ષણિકતા રજૂ કરે છે. આ રચનાઓ સામાન્ય  
પ્રકારની છે. વાત તે તે ચારિત્રકવિઓનાં પુસ્તકોનાં  
શીર્ષકોથી પણ આજેઆઈ રચના સાંધી હોય એઠું  
શિખાઉ કવિકૃત્ય પ્રવીષ ગઢવીએ કેમ કર્યું હશે એવો પ્રશ્ન  
થાય છે. જુઓ એક નમૂનો :

જનપદની

## ‘तिराड’ सांघवा सतत

प्रयासी.

‘ચોકી’ રાખે

## ગોલાણાને પાદર,

દલિત અત્ય

ੴ ਸਤਿਗੁਰ

ન માત્ર

ଭୁକ୍ତିପ.

15

‘પ્રકૃતિ / સંસ્કૃતિ’ રચનામાં કવિ વિરોધાભાસી ગુજરાતી સાથે મઝીને સમીકરણો બાંધે છે.

## હિંસા પ્રકૃતિ અહિંસા સંસ્કરણ

## कोध प्रकृति शांति संस्कृति

‘રોટલો’ રચના પણ આવી, સમીકરણત્મક ટૂંકાં વાક્યોની રચના છે. ગાંધીયુગની એક રચનામાં શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે કે જગતમાં સૌથી મોટો પ્રશ્ન કયો ? ત્યારે હેઠળી પાટલી પર બેસેલો એક વિદ્યાર્થી જવાબ આપે છે –

સા'બ, સા'બ, પ્રશ્ન એક રોટલાનો મોટો છે.

- એની યાદ આવે છે. ‘બંને જોઈએ’ જેવી રચનામાં પડ્યા થોડી સામા છેડાની બે ચીજો મૂકી ‘બંને જોઈએ’ એવું કહી -

બેમાંથી કોઈ અનુભૂતિ નથી

અમ કેમ હવી હવી ?

- જેવો નાનકડો પણ વેદક પ્રશ્ન કવિ મૂકે છે.

સંગ્રહની લઘુરચનાઓ પણ વેધક પ્રશ્નો લઈને આવતી સરળ રચનાઓ છે. મોટા ભાગની આવી રચનાઓમાં કવિ વિરોધભાસા વસ્તુઓની સંનિધિ રચી વેધકતા સિદ્ધ કરવા મયે છે. ‘ઓઈલ પેઈન્ટ’, ‘દેવભૂમિ યાત્રા’, ‘ચીની દીવાલ’, ‘રહસ્ય’, ‘મશીનનો શો વાંક ?’, ‘ભહેચણ’, ‘વિજ્ઞાન’, ‘કાફી’ જેવી રચનાઓ આ સંદર્ભે જોવા જેવી છે.

‘અમે તો લૈ એવા...’ (પૃ. ૬૬, ૬૭) રચનાનું બોલયાલના લહેકવાળાં શીર્ષક જ કટાક્ષનો કાકું પ્રગટાવે છે. પ્રમાણમાં આ રચના સારી છે. સમાજમાં પ્રવર્તતા બેવડા ધોરણનું નિરૂપણ કરતી અર્થાત્ વાણી અને વર્તન વચ્ચેના ભેદને રજુ કરતી આ રચના વાચનક્ષમ છે.

અમો તો ભે એવા

બોલીએ કેં ને કરીએ કેં...

આવા ઉઘાડ સાથે સ્ત્રી, શૂદ્ર સાથેનું સમાજનું કેવું વિપરિત વર્તન છે એની વિગતો કવિ આપે છે. વિધવાને ગંગાસ્વરૂપ કહેવાની પણ એના શુક્રન નહીં લેવાના, સ્ત્રીસ્વરૂપા ‘મા શક્તિ’ની આરતી કરવાની પણ સ્ત્રીભૃગહત્યા કરવાની, સ્ત્રીને સરસ્વતી કહેવાની પણ એને ભણવા નહીં દેવાની, સ્ત્રીને સીતા કહેવાની પણ એને બેસવાની જગ્યા નહીં આપવાની, ‘અંદ સૌભાગ્યવતી’ કહેવાની પણ એની પાસે દાસીપણું કરાવવાનું, ‘વસુષીવ કુદ્રમ્ભકમ્’ કહેવાનું પણ શૂદ્રને ગામબહાર વસવાટ આપવાનો વગેરે.... અરે, બદ્ધ, કંબીરાહિ જેવા સર્થોના જન્મ પણી પણ -

“અમો તો ભે એવા

બોલીએ કેં ને કહીએ કેં...”

- કહી કવિએ વેધક કટાક્ષ કર્યો છે.

ઈશ્વર વિશેની રચનાઓમાં ‘શાંકાનો લાભ’ (પૃ. ૫), ‘આધાર’ (પૃ. ૫), ‘ઈશ્વરનું અસ્તિત્વ’ (પૃ. ૬૮), ‘ભગવાન’ (પૃ. ૭૨), ‘ભગવાન’ (પૃ. ૮૨), કવિનું બાળસહજ કૃતૂહલ નિરૂપાયું છે. ભગવાન વિશેની એક રચનામાં સૂચિમાંની વિચિત્રતા અને વિરોધાભાસ વિશેની અવઢવ રજૂ થઈ છે તો બીજી રચનામાં પૃથ્વી પરની માનવતાવાદી વિભૂતિઓમાં કવિ ભગવાનના અસ્તિત્વને જુઓ છે. પૃ. ૮૨ ઉપરની રચનામાં ભારતીય વિચારસરણી મુજબના ભગવાન પર સીધા કટાક્ષો કરે છે. યદ્ધને વિષય

કરતી રચનાઓ પણ અહીં છે. ‘યુદ્ધ’ (પૃ. ૮૦), ‘તારો ભાઈ જ તારો શત્રુ’ (પૃ. ૮૬) રચનાઓ માણસજીતની યુયુત્સાવૃત્તિ વ્યક્ત કરતી રચનાઓ છે. માણસને શાંતિ વગર ચાલ્યું છે, પણ યુદ્ધ વગર નહીં. જુઓ. –

ડાયનોસોરની જેમ સર્વનાશ પામશું  
ત્યાં સુધી  
યુદ્ધનો ઉન્માદ ભૂલીશું નહીં...  
બને રચનાઓ જીણવથી વાંચવા જેવી છે.

જ્યાં કશો અન્યાય કર્યો છે ત્યાં એનું દુષ્પરિણામ મળ્યું જ છે. ‘પરિણામ’ રચના આ વાત કરે છે –

એકલાયનું અંગુષ્ઠછેદન  
પરિણામ : કુષ્ણવધ

સંગ્રહની અન્ય રચનાઓ પણ લઘુકદમાં જન્મીને જગતમાં, ખાસ કરીને ભારતીય સમાજજીવનમાં પ્રવર્તતી વિષમતાઓને વ્યક્ત કરે છે. કવિ ‘મૂળ ઉપાય’ અને ‘ગર્વસે કહો’ જેવી રચનાઓમાં સમાજમાં, વિશ્વમાં શાંતિ કઈ રીતે પ્રગટે એના ઉપાયો બતાવે છે :

....રચનું હશે જો  
વસુધા કુદુમ્બ

ખુલ્લાં રાખવાં પડશે તમામ દ્વાર  
ધૂત-અધૂતનાં ઓગાળવાં પડશે રક્તાં...

બનવું હશે જો

વિશ્વમાનવ

રચનું હશે જો

વસુધા કુદુમ્બ

રચવા પડશે

એક સંસ્કાર

એક ધર્મ

કેવળ માનવધર્મ (પૃ. ૧૮-૧૯)

બિનદુલિત કવિ પ્રવીણ ગઢવીએ પીડાના જાતઅનુભવ કરતાં અન્યને થતી પીડાને આત્મસાત્ત કરી છે. એટલે કોઈ પીડિતમાં ગુરુસો કે ઘૃણા જન્મી શકે એના બદલે અહીં, આ કવિમાં, દાઝ જન્મી છે. સ્વાભાવિક રીતે જ આકોશ વ્યક્ત કરતી દ્વિતી કવિતા કરતાં પ્રવીણ ગઢવીની અહીંની કવિતામાં પીડકો પ્રત્યે આકોશ જન્મે એવું ખાસું છે. એટલે કહી શકાય કે પ્રવીણ ગઢવીની કવિતા આકોશની કવિતા નથી, પણ આકોશ પ્રેરતી કવિતા છે.

### સામા કંંઠાની વસ્તી : નવનીત જાની

વલૂર પ્રકાશન, ભાવનગર, ૨૦૧૦. કા. ૨૦૦, પૃ. ૧૫૦

### સંવેદનવિશેષોના ધ્યાનિગાર્ભ અર્થસંકેતો

ગુણવંત વ્યાસ

ગુણવંત

૨૦૧૨ જુન્નુંમાર્ગ ભાવનગર

નવનીત જાની ટૂંકીવાતક્ષેત્રે પ્રથમ ‘તિરાડનો અજવાસ’ ને પછી આ બીજા સંગ્રહથી ખાસું જાડીતું નામ બની ચૂક્યું છે. એમની વાર્તાઓ સામયિકોના માધ્યમથી રચિકો / સમીક્ષકો સુધી પહોંચી, આવકાર્ય લેખાઈ છે. સંગ્રહના નિવેદનમાં લેખક લખે છે ‘સામા કંંઠાની વસ્તી એટલે સામા પ્રવાહે તરનારી વસ્તી. જેઓ દ્વિલ અને દુનિયાનાં રૂઢ બંધનોને ખાસતે મારી માત્ર ને માત્ર માણસગીરી ઉપર ઊતરી આવે છે.’ લેખકને રસ છે માણસમાંના ‘વિશેષ’નો;

ને આથી જ એ ‘હાડ-ચામથી વિશેષ જે વસ છે એને વાર્તામાં ખંખોળવા’ મથે છે. એના પરિપાક રૂપે તેર વાર્તાઓ અહીં ઊતરી આવી છે. ‘વાત તો એટલી જ કે –’થી શરૂ થતી આ ખંખાખોળ તેરમી વાર્તા ‘સમાપ્ત’ આગળ પૂરી થાય છે; પણ પૂરી થાય છે ખરી ? – કે ભાવકના ચિત્તમાં ખળભળ મચાવતી રહે છે ? – જોઈએ.

સંગ્રહની કેટલીક વિશેષ નોંધપાત્ર વાર્તાઓમાં ‘વી. વી. (બ્રાન્ડ) ડબલ ટેસ્ટેડ (વિકટરી) (૨૮૦ ML)’,

‘હરિભાભાની એક દિવસની જિંદગી’, ‘સામા કંઠાની વસ્તી’, ‘અંતિમ છાયા’, ‘ટ્થાર ફૂટ્ટી રહી’, ‘અલગ’ આદિનો સમાવેશ થઈ શકે. ‘વી. વી. (બાન્ડ)...’ ગુજરાતી ટૂંકીવાર્તામાં નોઝી ભાત રચતા સબળ સર્જકર્મનું ઉદાહરણ છે. રેલવેસ્ટેશને સોડા વેચતા ધૂડાના જીવનની કરમકઠણાઈ છ અધ્યાયમાં, સૂચક ઉપશીર્ષક તળે સક્ષમ ભાષાવૈવિધ્યથી આલેખાઈ છે. ‘રબ્બરિયાં ચચ્ચલાં ઘસતો, ખૂલીને હસતો ધૂડો’ એના હાસ્યને જ નહીં, ખૂદની જાતને પણ ખોઈ બેસે એવું કરુણાગર્ભ કથાનક સંયત સૂરે રજૂ થયું છે. સોડા વેચતો ધૂડો સોડામશીન બરીદવાનું સાહસ ખેડી બેસતાં ઘરમાં રેનક પથરાય છે, પણ આજુબાજુની દુકાને રંગ-બેરંગી પેખ્ખી-થમ્સઅપ-કોકાલાનું આગમન થતાં એ રેનકને જાંખપ લાગવી શરૂ થાય છે. ‘મૌકા-એ-વારદાત ઉફ્ફ કડચી-ચોખી-નવતર’ બની રહ્યાના, ને ‘પીઠ ફાલેલું ખરજું બહુ મથવા છતાંય કાબૂમાં નહોલું આવતું.’-ના સંકેતથી ધૂડાના ચડાવ-ઉતારનો આલેખ ધૂડો હરજી કોણી ઉફ્ફ ધૂડાલાલ ઉફ્ફ ધૂડાજી ઉફ્ફ માયકાંગલો ઉફ્ફ ઠોક્કોથી સૂચવાય છે. આર્થિક રીતે સજજ થતો જતો ધૂડો પુનઃ અવદશામાં અટવાતો જે રીતે રજૂ થાય છે એમાં લેખકની સર્જકતા ચાલ્ખુષ થતી રહે છે. ભવાઈનો વેશ તેને વળ ચડાવે છે : રંગલીને સોડા પાવા વિદૂષક બૂમ પાડે : ‘એ ધૂડાલાલ...’ ને ધૂડાના પેટમાં ગલગલિયાં ! ‘આટલા બધા મા’ણા વચાળે ભવાયાએ આપડું નામ પોકાર્યું !’ પણ રંગલીનું ‘અહું, વિદૂષકને ‘દિલ માંગો કુછ ઓર – ફેફસી’-ની દિશામાં વઈ જતાં ધૂડાલાલની જગ્યાએ રંગલાને મોઢે ‘ઉત્તમલાલ’નું નામ ગવાવા લાગે ત્યારે લેખક નોંધે : ‘ઓળખીતાં નામો નીચે કચડાતા પોતાના નામને ધૂડો જોઈ રહ્યો.’ ધૂડાના વિનિપાતને વાર્તાકારે કથાનકલાથી પ્રત્યક્ષ કરાવ્યો છે. ધૂડાના મૂળ કથાનક સાચે પ્રારંભે તેમ અંતે ગરુડ-વિષ્ણુ-સંવાદનું જે સાયુજ્ય રચાયું છે તે અનોખી તાજગીનો અનુભવ કરાવતું રચનાકર્મ બની રહે છે. ને તેમાંય અંતના ‘તા. ક.’ વાતાને સંદર્ભે નવા સંકેતો વિચારવા પ્રેરે છે : ‘સુજ્ઞજનોને એ કહેવાની ભાંયે જરૂર પડે કે આ વાર્તા બે પક્ષીઓ વિશેની છે. એક પક્ષી ‘હોલું’ છે. બીજું પક્ષી ‘ગરુડ’ છે. હોલા પાસે ઉડતી

ભીનાશ ને તગતગતી લગટી છે. ગરુડ પાસે અનાદિકાળથી જેનું સ્તુતિગ્યાન કરતાં દેવ-મનુજની જિધવાગે તૃષ્ણાનું વીપુલ નથી બાજુંયું એવા મંગલમ્ર – ભગવાન વિષ્ણુ...’ – વળવેમનસ્ય, યંત્રયુગની વિડંબના અને માર્કેટ કલ્યર સામે જીજુમતા પુરુષાર્થની પંગુતા આ વાર્તાનો ધનિ બની શકે તેવા કથાનકમાં સશક્ત તળભાષા સાચે દેવભાષા, લોકભાષા અને અંગ્રેજી ભળતાં સોનામાં સુંગધનો અનુભવ થાય છે.

‘હરિભાભાની એક દિવસની જિંદગી’ તળગામના વૃદ્ધમાનસની પારિવારિક ચિંતાનો લાગણીછલકતો આલેખ છે. યુવાન દીકરાની વ્યવસાયવિષયક અને પુખ્ત દીકરાની લગ્નવિષયક જવાબદારી – પોલીસાખાતામાંથી વફાદારીનું ઠનામ મેળવીને નિવૃત્ત થયેલા – હરિભાભાની ચિંતાનો વિષય છે. અગવડો વર્ચ્યે આશાનો તંતુ જીવતો રાખતા હરિભાભાની મનોસ્થિતિ ચિત્તભાનો અહેસાસ કરાવે છે. રેલવેસ્ટેશનનું, વાસ્તવિકતાથી ખીચોખીચ જગત અને ડેડમાસ્ટર એવા મોટા દીકરાની ‘સ્વ’-કેન્દ્રી હિતચિંતા તેમાં રંગ પૂરે છે. પાણીની તરસ અહીં પાણી પૂરતી કંધાં સીમિત રહી છે ! સુકાતા જાડને પાણી સીચવાનો જાણો કોઈ અર્થ જ નથી ! – હરિભાભા આ કંધાં જાણો છે ! સાદા માશસનું, નૈતિકતાના તાણવાણાથી વશાતું-ચુંથાતું સાચું મનોગત લાંબીટૂંકી વાર્તાનું નિમિત્ત બન્યું છે. તરલ અને જીવંત દશયાંકનોથી ગામડું પ્રત્યક્ષ થયું છે.

ગરીબી ને ભૂખમરામાં યે જીવતું-જાગતું ગામડું ‘સામા કંઠાની વસ્તી’નાં પાત્રોથી પ્રત્યક્ષ થાય છે. બુધીરામ, માધો, ભીખુ, દલિયો, નારસંગ આદિનું ભાવવિશ તપાસો. થાળામાં વખત સુકાઈ જાય એવી દુષ્કાળની સ્થિતિમાંથે પરિસ્થિતિનો સામનો કરતાં આ પાત્રોની જિજ્ઞાસા ને એ માટેની રોજગારીની ભૂખ જે પ્રકારે અહીં આલેખાઈ છે એ વાર્તાનું વિત્ત બની રહી છે. આરંભથી અંત સુધી આવતા તરસી, કોરી, કંઠો તુટેલી બૂંબલીના સંદર્ભો વાર્તાના ભાવજગતને પોષક બન્યા છે. પાત્રોની તળ બોલીની ખારાશમાં પ્રગટતી મીઠાશ આત્મીયતાની સૂચક છે. હાડપિંજર થવાના સામાને ઠેલતાં હોર જ નહીં, માનવસમૂહ પણ પાણીને બદલે લૂના ધૂંટા ભરીને જીવી રહ્યો છે. એવા સમયે, ગામને જોડતી સડકનું

કામ શરૂ થતાં ગ્રામમાં ખુશીનો જે જુવાળ આવે છે તે જુઓ : ‘બધાના મોઢે રાજ્યપાની તડકી ચમકતી હતી.... આજુભાજુ આવળ-બાવળનાં ફૂલ હસતાં હતાં... મનેખનું પૂર આવ્યું હતું... નિકમ-પાવડા તો ખાડતા ખાડે, તગારાનો તોર તો કંઈક જુદો જ હતો... ખોઢવવરીએ બધા આગળ હસવાનાં પતરાળાં પાથર્યા... બધાનાં મોગમાં આજે દાંત ફૂટવા હતા !’ – જ્યાં ‘કોઈ સૂકા દેવે પોતાના ચારેય હાથ આ ધરતી પર નવરા કર્યા’ હોય ત્યાં, કામ મળો એ આશાનું કિરણ રોનક ફેલાવી જાય છે; પણ ધત્રયુગના પ્રતીકસમું રાખસી મશીન શ્રમજીવીઓની રોજગારી પરનો પ્રહાર બની વિઘાતક અસર વર્તાવે છે. ત્યારે, ફરી ‘વી. વી. (બ્રાન્ડ)...’નો ધૂડો ને તેની અવદશાનાં નિમિત્તો સ્મૃતિ પર તરવરવા લાગે છે. સત્ય એ છે કે, ‘ધમણ માથે વીયાયેલી બિલારીને ક્યાંથી ખબર હોય કે ધમણ વાસી હવા વધારે હિ’ નો હંદરે.’ નંદવાયેલી છોચકીમાંથી તરસ છીપાવનારું જળ નહીં, ધૂળ-તણખલાં જ ખરે એ ખરું વાસ્તવ. કારુષ્યને હળવાશથી પ્રયોજવાની સર્જકની આવડત અહીં વાર્તાનો વિશેષ બને છે.

‘અંતિમ છાયા’ વૃદ્ધદંપતીની મનોવેદનાને આવેબે છે. બધી મૂડી ખર્ચને દીકરાને અમેરિકા સ્થાવી કરેલો. પોતાના એકમાત્ર આધારરૂપ આ પુત્ર વર્લ્ડ ટ્રેડ સેન્ટરની કારમી ઘટનામાં મૃત્યુ પામ્યો છે. એ હકીકત ડોસો-ડોસી બંને જાણતાં હોવા છતાં એકબીજાંથી અજાણ બની પુત્રના મૃત્યુની વાતને છુપાવવા જે મથામણ આદરે છે એમાંથી વાર્તા નીપળ છે. ‘અનાસક્રિયોગ’ તરફ વળવા માગતા દંપતીનો આસક્રિયોગ એમના કિયા-કલાપોથી સતત બ્યક્ત થતો રહે છે. ડેડ એલિઝન, ૧૨મી સાએ.નું છાપું કે બારીએ આવતું કબૂતર કલ્યન બની શકે તેટલાં સક્ષમ છે. ચિત્તભમની સ્થિતિએ પહોંચેલાં ડોશીની મનોદશાની સામે સ્થિતપ્રભનો આભાસ ઊભો કરવા માગતા ડોસાની મનોવ્યથા વેધકતાથી આવેખાઈ છે. તો, છતે દીકરે ‘ધરડાંખ એકલાં’ વૃદ્ધ દંપતીનું બીજું ચિત્ર ‘તળ’ વાતર્માંથી મળે છે. ‘સેઝ’ને નિમિત્તે બાપાને જમીન વેચી દેવા સમજાવવા શહેરથી દીકરો આવ્યો છે. પણ ‘કણબીનું છોરું કટકો જમીન પર કદી ભૂખ્યું નો’રે’માં દફ્ફાણે માનતા ડોસા જમીન નહીં વેચવાના મતના છે. એતીમાં નહીં નભે

તો બેઉ મા’ણા શેઢે ખાડો ખોઈ જવતા સમાધિ’ લઈશું – એવી મક્કમતાવાળા ડોસા ભાજી ગયા છે કે – ‘દીકરાની ભીડ પોતાના ખેતરમાં ક્યાંક છીદું શોધી રહી છે.’ ફીલા પડતા ડોસાને ડોસીદ્વિમત બજે છે : ‘સવારે ઘસીનેના પાડી ધો. ભલે હાલતીનો થાય.’ પણ ડોસામાં, સેઝ નિમિત્તે જમીન ઝૂંટવાઈ જવાનો બય દીકરાએ ઘાલી દીધો છે. જમીન સાથેનો સંબંધ સ્મૃતિ-સાહચર્યથી જવતો થતો રહે છે. પણ અંતે, ‘મને વળી પેટના જણાથી વધુ લાડ કેવાં ?’ - નો સમાધાનકારી માર્ગ શોધતા ડોસા દીકરાના હિત ખાતર રસ્તો ખોળી કાઢે છે : ‘જા, તું તારે ગાડારસ્તે વિમાનો ઉતારજે.’ - ત્યારે આશર્ય અને અહોભાવથી છલકતો દીકરો ઉપકાર કરવા તત્પર થાય છે, પણ ડોસાને એની ક્યાં પડી છે ! લેખકે ભાષા પાસે સારું કામ લીધું છે. કહેવાનું નહીં કહીને ઘણું સૂચવી દીધું છે.

‘વસ્તુસ્થિતિ’ વાર્તાનાં પાત્રોની ભાષા ચિંતા, થાક, હતાશા ને નિષ્ફળતાને અંતે ચીડ, નફરત, રોષ ને નિતરસ્કારયુક્ત બનતી પરિવારના પોતાના સાથે પારકાની જેમ વર્તાવું કરતી જણાય તેનું એકમાત્ર કારણ ઉમર વઠવી ગયેલી પુત્રી (નાયિકા)નું ક્યાંય ન ગોઈવાવું છે. ‘કંટાળાનો કમોસમી વરસાદ’ ઘર આખામાં વરસતો રહે છે સતત – કોઈની હાજરીમાં પણ ! પૂત્રા જેવા પણ્ણ સામે વાઘણ જેવી માના લોહીઉકણા દીકરીને ઠેકાણે પાડવાની ચિંતાને કારણે છે : ‘કેવેન્ડરનાં પાનાં જેવા’ નાયિકાના દિવસો છેલ્લાં દસેક વર્ષથી તો યાંત્રિકતાથી છોળાઈ રહ્યા છે, નિરસ એવા ‘જોવા’ આવતા ‘નરોત્મો’ સામે ! અંતે, કોઈ મુરતિયાની ‘હા’થી પરિવારને હશકારો થાય એવે સમે નાયિકાની મક્કમ એવી ‘ના’ નવી દિશાની અંગળી આલે છે. નાયિકાનો ‘સ્વતંત્ર એવો અંતિમ નિર્ણય પારિવારિક તંગદિલી વિશે થોડું સૂચવી જાણું વિચારવાનો પૂરો અવકાશ આપે છે. સંકુલ કથાનકમાં વીટળાઈને આવતા કથનાત્મક ગદ્યની સંકેતિકતા ય ઘણું સૂચવી આપે છે.

દલિત સંવેદનની બે વાર્તાઓમાંની એક, ‘અલગ’માં દલિત યુવતીને પરણતા બ્રાહ્મણ યુવક સાથેનો ઘરના સભ્યોનો અધ્યૂત્ત્વબહાર યુવકના તુટ્ટા ભાવસંબંધની વેદનાને સર્જકીય સ્પર્શ આપે છે. તો, બીજી ‘દાણાપાણી’માં બેન્ડવાળાંના આગમને ડોલીના ફોલ ફીલા

પડ્યાની જાણીતી વેદના જાણીતી રીતે વાર્તા રૂપે રજૂ થઈ છે. ‘અખેપાતર એવાં કળ’ પણ કલાકાર એવા બીજલ હોલીને કોરાણે મેલી બેન્ડવાળાંને રવાડે ચેતે ત્યારે ‘કઠણાઈની કાબરને ઓધાન ર્યાનો ભાવ જન્મે. જ્ઞાપુની આખી બોલી ભાષાની સામે બીજલની દ્યામણી વાળીનો વરતારો ધીમેધીમે અંત તરફ દોરી જાય ને પ્રારંભે સંકેતાવેલું, અંતે થવાનું જ થાય. બીડીનો રાતો તિખારો ચણોઠીની જેમ અધરાતે વલવલતો રહે. માવતર સમા ‘કળ’ પાહેંથી ‘ત્રણ ટકાના હોલી’ને ‘ઠ્રણાવેડા’ જેવા શબ્દોની ‘વધામજીથી’ બીજલનો જીવ ‘હોલાવા’ લાગે. ને ‘દેલી બહારનું અધારું વાટે ઊભું’ જ્ઞાપાય. ‘કળ’ને લીધી ‘રોટલો રણી’ ખાતા બીજલને ‘દાણાપાણી’ના ફાંઝા પડે એવી વસ્તુનું ગુંફન જ વાર્તાનું વાતાવરણ રચી આપે છે.

‘વાત તો એટલી જ કે –’ એ વાર્તા ભાગતરભૂયા બાળમજૂરની અતૃપ્ત જંખનાની કરુણતા આદેખે છે. ચાની

કીટલીએ જુદાંજુદાં નામોથી સંબોધાતા બાળનાયકની બાધ્ય તેમ આંતરિક કિયા-પ્રતિકિયાની છબિ ભાવકચિત્ત પર લિલાતી રહે છે. યુનિવર્સિટી સામેની ચાની કીટલીના બાળમજૂર ટેણીની, કચરાપેટીમાંથી મળેલી ફેમ વિનાની સ્લેટ પર અક્ષર પાડવાની – ભાષાવાની તાલાવેલી સામે સંવેદનશૂન્ય વિશ્વ મૂકી આપી, ટેણીની ઠીંગરાતી ઠચ્છાઓને લેખકે સાંકેતિક રીતે ઉઠાવ આપ્યો છે. અંતમાં એ સ્લેટ પર સૂચિત ચા-કોઝીના ભાવ ટેણીના જીવનની સ્થગિતતાનું સૂચન બની રહે છે.

મોટા ભાગની વાર્તામાંથી કથનશૈલીનાં, બોલીવિશેષ / વર્ણનવિશેષ અનેક દણ્ણાંતો મળી આવે. ભાતીગળ તળને તાકતી ને માનવમનને તાગતી વાર્તાઓમાં ઊપસતો ગ્રામપરિવેશ ચૈતન્યભર જીવનના ખાતીપાને પણ ચીંધી આપે છે. ધનિગર્ભ અર્થસંકેતોવાળી આ વાર્તાઓ લાંબા કણ સુધી ટકનારા સર્જકબળથી લખાઈ છે એવું મારું માનવું છે; તમારું ?? □

## આ લે, વાર્તા ! : ગુણવંત વ્યાસ

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, ૨૦૧૧. ૩. ૧૫૨, રૂ. ૧૨૦

## વ્યંજક અર્થવ્યાપ સિદ્ધ થયો છે

ઇલા નાયક

સાહિત્યનો માત્ર કલા તરીકે અભ્યાસ શક્ય નથી કેમકે સાહિત્ય વાસ્તવિક સૃષ્ટિથી મિન હોવા છતાં તે જીવનથી અવિચિન્ન છે. સમાજના વ્યવહારોનું નિયંત્રણ અનેક પ્રકારની વિચારધારાઓ અને અન્ય સાંપ્રત પરિબળો દ્વારા થતું હોય છે. આ દસ્તિએ નારીસ્વાતંત્ર્ય, દાખિતસંવેદન, બદલાતો જતો ગ્રામસમાજ, પરિવર્તિત થતું જીવન અને મૂલ્યો, વિજાળુ દશ્ય-શ્રાવ્ય માધ્યમોની મનુષ્યજીવન પર થતી અસર વગેરે આ સંગ્રહની રચનાઓમાં પ્રતિબિંબિત થયાં છે પણ તે વાર્તાકલાની શરતે.

‘આ, લે વાર્તા’ કહીને ગુણવંત વ્યાસે આપણા હાથમાં અફાર વાર્તાઓ ધરી દીધી છે. એમાંથી બાર જેટલી

વાસ્તવમાંથી એક કલાત્મક વૈકલ્પિક વિશ્વ સર્જતી કૃતિઓ આપીને તેમણે સાંપ્રત વાર્તાકારોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. વાર્તાકારને રસાનંદ સંપડાવવાની સાથે જ કંઈક કહેવું પણ છે તેથી એમાંથી જીવન વિશેનું ચિંતન ધનિત થતું રહે છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ મનોવાસ્તવકેન્દ્રિત હોઈ ઉચિત રીતે જ પ્રથમ પુરુષકથન કેન્દ્રનો પ્રયોગ ઘણી કૃતિઓમાં જોવા મળે છે. આ સાથે અહીં ગીજો પુરુષકથન કેન્દ્ર, કથન, વર્ણન, સન્જિધીકરણ જેવી રચનાપ્રયુક્તિઓ પણ ચોજાઈ છે.

સંગ્રહની ‘હીંચકો’ વાર્તા એક નોંધપાત્ર રચના છે. વાર્તાનો નાયક ઓફિસેથી જતાં આવતાં કોસિંગ આગળ

સાહિત્ય

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ ૧૫

ଓભા રહેતાં ઈશાન ખૂણાના ફ્લેટના બીજા માળની બાલકનીમાં હીંચકા પર હીંચકતા એક દંપતીને રોજ જુઓ છે. આટલી અમથી ઘટના આ વાર્તાનું નિમિત્ત બને છે. હીંચકે જૂલતાં દંપતીને જોવાનું નાયકને વળગણ થઈ ગયું હતું. એક દિવસ તેને બાલકનીમાં જૂલો કે જૂલનાર કોઈ દેખાતું નથી પણ જોવા મળે છે “House on rent”નું પાટિયું. જૂલાનું દશ્ય વિલીન થઈ જતાં નાયક ઢીલોફસ થઈ ઘરે જાય છે તો તે પુત્રીની ડ્રોઝેંગબુકમાં આકાર વેતો હીંચકો જુઓ છે અને તે વિચારે છે કે આવતા મહિને મળનાર ઈજાઝમાંથી તે રાશ્મિને જૂલો અપાવશે, એટલામાં જ પત્નીના નાયકના હાથમાં મકાનવેરાનો પત્ર આપે છે ત્યારે તે બોલી ઉઠે છે : “થઈ રહેશે. આવતા મહિને ઈજાઝો છૂટે જ છે ને ??” અહીં મધ્યમ વર્ગના માનવીના જીવનની વાસ્તવિકતા અસરકારક રીતે વંજિત થઈ છે. રોજ નોકરીએ જરૂર, કોસિંગ આગળ ઊભા રહેતું, પત્નીએ આપેલી ઘરની ચીજોની વાદીનું સ્મરણ કરવું અને આ બધાં વચ્ચે હીંચકે જૂલતા દંપતીનું મનોરમ્ય દશ્ય નાયકના મનઃસંચલનો રૂપે જ નિરૂપાયું છે. નાયકની રોજબરોજની એકવિધ જિંડગીમાં હીંચકે જૂલતા દંપતીનું દશ્ય અવનવી કલ્પનાના રંગ પૂરે છે. જૂલે જૂલતા દંપતીમાં તે પોતાને અને પત્નીને જુઓ છે અને રોમરોમ મલકી રહે છે. નાયકચિત્તમાં આ દંપતીનું અવિરત જૂલતું ચિત્ર એવું તો અંકાઈ ગયું કે તે મનોમન કહે છે : “સનાતન જૂલતા જૂલાએ મને ડોલાવી દીધો. એના જૂલવાથી જાણે ચૈતન્ય જૂલી રહ્યું છે. એના જૂલવા સાથે ઉત્તર દક્ષિણા બે ધૂવો જોડાઈ રહ્યા છે...” આ હીંચકાના દશ્યની સંનિધિમાં ટ્રેનમાં રડતા બાળકને શાંત કરવા બાંધેલા હીંચકાનું ચિત્ર મુકાયું છે. આ બે દશ્યોનું સંનિધીકરણ વાસ્તવ, કલ્પના અને વાસ્તવ એવી વિશિષ્ટ ભાત રચે છે અને હીંચકાનું પ્રતીક અનેક અર્થવર્તુલો રચે છે.

‘ચહેરાનું ઘરેણું’ વાર્તામાં પુરુષની મર્દનગીની ઓળખ એની મૂછ જ છે એવી પારંપારિક માન્યતાને હળવી ચાલે વાર્તારૂપ આપ્યું છે. ઉંમર વધતાં માથાના વાળને તો કાળા કરી શકાય પણ મૂછમાં દેખાતા ધોળા વાળ નાયકને ગૂંજે છે. તે મૂછ કાઢી નાખવાનો વિચાર કરે છે પણ એ માટે પત્નીનો સખ્ત વિરોધ હતો. પત્ની દાઢા, વડાઢા, શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ, કાઠિયાવાડી

બહારવટિયા વગેરેનું શૌર્ય મૂછમાં જ હતું એવું ભારપૂર્વક કહે છે. વધતી ઉમરનો હંદેરો પીટીલી, ન ગમતી સફેદીથી શોભતી મૂછ નાયકને ‘કાકા’નું સંબોધન આપે છે પણ ઓફિસમાં ‘સિનિયર’ની પદવી આપાવે છે ! નાયકને દિલ્હી ટ્રેનિંગમાં મોકલવામાં આવે છે ત્યાં હોટલમાં મૂછના વિચારમાં ને વિચારમાં હોઠ પર રેઝર ફરતું રહે છે અને બેઝીનમાં વેરવિભેર પડેલી મૂછમાં તેને બાપાનો પીંખાવેલો કાબરચીતરો ચહેરો તથા પત્નીનું સોગિયું મોં દેખાય છે. વાર્તાના આ ચિત્રાત્મક અંતની વંજના હાસ્ય પ્રેરે છે. આ વાર્તામાં વધતી ઉમરને ઢાકવાની મથામણ કરતા નાયકનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ થયું છે.

અહીં પ્રોફેના મનોગતને વાચા આપતી અન્ય બે વાર્તાઓ પણ રસપ્રદ છે તે ‘પડછાયાની પળો’ અને ‘પ્રતીક્ષા.’ ‘પડછાયાની પળો’ વાર્તામાં મનહરલાલ ટી.વી.ના સમય પ્રમાણે ઘરની ઘડિયાળોના કાંચા ફેરવ્યા કરે છે. જુદો જુદો સમય દર્શાવતી ઘડિયાળોને લીધે તેઓ સમય વિશે સાશંક રહ્યા કરે છે. સમયની આવી અતંત્રતાથી તેઓ અકળાય છે. તેમને દેશ આખાની ઘડિયાળોને એકટાઈએ કરી આવવાનું જનૂન ચેતે છે. બીજી જ કષેત્રે તેઓ શાંત થાય છે. સમયના વળગણથી મુક્ત થવા તેઓ ઘરની બહાર નીકળી જાય છે, પણ તેઓ પાછા ફરે છે અને ટી.વી. ચાલુ કરે છે. ટી.વી.ના એક ખૂણે ડિઝિટલ અંકો ૧૧:૦૪નો સમય બતાવતા હતા અને તેમાંથી સહસ્ર લોલકઘડી તરફ જોવાઈ જાય છે. લોલક બંધ હતું ! અહીં ઘડિયાળનો પ્રતીક તરીકેનો પ્રયોગ જગતની પરિવર્તનશીલતા સૂચિત કરે છે. સમયાંયિતવન સાથે આ વાર્તા નિવૃત્ત માનવીની મનઃસ્થિતિનો નિર્દેશ પણ કરે છે. કશું જ કરવાનું ન હોવાથી મનહરલાલને સમય વળ્યે છે !

આ સંગ્રહમાં દખિત સંવેદનાને વ્યક્ત કરતી ત્રણ વાર્તાઓ છે : ‘વિકલ્ય’, ‘કેવટદર્શન’ અને ‘જાકળભીનું સવાર.’ આ ત્રણ વાર્તાઓની સંવેદનતરાહો અને મુદ્રાઓ જુદી જુદી છે. ‘વિકલ્ય’ વાર્તામાં એક દખિત યુવાનના આત્મસંમાનને વાર્તારૂપ મળ્યું છે. ગામની પ્રાથમિક શાળામાં નિયુક્તિ થતાં દખિત યુવક બાધર આચારને મળવા જાય છે, ત્યારે તેમની પંડ્યા અટક વાંચીને પ્રથમ તો તે અટકી જાય છે, પણ પછી આત્મવિશ્વાસ મેળવી

સાંકળ ખખડાવે છે. પંડ્યાસાહેબ “જે હોય તે, અંદર ચાલ્યા આવો” એમ કહે છે. આમ બાધર અને પંડ્યાસાહેબની મુલાકાતથી વાર્તા ખૂલતી જાય છે. પંડ્યાસાહેબનાં વાક્યો અને બાધરની કિયા-પ્રતિકિયાથી બંનેનાં વ્યક્તિત્વ પ્રગટ થતાં રહે છે. પોતે પીઠ બાબણ આચાર્યના પૂજાના ઓરડા સુધી પહોંચે છે તેથી બાધર માઝી મારે છે ત્યારે પંડ્યાસાહેબ તેને ‘પરમારસાહેબ’ શાબ્દોથી સંબોધે છે. પોતાની આવી ઓળખ બાધરને અજાણી લાગે છે. અનુભવોથી પીઠ થયેલા પંડ્યાસાહેબનો તેને પરિચય થતો જાય છે. તેઓ પોતે આભડછેમાં માનતા નથી એમ કહી સલાહ આપે છે : “પણ દુનિયા આ નહીં સમજે. આથી જીવવાના જોગડા કરી લેવા સારા” (પૃ. ૪૮) આ પછી ગોરાણી આવતાં તેમણે બાધરની ઓળખ આપતાં કહું કે, “લક્ષ્મી, આ આપણી નિશાળમાં આવેલા નવા માસ્તરસાહેબ બહાદુરસિંહજી.” આ સાંભળી બાધર મૂઢ થઈ જાય છે. ગોરાણીના માતૃભાવથી તે જિત્યાય છે પણ રાતે તેને ઊંઘ આવતી નથી. મૌરપિચ્છ ખોસીને ફરતા કાગડાની અવદશા અને સિંહનું ચામડું ઓઢીને ફરતા ગર્દનનો અંજામ તેને યાદ આવે છે. ખૂબ મનોમંથન પછી તે સવારે પોતાનો સામાન લઈને ઓસરીનાં પગથિયાં ઊતરી સ્વજનોનાં ઝૂપડાં તરફ ચાલવા માંડે છે ત્યારે તેને પંડ્યાસાહેબનો “નાશો મોહં...” શ્લોક સંભળ્યાય છે અને કથક લખે છે : “ઉગમણે સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું હતું” પંડ્યાસાહેબનો શ્લોક અને અંતનું વિધાન દલિતોના ભાવિની વંજના કરે છે. અહીં બાધરના સ્વમાનનો ઉચિત પણ્ણેક્ષ્ય રચી સહેજ પણ બોલકા થયા વિના વાર્તાકારે ઇસ્થિતને પ્રગટાવ્યું છે.

‘કેવટદર્શન’ વાર્તામાં મૃત હોરને ચીરિને ચામડું, માંસ વગેરે છૂદું પાડતા દલિતોના ચિત્ર સામે ડોક્ટરી ભાષાતો કથાનાયક માનવશબનું ડિસેક્શન જુએ છે એ ચિત્ર મૂડીને વાર્તાકારે દલિત અને ડોક્ટરને સમાન સ્તરે મૂડી આયા છે. શબનું ડિસેક્શન જોતાં કથાનાયકની આંખો ભગરીનું ડિસ્ફિંગરમેન્ટ કરતા સોમલાને જ જોતી હતી. બપોરે તે મેસ પર ખાવા ન જતાં એમ જ બેસી રહે છે. તેને દુલાકાગની ભજનની પંક્તિઓ હવે વધુ સારી રીતે સમજાય છે :

“નાઈની કદી નાઈ લે નહીં આપણે ધંધા ભાઈજા...  
કાગ, લે નહીં ખારવાની ખારવો ઉત્તરાઈ..  
પગ મને ધોવા ધો રધુરાયજી...”

પ્રાપ્તકર્મ કરવામાં હલકું કે ઊંઘું એવો ભેદ હોઈ શકે નહીં એવો ધ્વનિ જગાડતી આ વાર્તા દલિતોને થતા અન્યાય તરફ ઈંગિત કરે છે.

‘આકળભીનું સવાર’ વાર્તામાં પણ આભડછેટની જ વાત છે. અહીં અજાણતાં જ બાબણને સ્પર્શી જતાં ગાળો અને મારથી અપમાનિત થતા મોતીના જીવનની કથા છે. નવપરિણિત મોતી અને એની વહુ મસ્તીમાં વાડીએથી પાછા વળતાં, જાજ્ઞુ કરવા બેઠેલા રામશંકરને અથડાઈ જાય છે અને રામશંકર તેને ગંધી ગાળો બોલતો, મારતો ઢસીને લઈ જાય છે. આ ઘટના પછી મોતી બીજે જ દિવસે ગામ છોરી અમદાવાદ જતો રહે છે અને અહીં તે કાપડના વેપારમાં ખૂબ ક્રમાઈને મોતીરોઠ બની જાય છે. તેને વતન યાદ આવે છે પણ પેલું અપમાન ભૂલાતું નથી. તે અપમાનનો બદલો જુદી જ રીતે લે છે. ગામનાં વિકાસકાર્યો જેવાં કે પંચાયતને નવું મકાન, શાળાના ઓરડા, રસ્તા-લાઈટોની સુવિધા વગેરેમાં મદદ કરે છે અને સહુ એને ‘મોતીભાઈનું સન્માન આપે છે. ગામમાં હેન્ડપર્મ્ય મૂકવાનો હોય છે ત્યારે સહુને મોતીભાઈ યાદ આવે છે. સહુને મોતીભાઈ માટે માન થાય છે પણ સવણોનું દલિતો તરફનું વલાણ બદલાતું નથી એ નિરૂપવા વાર્તાનો થોડો પ્રસ્તાર થયો છે. મોતી પોતાના દીકરાના લગ્નનું આમંત્રણ સહુને આપે છે. બધાંને લગ્નમાં જવું છે પણ એકબીજાથી નજર ચોરે છે અને કોઈ ને કોઈ કારણ આગળ ધરી બધાં લગ્નમાં જાય છે. મોતી આથી સંતોષ પામે છે. આ વાર્તામાં દલિતો તરફના અન્યાયની વાત તો છે જ પણ જાથે માનવસ્વભાવની લાક્ષણિકતાનું વાસ્તવિક ચિત્ર પણ મળે છે.

‘બૂટ’ વાર્તામાં પુત્રે આપેલા નવા બૂટની આસપાસ મૂળજીનું સંવેદન વણાયું છે. અભાવમાં જીવતા મૂળજી માટે દીકરો શહેરમાંથી બૂટ લાવ્યો છે. નવા બૂટનો આનંદ અને ઉતેજના વાર્તામાં અસરકારક રીતે ઉપસ્થાં છે. નવા બૂટ બગડી ન જાય એની કાળજી, બુધવારે બધું બેવડાય એમ માની બૂટ બુધવારે જ પહેરવાનો નિર્ણય, બૂટ પહેરતાં પહેલાં પગ ઘરી-ઘરીને ધોવા, નવા વર્ષે નવા બૂટ પહેરીને

ગમમાં નીકળવાની તાલાવેલી, પોતાના બૂટ જોઈ સહુ તેની દર્શા કરશે એવી એની કલ્યાણ - વગેરે મૂળજીના નાના નાના વર્તન અને વિચારોમાં પાત્રમાનસ આબાદ ઉપસાધું છે. મૂળજીનું આવું વર્તન ભાવકને રમૂજ પેરે પણ “આવું જ થાય” એવો ભાવ પણ જાગે. પોતાના નવા બૂટ કોઈ જુએ, પ્રશંસા કરે એવું જંખતા મૂળજીના નવા બૂટની કોઈએ નોંધ પણ ન લીધી રેથી એનો ઉત્સાહ શરીરી જાય છે. વિચારમાં ને વિચારમાં ઘરે પાછા ફરતાં તેનો પગ છાણના પોઢળા પર જઈ પડે છે અને તેનું મન ખાંદું થઈ જાય છે. એ ઘરે પહોંચે છે ને એને જાણ થાય છે કે વાલજીને સર્પે ઉંખ દીધો છે ત્યારે એ બૂટને ફંગોળીને મિત્રના ઘરમાં જાય છે. મિત્રને સર્પદંશ થતાં વાલજીનો નવા બૂટ માટેનો ઉત્તરી જતો મોહ બૂટને પ્રતીકસ્તરે મૂકી આપે છે. વાલજીનું મનોગત ઝીણવટબર્યું અને વાસ્તવિક છે.

‘સથવારો’ વાર્તામાં “અંડ સૌભાગ્યવતી”ના આશીર્વાદ પ્રાપ્ત કરીને ગુંગળાતી ગંગાના મનોભાવને પ્રગટ કર્યો છે. “અંડ સૌભાગ્યવતી”નો આશીર્વાદ સાચો પડે તો પોતાના મૃત્યુ પણ પતિનું કોણ એવી ચિંતા તેને દુઃખી કરે છે. સૌભાગ્યને અંડિત રાખીને પાછળી જિંદગીમાં પતિ એકલો પડે એવો આશીર્વાદ એને મંજૂર નથી, “અંડ સૌભાગ્યવતી”ના આશીર્વાદને અહીં નવું જ પરિમાણ સાંપડ્યું છે. એ દ્વારા ગંગાનો પતિ માટેનો પ્રેમ વ્યંજિત કર્યો છે.

‘ઉપરવાળો’ વાર્તામાં ‘ઉપરવાળો’ શબ્દના તિર્યક્ક પ્રયોગથી વાર્તાકારે ઉપરવાળાની લીલા લીલયા વ્યક્ત કરી છે. પુત્ર લીધેલું નવું મકાન ફ્લેટ છે એવું જાણે છે ત્યારે માલજીભાઈ નિરાશ થાય છે. ફ્લેટના વાસ્તુમાં તેઓ કમને જાય છે. પુત્ર ગાડીમાં લેવા આવે છે ત્યારે ઊંચાં ઊંચાં બિંદિગો જોઈ તેઓ રાજ્યો અનુભવતા નથી, પણ તેમને ૨૬ મી જાન્યુઆરીનો ભૂકૂપ જ યાદ આવે છે. પુત્ર તેમને ઈસ્કોન મંદિર જોવા લઈ જાય છે ત્યારે મંદિરની ઊંચાઈ જોઈ તેમને થાય છે, “ઉપરવાળા, તારી લીલા અપરંપાર છે.” આ પણી પુત્ર પોતાના દસમા માળના ફ્લેટની બાલ્કનીમાંથી માલજીભાઈને મંદિર બતાવે છે તો માલજીભાઈ આશ્રમાં મુકાઈ જાય છે અને બોલી ઉઠે છે : “ઓ મારા લાલજી તમો બાળરૂપ બની ગયા !

વિશાટમાંથી વામન થતાં કર્દી વાર જ નો લાગી.” અને મંદિર તરફ મલકાતાં જોઈ કહે છે : “આને ઉપરવાળો કહેવો કે નીચેવાળો ?” ‘ઉપરવાળો’ શબ્દનો લાક્ષણિક પ્રમોગ અને કાંકાઓ રસપ્રદ છે. માનવમનની આવી લીલા રમતિયાળ શૈલીએ આસ્વાદ્ય બની છે.

‘ંખીલોક’ વાર્તા અન્ય વાર્તાઓમાં જુદી જ ભાત પાડે છે. ગદ્યમાં કાલ્યત્વનો અનુભવ કરાવતી આ વાર્તાનું સંવેદન પણ કાલ્યક્ષમ છે. નાનકડી દીકરી અવનિ કથાનાયકને ઉંઘમાંથી જગાડવા એના કાનમાં ટહુકે, કાન બેંચે, મુલાયમ પીછાનો સ્પર્શ કરે અને નાયક જાગે ત્યારે સામે જ પંખિણી સમી મંદ મંદ હસતી અવનિને જુદે અને પાછો આંખો મીંચી દે. આ પછી નાયક સ્વનલોકમાં પહોંચી જાય છે. ત્યાં એ શું શું જુદે છે, અનુભવે છે અનું કાલ્યમય આવેના એટલે ‘ંખીલોક’ વાર્તા. અહીં દ્વિરેફની ‘જમનાનું પૂર’ વાર્તાનું સ્મરણ થાય. રસિકલાલ પરીખે ‘જમનાનું પૂર’ વાર્તાને ગદ્યકવિતા તરીકે ઓળખાવી છે તો આ ‘ંખીલોક’ વાર્તા પણ ગદ્યકવિતા જ છે. ‘જમનાનું પૂર’માં એક વ્યક્તિત્વવાદી સ્ત્રીના સંવેદનની પ્રતીકાત્મક કથા છે. અહીં ‘ંખીલોક’ વાર્તામાં પિતા-પુત્રીનો મુલાયમ પીછા જેવો પ્રેમ કાલ્યમય ગદ્યમાં વ્યક્ત થયો છે.

આ ઉપરાંત ‘વરતારો’, ‘જન્મોત્સવ’, ‘કન્યાદાન’, ‘હજુ હું જીવું છું’, ‘ટુ કોપી’, ‘પગલી’, ‘આ, લે વાર્તા’ જેવી સરેરાશ વાર્તાઓ છે જેમાં ક્યાંક ‘મુખરતા, કૃત્રિમ નાટ્યાત્મકતા, સ્થૂળ ચમત્કૃતિ, સામાજિકતાનું સીધું સપાટ આવેના જોવા મળે છે. પરંતુ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓમાં જીવનની સન્નિકટ રહીને વાર્તાકારે કલાનુભવ કરાયો છે. વાર્તાકારીને જીવનને જોવા-પરખવાની દસ્તિ, મનુષ્યવ્યવહારનું ઝીણવટબર્યું નિરીક્ષણ, પાત્રોનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ અહીં આસ્વાદ રીતે રૂપાંતરિત થયાં છે. વાર્તાભાષામાં પણ સર્જકની શક્તિનો જ પરિચય થાય છે. તેમણે ટૂંકાં વાક્યોનાં સંયોજનો થડી તથા વાક્યોમાં પ્રાસ રહીને ગદ્યલય નિપણાયો છે. અર્થાંકારો, કલ્યાણ, પ્રતીક, વકોન્જિત જેવી વિશીષ્ટ ભાષાપ્રયુક્તિઓ પ્રયોગ અર્થવ્યાપ સિદ્ધ કર્યો છે. તેમણે ભાષાનો વંજનાસ્તરે કરેલો પ્રયોગ વાર્તાઓને કલાકૃતિની ઓળખ આપે છે. આ વાર્તાઓ માટે ગુણવંત વ્યાસને અભિનંદન આપતાં કહી શકાય કે “લાવો બીજી વાર્તા !” □

## કાન્તના પત્રો : સંપા. દર્શના ધોળકિયા

ગુજરાત સાહિત્ય અકાડમી, ગાંધીનગર, ૨૦૦૮. ૩. ૪૬૬, રૂ. ૨૧૫

## ઉત્તમ પત્રસંપદા, મદ્યામ સંપાદન

કિશોર વ્યાસ

મંથનકણના એક ઉત્તમ કવિની સાંસ્કૃતિક, સાહિત્યિક અને સામાજિક મથ્યમણો આ પત્રોમાં વ્યક્ત થઈ છે. કાન્તના આ પત્રો મનુષ્યસ્વભાવને, જીવનપીડાઓને પ્રગટ કરનારા તેમ સાક્ષરયુગની છબિ અંકી આપનારા છે.

આ અગાઉ બલવંતરાયે સંપાદિત કરેલા કાન્તમાલામાં ખરેખર તો અંગેજ્માં લખાયેલા ને ગુજરાતીમાં અનૂદિત કરીને મુકાયેલા ૧૪૪ પત્રો પ્રકાશિત થયા છે. સંબોધન વિનાના આ પત્રો કોને-ક્યારે લખાયા છે એવું આપણે કેવળ અનુમાન કરવાનું રહે છે. પ્રસ્થાન (ઈ. સ. ૧૯૨૪, અંક ૨)માં ૬૪ પત્રોનું પ્રકાશન થયું છે. ‘વીજા’ના વાર્ષિક અંક (૧૯૨૭)માં કુલ ૧૮ પત્રો પ્રકાશિત થયા છે. કાન્ત-શતાબ્દી નિમિત્તે પ્રકાશિત ગ્રંથ (૧૯૬૭)માં ૮ પત્રો પ્રસિદ્ધ થયા છે. આ ઉપરાંત મુનિકુમાર ભણ સંપાદિત પત્રોનો અહીં ઉલ્લેખ કરેલો છે પણ સંપાદક દર્શના ધોળકિયા એ પત્રોને જોઈ શક્યાં નથી. પલવવી ભણ સંપાદિત ‘કવિ કાન્તનું સાહિત્ય’ પુસ્તકમાં કાન્તના પત્રો હતા એને પણ સંપાદક અહીં આમેજ કરી શક્યાં નથી ! એ પત્રો જો પરિશિષ્ટમાં પણ દાખલ થઈ શક્યા હોત તો કાન્તના આ છૂટાછવાયા તમામ પત્રો એક જ ગ્રંથમાં આપણને મળી શકત. આટાટલા પત્રોના ગ્રંથપ્રકાશનથી એક વાત સ્પષ્ટ થાય છે કે સામગ્રીનાં સતત પુનરાવર્તનો ટાળવાની એક મહત્વની અભ્યાસશીસ્ત આપણા હાથમાં આવી નથી.

કાન્તના પત્રસાહિત્યની આ વિપુલતા જોઈ, બલવંતરાયે કહેલું એની સાથે આપણે પણ સંમત. થઈએ કે : ‘મણિશંકરનું જીવન એમના પત્રોમાં છે.’ જોકે અહીં મુકાયેલા કેટલાક પત્રો એની અનિવાર્યતા સિદ્ધ કરે એવા

નથી. જેમાં સ્થૂળ અને કોરી વિગતો માત્ર હોય એવા પત્રોને ગાળીચાળી નાખવા જોઈએ. જેમકે અહીં ૨૮-૫-૧૮૧૨નો પત્ર, (પૃ. ૩૬૭) ૧૨-૫-૧૮૧૭નો પત્ર (પૃ. ૪૦૬) વગરે.

કાન્તના આ પત્રોમાંની કવિતાવિષયક ચર્ચા કાન્તની કવિતાદસ્તિ અને સરજીતાને પ્રગટ કરી આપનારી છે. બલવંતરાય સાથે ચાલેવી આ ચર્ચાઓમાં ગોવર્ધનરામની સ્નેહમુદ્રા જેવી કૃતિ વિશે નિખાલસ અભિપ્રાય છે તો એ સમયની ગુજરાતી કવિતાની આકરી સમીક્ષા પણ છે. પોતાની રચનાઓ વિશે વાત કરવામાં કાન્ત એટલી લઘુતા અનુભવે છે કે આજના જમાનામાં તો એને નવાઈ જ કહેવી પડે ! રચનાના લંબાણ બાબતે મૂળાતા કાન્ત બલવંતરાયને એક પત્રમાં કહે છે : ‘મહેને એક કુટેવ પડી છે કે મારી કૃતિઓ જન્મે પછી થોડા ડિવસ સુધી તેમને હું (ઘટે તે કરતાં) ઓછી મૂલાંથું છું. (પૃ. ૨). તો ક્યારેક કાવ્યસર્જને આપેલી શ્રદ્ધાને પ્રગટ કરતાં તેઓ લાખે છે કે : ‘મહારું કાવ્ય હજુ પૂરું થયું નથી. એ કાવ્ય આપણી ભાષામાં વિશિષ્ટ થશે. પણ મને શંકા (પણ) રહે છે જે એ પ્રથમ પંક્તિનું નહીં ગણાય. મહારી શક્તિ જરા બૂઠી પડી ગઈ છે અને મહારી કલ્યાણાનું (નિરૂપણ) તેજસ્વી કરવાને માટે મહારે મંથન કરવું પડે છે. (પૃ. ૩) આ કાવ્યો માટે સ્પષ્ટ અભિપ્રાય આપવા બાબતે દાકોરને કહેતા કાન્ત આપણને સતત નવું શીખવા તત્પર વિદ્યાર્થી જેવા, તો ક્યારેક વળી આત્મશ્રદ્ધાના રણકાર વિનાના લાગે છે. તેઓ દાકોરને કહે છે : ‘તહમારી રંક ટીકાઓ મને જોઈએ. પણ છૂટક છૂટક (શાબ્દો, કડીઓ આદિ ઉપર) નહીં. એ (કાવ્યની) કવિતા વિશે હું ઈચ્છું છું જે તહમારે સમગ્ર નિર્ઝય લખી જણાવવો :

સાહિત્ય

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ ૧૮

હું ઈચ્છણું છું જે કલાકૃતિઓના વર્ગમાં તહમારે એનું સ્થાન નક્કી કરવું : વળી હું આગળ વધું છું કે ઉલટો પાછળ પડતો જાઉ છું, તે ય તહમારે ચોક્કસ કરવું પડશે. કેમ જે મહને ધાસ્તી રહે છે કે હું થોડાં વર્ષમાં તો કવિ મટી જવાનો’ (પૃ. ૩) બાવીસ વર્ષની યુવાન વિયે કાન્ત પોતાના સર્જન વિશે જે નિર્મભતાથી વાત કરે છે એ ધ્યાનાર્દ બને એમ છે. ઉત્તમ બંડકાળ્યોનો કવિ ક્યારેક જાણે પોતાના ક્રિતિસોપાન પર અહીં હસ્તકાર કરતો હોય એવું લાગે છે. કાન્ત કહે છે : ‘બલવંતે રમાને કેવળ નિર્માલ્ય ગણેલ છે પણ મને દુઃખ નથી લાગ્યું. બીજા માણસે પ્રશંસા પણ કરેલ. ખરા આવેશથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર નથી રાખતો. મને મારા હદ્દય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે માનું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઈતિહાસમાંથી જલદી ભૂસાઈ નહીં જાય. આ વૃત્તિને હું Confidence (વિશ્વાસ) કહું છું, તે અભિમાનથી જુદી જ ચીજ છે.’ જાત પ્રત્યેના આ વિશ્વાસને આગળ ધરીને તે કવિયશને પામ્ય એમાં અભિમાન નથી એ યાદ રહે. ઊંડી અનુભૂતિ સર્જનનો પ્રાગ્ન છે એમ કહેતા કાન્તે અસરકારક શૈલીમાં એક વિધાન આપ્યું છે કે : ‘લખવાની ઈચ્છા હોય એ સારી વાત છે. માત્ર લખવાલાયક અનુભવ જોઈએ. વિશેષ અનુભવ વગર ભેદક લેખો લખાતા નથી.’ (પૃ. ૨૧૮) કાન્ત એ સમયને ગુજરાતી કવિતાની બાલ્યાવસ્થા ગણાવે છે. આથી કવિતા લખવી કાન્તને મુશ્કેલ જણાતી હતી. અંગ્રેજી કવિતાના અભ્યાસને લીધે કવિતા-પરીક્ષણ માટેના અતિ કડક નિયમોનો પણ કાન્તને ખ્યાલ હતો. એ કસોટીની ઝેરણ પર તપાસતા ગુજરાતી કવિતામાંથી બહુ જ થોડી રચનાઓને કાન્ત પસંદ કરતા હતા. ખરેખર, સંસ્કૃત કવિતાના પણ મોટો ભાગને કચરો જ ગણશો થયો છું અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ જોડનારો હતો’ (પૃ. ૪૪). અંગ્રેજી કવિતાને ઉત્તમ કોટિની માનવામાં ભૂલ નથી પણ સંસ્કૃત-ગુજરાતી કવિતા કે પ્રેમાનંદ જેવા કવિને ઉંતરતી કોઈના ગણવામાં કાન્ત વિવેક દાખવી શકતા નથી. તેઓ એક પત્રમાં એવું કહેતા ટેખાય છે કે ‘આપણી ભોંયમાં એવી ઉંચાઈના બુદ્ધિમાનો નથી. આપણા કવિઓ મૂર્ખ અને વિવેચકો બદલ્યા છે. (પૃ. ૪૬).

બીજા એક પત્રમાં પ્રેમાનંદને શેક્સપિયરની કક્ષાનો ઘટાવનારા, દ્યારામને બાયરનથી ચઢિયાતો ગણાવનારા આપણા પ્રેજ્યુએટોને મૂર્ખમાં ખપાવીને તે એવો અભિપ્રાય વહેતો કરે છે કે દ્યારામ બાયરનથી કે ડોન જોન્સથી વધુ વિષયી છે. (પૃ. ૫૨) કાન્તના આવા અભિપ્રાયો ઉત્તાવળિયા અને એમની સાક્ષરપ્રતિભાને ઝાંખ્ય લગાડનારા છે. ડાકોરને કવિતા માટે પ્રોત્સાહિત કરતા કાન્ત સંબોધનાત્મક શૈલીએ કહે છે કે : ‘કવિતા કરવાનું ચાલુ રાખો મારા પરમ મિત્ર ! આ સમયે મને આપણી રંક ભૂમિ માટે પહેલી કવિતા મળી છે.’ આમ કચ્ચા પદી કવિતાના અંતરેંગની ચર્ચા હથ ધરે છે ને ક્યાંક ઉત્તમ વસ્તુ જોતાં ‘હવે હું તમને કવિ કહું’ એવો હર્ષદ્વાર કાઢે છે પરંતુ મિત્રોની કવિતા બાબતે પણ તેઓ સ્વસ્થતાથી સમીક્ષા કરે છે. કલાપીએ કાન્ત પર મોકલેવાં કેટલાંક કાવ્યો સંદર્ભે ડાકોર ચાથે વાત કરતાં કાન્ત આ કાવ્યોની નજીકતને પ્રશંસે છે પણ એમાં દૂઝતાં હૈયાના ભાવો – નિરાશા અને નબળાઈઓને સ્ત્રોષ કહે છે. પોતે કલાપીના ‘રફ ટ્યુટર’ થવા તૈયારી દાખવતા નથી પણ કવિતા બાબતે કઠોર સત્ય પણ કહેવાનું આવશો તો એ કલાપીને કહેવાની તૈયારી દાખવે છે એમાં કાન્તની સારી કાવ્યપ્રીતિનો અણસાર છે. કલાપીએ પણ સ્વીકાર્યું છે કે ‘મહારું રૂદન આપને વ્યવસ્થા વિનાનું લાગે છે એ બરાબર જ લાગે છે.’ કાન્ત પોતાનાં કાવ્યો વિશે કલાપીનો મત માગે છે ત્યારે, ‘આપનાં કાવ્યો વાંચી તેને માટે કાંઈ કહેવું એ મહારી શક્તિની બહારની વાત લાગે છે’ એમ કહીને કલાપીએ કાન્તની કવિતાને દરશાંગુલ ઉદ્ઘર્વ કહી દીધી હતી એ જાણીતી વાત છે. (જુઓ : કલાપીઘટના – સં. રમેશ શુક્લ, ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૮૮) સાહિત્યમાં કલ્યાણ કરતાં વાસ્તવના નિરૂપણનો મહિમા કરતા કાન્ત નહાનાલાલ ને કલાપીનો ભેદ કરતાં ઈન્દ્રકુમાર વાંચીને અભિપ્રાય આપતાં જણાવે છે : ‘અમને લાગે છે કે વર્તમાન ગુજરાતની સાંસારિક અને ઇતર જીવનની મુશ્કેલીઓ પર કવિ હજી થોડો જ પ્રકાશ નાખે છે. ચિત્રો ઘણાં ઉચ્ચ અને સુંદર આવેજે છે. જીવનસંબંધી પણ ઘણાં ગંભીર સત્તો આપે છે અને તોપણ વર્તમાન સમાજને દુઃખ ક્યાં છે, મુશ્કેલી ક્યાં આવે છે, વિરોધો કેવા ઊભા થાય છે વગેરે નજીદીક રહીને તેમણે

જોયેલ નથી. અને તેટલા માટે ખરી મુશ્કેલીઓ ઉપર [તે] કંઈક અજવાણું પાડતા નથી. નવી કાલ્યનિક સૃષ્ટિ બહુ સુંદર ખડી થાય છે, પણ તેમાં હાલના વખતના આપણા જીવનની સાથે સમભાવનું દર્શન થોડું છે. ગુજરાતના હદ્યને જેવો કલાપીએ સ્પર્શ કર્યો છે તેવો કવિ હજી કરી શક્યા નથી' (પૃ. ૩૬૦) પણ આમ કલ્યા પછી ન્હાનાલાલની સ્ક્રિફ્ટને તેઓ અવગણતા નથી. એમના કવિવિશેખને બિરદાવતાં નોંધે છે : 'તેમને મતે કવિમાં કલાપીની સરલતા નથી; કલાપીનો પ્રસાદ પણ નથી. પણ કવિમાં કંઈ બીજું છે જે ગુજરાતમાં વિરલ છે.

'મેં જે વાંચ્યું છે તે વાંચવાનો શ્રમ લે એવા આ દેશમાં થોડા છે.' (પૃ. ૨૫૨) એમ કહેનારા કાન્તના પત્રોમાં સતત નામી-અનામી સર્જકો, ચિંતકોના વિચારો ઠલવાયા છે. સ્વીડનબોર્ગના વિચારોથી પ્રભાવિત કાન્તે આપણા ધર્મનું સૂક્ષ્મ મૂલ્યાંકન કર્યું છે પણ એમાં ક્યાંયે કોઈ ધર્મ કે સંપ્રદાય પ્રત્યેની એમની આકર્ષણી નથી, એ વાત નોંધપાત્ર લાગે છે. કાન્ત માનતા હતા કે મનુષ્યની શક્તિ અને પૂજ્ય બુદ્ધિને પરિણામે ધર્મો ઉદ્ભવે છે તેમ નીતિમય અને અનીતિમય એવા વર્ગોમાં જ ધર્મનો સમાવેશ થઈ શકે. તેઓ ધર્મને જીવતી વસ્તુઓ ઘટાડે છે ને તે ઘણી સંકુલ છે એમ કહે છે. જનસમાજમાં ધર્મોને અપરિમેય પણ પ્રાણભૂત કાર્યો કરનાર તેઓ ગણતા હતા અને આ ધાર્મિક બનાવોના વ્યાપારની ખરી કિંમત અંકવા માટે ધીરજ અને શોધને તેઓ અનિવાર્ય ગણતા હતા. ધર્મના વિષયમાં વાદવિવાદ અરથાને છે એમ તેમનું સ્પષ્ટ માનવું હતું. આવી ચર્ચાઓ કરતી વેળાએ એકેશ્વરવાઢ, અદ્વૈતવાદી ચર્ચાઓ પણ ગૂંથાતી ચાલે છે. વિદ્વાનોના ને સંતમહાત્માઓના મતોનું પ્રમાણ આપતા જઈ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય એમાં મૂકી આપે છે. 'હું સિદ્ધાંતોનું અને તે સાથેના તર્કનું અન્વેષણ નથી કરતો પણ માન્યતાઓનો અને તે સાથેની ભાવનાનું અન્વેષણ કરું છું.' (પૃ. ૧૪૦). ક્યારેક ધર્મની પ્રવર્તતી જુદી વિચારધારાઓથી અકળાઈને કાન્તે એમ પણ કહી નાખ્યું છે કે 'અરે જ, હિંદ અતિ વિચિત્ર છે, એ રીતે કે અહીં એકએકથી કેવલ વિરુદ્ધ મત એકસાથે જ પ્રવર્તી રહ્યા છે.' (પૃ. ૧૪૪), વેદ, ઉપનિષદ, યોગસૂત્ર, ગીતા જેવા ધાર્મિક ગ્રંથોના જ્ઞાતા

તરીકે અહીં કાન્તનો ડગવે ને પગવે પરિચય થાય છે. એમાંથી પ્રગટું દોહન પ્રભાવિત કરનારું છે જે સત્યશોધક કાન્તની છબીને જીવંત કરે છે. ક્યારેક-ક્યારેક તો કાન્તના હાથથી વિચારસૂત્ર ટ્યુક્રી પડે છે. જેમકે : 'દુનિયામાં ઘણા માણસો બેશક ઘણા ખરાબ છે પણ મને પ્રતીતિ થાય છે કે આપણે પોતે નિર્ભલ ન હોવાને લીધે ઘણાને હોય તે કરતાં પણ વધારે ખરાબ માની લઈએ છીએ.' (પૃ. ૧૮૮) એક જગાએ સત્યની પ્રાપ્તિ અંગેનો કાન્તનો ઉદ્ગાર આવો છે : 'અફ્સોસ એ છે કે હાલના વખતમાં આપણે બધા માની લઈએ છીએ કે ધર્મનું સત્ય આપણને મળી ચૂક્યું છે. હકીકિત એ છે કે એ સત્ય પરમ દુર્લભ છે અને ઘણા જ થોડાને મળે છે. એ મણ્યા પછી આત્માને એટલી શાંતિ રહે છે કે ક્ષોભ કદાપિ થતો નથી.' (પૃ. ૨૪૨) ધર્મચિંતન અને આત્મપરીક્ષણ અંગે સતત મથામણ કરનારા આ સાક્ષરને કહેવાનું ઘણ્યું છે પણ માણસોની ઉપેક્ષાવૃત્તિ નિરાશા ઉપજાવે છે ત્યારે કાન્ત કહી ઉઠે છે કે : 'અરે રે ! દુનિયા તહમારું સાંભળવું જ બધ કરી દે છે, તે જ સમયથી, કે જ્યારે તહમને કંઈ કહેવાનું એવું પ્રાપ્ત થયું હોય છે.' (પૃ. ૨૫૧)

નવી ધર્મપ્રતીતિને સમસ્ત ગુજરાતમાં કે હિન્દના સાક્ષરો સુધી પહોંચાડવાની મહેયથા કાન્તે સેવી હતી. અનેક પત્રોમાં આ ભાવને કાન્તે વ્યક્ત કર્યો છે પણ એનો ઉમળકાબેર પ્રતિસાદ જ ન મળતાં આ માર્ગના તેઓ એકલપ્રવાસી બની રહ્યા. આ સ્થિતિએ એમના મનને નિર્ભળ અને ઉન્માદી બનાવી મૂક્યું. ધર્મપરિવર્તન પછી તો કાન્તને જીવનનો અસ્વચ્છ તાપ વેદવાનો આવ્યો. 'કુટુંબનો વિયોગ, પરિશિતોની ટેકશી વગેરે બધાં દુઃખોથી મારું અંગેઅંગ જખમી થયેલું છે. જીવનના શબ્દથી પણ દિલાસો મળતો નથી' (પૃ. ૧૮૮) એવા વિધાનમાં કાન્તની હતાશા પડવાય છે. ધર્મપરિવર્તનની ઉત્તેજના અને અવસાદથી તેઓ એક પત્રમાં એમ લખે છે કે : 'સાંભળો અને પછી કહો. પરીક્ષા કરો અને મને છું તેવો સમજવાનો યત્ન કરશો તો હું સંતુષ્ટ રહીશ.' (પૃ. ૨૫૩) અને તે છતાં એવો કોઈ પ્રયત્ન ન થતાં મધ્યારિયે દૂબેલા વહાણના ખલાસીની જેમ કાન્તનો ઉદ્ગાર છે કે : 'સેનાપતિ તરફથી મળેલી સામગ્રી બેદરકારીમાં લૂંગાઈ ગઈ' (પૃ. ૩૪૬)

એક પછી એક સ્વજનના અણધાર્યા અવસાનથી કુટુંબપ્રિય કાન્તના હૈયાને ભારે ઠેસ પહોંચી હતી. સેહીજનોના વર્તાવ અને શાંતિ તરફથી મળેલા ત્રાસથી પણ કાન્ત બ્યાથિત થયા હતા. એ સઘળાની ક્રિયા-પ્રતિક્રિયા આ પત્રોમાં પ્રગટ થઈ છે. એમાં કાન્તના વત્સલ અને સેહભૂષ્યા માનસનો પરિચય થયા વિના રહેતો નથી. પત્ની નર્મદાને લખેલા પત્રોમાં એ સેહભાવ કેવો બ્યક્ત થાય છે એ જુઓ : ‘અપરાધોની ક્ષમા માંગુ છું. શાંતિને પરે તો નહીં પડું પણ તારે પરે પડું છું. તું ચાહે તે કર.’ (પૃ. ૨૭), (જેકે કાન્ત એ પછી શાંતિને શરણે ગયા હતા. મુનિકુમારના લગ્ન વખતે શાંતિભોજન થયેલું ત્યારે પોતે ડંડો નીચે મૂકી દઈને શાંતિને સાંઘાંગ પરે લાગ્યા હતા. (જુઓ : ‘કાન્ત વિશે’ – ભૃગુરાય અંજારિયા, સં. જ્યંત કોડારી, સુધા અંજારિયા, આર. આર. શેઠ, અમદાવાદ, ૧૯૮૮) ધર્મપરિવર્તનના આ તબક્કે અન્ય એક પત્રોમાં નર્મદાને ઉપાલંબ આપતાં તેઓ કહે છે કે : ‘હાલ તું જે વિચારે છે અને કહે છે તે ઉપરથી એ જ દેખાય છે કે તું સ્ત્રી છે પણ પત્ની નથી. (એ જ) નર્મદાના અવસાન સમયે લખે છે કે : ‘હું જાણું રડચો નથી પણ એના આધાતથી મારું હૈયું પથ્થર બની ગયું છે?’ આવા ઉદ્ગારોમાં પત્નીનેહનો સઘન અનુભવ મૂર્ત થાય છે. અહીં મુકાયેલા પત્રોમાં સૌથી વધુ બલવંતરાય ઢાકોરને લખાયેલા (૨૧૨ જેટલા) છે. કાન્ત મુક્ત મને પત્રોમાં કોણ્ણા હોય તો એ ઢાકોરને લખેલા પત્રોમાં. આ પત્રોમાં કાન્તનું બ્યક્તિત્વ જેટલું પ્રગટ થયું છે એટલું અન્ય કયાંય થયેલું જોવા મળતું નથી. કાન્ત એક જગાએ લખે છે કે : ‘મનુષ્યોમાં લક્ષ્યિશંકર, ન્હાની અને તમે એ ત્રણ મને નિકટ છો. તમે મારા સંબંધી સર્વથી વધારે જાણો છો.’ (પૃ. ૨૩૪).

કોઈ પણ ચર્ચા માટે કાન્ત ઢાકોરની સાથે સંવાદ (Sharing) કરવાનો મત ધરાવતા હતા. વધારે સંપૂર્ણ કાગળો લખવા એ ઢાકોરને વારંવાર આગ્રહ કર્યા કરે છે કેમકે બીજું આ દિવસોમાં કોઈ સુખ નથી એમ તેઓ કહે છે. બીજા એક પત્રમાં કહે છે કે : ‘શક્ય બને તો રોજ એકાદું પનું લખોને !’ ઢાકોર સાથેની મૈત્રી એવી ગાડ છે કે હુદય ખુલ્યું કરવામાં કાન્તને કશો સંકોચ નથી. ‘સાથે રહીએ અને કામ કરીએ તો ઘણું ઉપયોગી કામ કરવું –

મહેરબાની કરી એમ. એ. જલદી થઈ જાવ પછી કાયદો કરો. આત્મા તો આવી તક ન મળે તો મૂરજાઈ જાય (પૃ. ૬૪) ભારતનો ઇતિહાસ લખવાનું આમંત્રણ સ્વીકારી લેવા કાન્ત ઢાકોરને કેવળ વિનંતી જ નથી. કરતા, સંપૂર્ણ હસ્તપ્રતની સારા અક્ષરે નકલ પોતે કરશે એવી બાંહેધરી પણ આપે છે. અધરા અંગેજ શબ્દોનું ગુજરાતી કરી આપવા ને કક્કડ કક્કડ લખવા પ્રોત્સાહિત કરી મિત્રની પ્રગતિમાં રાજી રહે છે. આ મિત્રતાનો હક દાખવવાનું પણ કાન્ત ચૂક્તા નથી. ઢાકોરે માધવરાવ પેશા પર લખેલા એક નિબંધની માગણી તેઓ કેવી શૈલીથી કરે છે તે જુઓ : ‘તમારા નિબંધની સારી નકલ યુનિ.ને મોકલાઈ ગઈ હો. મને નકલ રફ મળશે ? પ્રાન્તના દેશમાં પ્રતિષ્ઠા થશે તેની મને શંકા નથી. મને અદેખાઈ નથી, પણ પહેલો વાંચવાનો મારો હક્ક. (પૃ. ૮૨). ઢાકોરને લખતાં કાન્ત ઘણી વાર પોતાની જાતને સતત ટપારતા રહ્યા હોય એમ લાગે છે.) ‘મારે બેશક વધારે વાંચવું જોઈએ’ (પૃ. ૮૬). લાંબું લાંબું લખવું મને પસંદ નથી (પૃ. ૧૫૮) જેવાં વિધાનો ઉપરાંત ‘હું તમારી જેવો ઝડપી લેખક નથી (પૃ. ૧૮૦) એમ ઢાકોર સાથે પોતાની જાતની સતત તુલના કરે છે.

કાન્ત સામાન્ય રીતે લાગણીના માણસ ગણાયા છે પણ ફિલસ્ફૂઝીના વિદ્યાર્થી હોવાના નાતે એમનું ચિંતન-વિવેચન તત્ત્વપરામર્શ-શક્તિની પ્રતીતિ કરાયા વગર રહેતું નથી. મિદ્ધાંતસારાના અવલોકન દ્વારા વેદાંત પર પ્રબળ હુમલો કરવા પોતે તૈયાર હોવાનું ઢાકોરને જણાવે છે પણ એ સાથે જ નોંધે છે કે : ‘આક્ષરી પાતકોમાંનું સૌથી અધમ સત્યાસ્ત્ય પ્રતિ એકસરખી બેદરકારીને જ ગણાનું ઘટે છે. એમ મને લાગવા માંડયું છે. જે કોઈ (અસત્યને જ આગ્રહપૂર્વક જ સત્ય લેખનારો) અયથાર્થદર્શી હો, તેની આંખ ઉઘાડવી સંભવિત ખરી, પરંતુ જે કેવળ અપક્ષતાને (હઠથી) વળગી રહે છે, તેની આગળ બધોય વાદ બૂઠો પડે છે. (પૃ. ૮૭) આવી ચર્ચાઓમાં કેવળ સુષ્ણ સુષ્ણ વાતો કરવાનું બંને મિત્રોએ યોગ્ય ધાર્યું નહીં હોય એમ લાગે છે. એક જગાએ પોતાનો જુદ્દો મત રજૂ કરતા કાન્ત ઢાકોરને કહી ટે છે કે : ‘માનવજીવન પ્રધાનપણો દુઃખમય જ હોઈ શકે’ એ તમારું સૂત્ર તમારા પ્રકાશ પ્રમાણે બરાબર છે. હું ઘણી વાર ભૂલી જાઉં છું, કે આપણા બંનેના

પ્રકાશો બિન્નાભિન્ન છે. માનવ-ઇતિહાસમાં જે બનાવોને હું સર્વોપરી ગણું હું અને જે સમજ્યા વગર ઇતિહાસ સમજી શકાય તેમ નથી, તે તરફ તમારી દસ્તિ હજી ઉઘડેલી જ નથી.' (પૃ. ૩૮૭) આવું સ્પષ્ટકથન કરનાર કાન્ત જ્યારે અકળાઈ ઉઠે છે ત્યારે ઠાકોરને આવાં આકરાં વેણ પણ સંભળાવે છે : 'તમને પણ ભગવાનલાલની અક્કલ પર ચાલવાને બદલે પોતાની અક્કલ પર ચાલવાની મારી જરૂર ભલામણ છે અને એ યાદ રાખવું, કે હું કેઈ જુગતરાય કે ભગવાનલાલ નહીં, પણ તમારો સમાન હું. માત્ર તમે ગોહરજાનની માહિક મારા કરતાં વધારે કમાઓ છો.' (પૃ. ૪૨૩). ઠાકોરના પ્રતિભાવો મેળવવા કાન્ત સદ્ગય તત્પર રહ્યા છે એ મેળવવામાં જ્યારે મોંઢ થયું છે ત્યારે કાન્ત ઠાકોરને લાગાયીથી કહે છે કે 'મારી ભૂલ થતી હોય તો હું સુધારવાને તત્પર છું પણ દૂર હોઈએ અને એકબીજાનાં મન પ્રગટ ન કરીએ તો શી રીતે જજ્ઞાય ?' (પૃ. ૨૪૪) કાન્તની પાંત્રીસ પૃષ્ઠોની નવલકથા 'કુમાર અને ગૌરી' શાનસુધાના પાંચ અંકોમાં પ્રગટ થઈ હતી. એ પછી પુસ્તિકા રૂપે પણ પ્રગટ થઈ. આ નવલકથાની નોંધ કાન્ત અને ઠાકોરના પત્રોમાં આવ્યા કરે છે પણ આવી નબળી નવલકથા લખવા પાછળ કાન્તનો શો હેતુ હશે એની વાત ન તો કાન્તે કરી છે કે ન તો ઠાકોરે એમની આ પ્રકારના સર્જન માટે ટકોર કરી છે એ આશ્ર્વય લાગે છે. ધર્મપરિવર્તનની ઘટના પછી એકલતાથી પીડાતા કાન્ત ઠાકોરના સંબંધ વિના ઝૂરતા હતા. એના પત્રો કાન્તને માટે ઔષધિ જેવા હતા. એક જગાએ લાગે છે કે : 'કૃપા કરીને બલુભાઈને કહો કે મહને લાગે. એના કાગળોથી હું આશા રાખું હું કે મહને ફાયદો થશે.' (પૃ. ૨૭૦) ઠાકોરના હદ્યને જીતવા ક્યારેક તો કાન્ત કાલાવાલા કરતા દેખાય છે એમાં કાન્ત-ઠાકોરની મૈત્રીનું બળ વરતાય છે. તેઓ કહે છે : જો મહારાં દીન વચનોથી તહુને દયા સર્જુરે, અને ગઈ ગુજરી, બધી કડવી ઘટનાઓ ત્હમે ભૂલી શકો, તો મહારાં વીનવણાં સાંભળો અને અહીં આવો. (પૃ. ૩૬૩). 'આજે હું ખૂબ પ્રસન્ન હું. તમારા પત્રની આતુરતા પછી એ પ્રાપ્ત થતાં આનંદિત હું એ કયા કારણે. કોણ જાણો ?' આવો આનંદોદ્ગાર કાન્ત પાસેથી મળવો દુર્લભ લાગે. અહીં એ ઠાકોરના પત્રો માટે કહેવાયો છે એમાં એ બનેનો અંતરંગ

સંબંધ પ્રગટ થાય છે. ઠાકોર અને કાન્તે પોતાનો પત્રવ્યવહાર અંગ્રેજમાં જ ચલાવ્યો હતો. પંડિતયુગના તમામ સર્જકોની આ ખાસિયત રહી છે કે પોતાના સર્જનને વિચારને પહોંચાડવા ગુજરાતીમાં મથવું પણ અંગત સર્જન પછી એ પત્રો હોય, ડાયરી હોય એ તમામ અંગ્રેજમાં જ લખવું. કલાપીએ તો કાન્તને પહેલેથી કહી દીધું હતું કે : 'હું તો આપને ગુજરાતીમાં જ લખીશ. આપ ઈંગ્રેજમાં લખશો (કલાપી ઘટના, પૃ. ૩૬). કાન્ત પણ ઠાકોરને તેમ હરિલાલને ગુજરાતીમાં પત્રો લખવાનું ભારપૂર્વક સૂચન કરે છે ને પોતે પણ ગુજરાતીમાં જ લખશો અથું આશાસન આપે છે પણ એ વચન કોઈ પાણી શક્યા નથી. કાન્ત અને ઠાકોરના આ પત્રો સંધન અત્યાસનો મુદ્દો બની શકે એમ છે.

આ પત્રોમાં કેવળ કવિતાચર્ચા જ નહીં, ગંધીકાર કાન્તની મથામણો આપણી સામે છતી થાય છે. વાનસુધામાં ઈ. સ. ૧૮૮૪થી ૧૮૮૬ સુધી લખાયેલું સિદ્ધાન્તસારનું અવલોકન, રોમન સ્વરાજ (૧૮૦૮) તેમજ સલીમશાહ અને અશ્વમતી (૧૮૦૮) જેવાં નાટકો. ઓરિસ્ટોટલનું નિકામેનિયન નીતિશાસ્ત્ર જેવા ગ્રંથોના સર્જન-પ્રકાશનની વિગતો ગંધીકાર કાન્તને આપણી સમક્ષ રજૂ કરે છે. સને ૧૮૮૮માં લખેલો શિક્ષણનો ઇતિહાસ શૈક્ષણિક વિચારના વિકાસ તરફ ધ્યાન ખેંચે છે. આ ગ્રંથ લખવા પાછળ કાન્તે કરેલો પુરુષાર્થ એક જ પંક્તિમાં આમ પ્રગટ થયો છે : 'મારો ઇતિહાસ પૂરો થયો છે, પણ એણે મને ભૌયભેગો કરી દીધો છે. (પૃ. ૮૨) ઓરિસ્ટોટલનું નિકામેનિયન નીતિશાસ્ત્રનો નબળો અનુવાદ કાન્તે આપ્યો છે. 'ઓરિસ્ટોટલનું આ આગળનું ભાષાનાતર મેં ડિક્ટેશનથી લખાયું છે. અનુલોખકો સૌ. નર્મદા અને મુનિકુમાર છે. મેં સુધારેલ નથી. (પૃ. ૩૬૮) અહીં સીધા જ ડિક્ટેશનને લીધી આપો અનુવાદ ક્રિલાસ્તાથી ભર્યો છે. જે બોલાયું તે લખાયું છે. સુધારવા-મઠારવાની જરાપણ દરકાર વિના થયેલા આ પુસ્તકમાં કવિતાના એકએક શબ્દને જોખીતોળીને બોલતા કાન્તનો ઊલટો જ અનુભવ વાચકને થવા સંભવ છે. (વધુ વિગતો માટે જુઓ 'કવિ કાન્તનું ગંધી' - હિનુભાઈ શાહ, ગુર્જર, અમદાવાદ, ૨૦૧૦) પંદર પત્રોની એક પત્રમાળાના રૂપે કરેલું સિદ્ધાન્તસારનું

અવલોકન પાછળનો કાન્તનો આશય બંડન કરવાનો નહીં પણ ‘જે ખરું કે ખોટું લાગે તે’ લખી જ્ઞાવવાનો હતો. કાન્ત તો ડેવળ મણિલાલનું જ નહીં કોઈનુંયે બંડન કરવાની તરફથીમાં નહોતા. ‘એનાં મંતબોને માન આપનારા મણે તો નથી લાગતું કે ઘણા હોય. એ અને બીજા સૌ ભલે ને પોતપોતાને માર્ગ વહે. આપણે શું ? આપણે આપણા સાહિત્ય પાછળ જ મંડિયે એમ કહેવું બહેતર નહીં ?’ (પૃ. ૪૨) જેવા વિધાનમાં કાન્તમાં રહેલો સમભાવી વિવેચક બોલતો હોય એવી પ્રતીતિ થાય છે.

કાન્ત બે સામયિકોના તંત્રીપદ સાથે સંકળાયેલા રહ્યા એનો વિગતે પરિચય તો આ પત્રોમાંથી પસાર થનારને મળે છે એમાંનું એક ગુજરાતી ભાષામાં પ્રગટ થતું બિટીશ અને હિન્દી વિકમ સાપ્તાહિક હતું. પ્રથમ મહાયુદ્ધ વખતે એ પ્રકાશિત કરવામાં આવેલું એ સાડાચાર વર્ષથી વધારે સમય સુધી ભાવનગર રાજ્ય તરફથી મહારાજી નંદકુંવરબાને નામે પ્રગટ થતું રહ્યું. આ સામયિક માટે ભાવસિંહજી અને નંદકુંવરબા બહુ જ તકેદારી રાખતાં. એક વાર તો મહારાજા ભાવસિંહજી કાન્તને ત્વાં ત્રણ વાર આવી ગયેલા : ‘કેમ મણિશંકર, તૈયાર થયું ?’ (જુઓ : કાન્ત વિશે – ભૂગુરાય અંજારિયા, સં. જ્યન્ત કોઠારી, સુધા અંજારિયા, આર. આર. શેઠ, ૧૯૮૮) બિટિશ હક્કમતના સહયોગમાં પ્રકાશિત આ સામયિકમાં વ્યાપક માનવહિત-વિષયક લેખોનું પ્રકાશન થયું છે એનો સંદર્ભ અહીં પત્રોમાં દેખાય છે. ધ હાઈ ઓફ ઇન્ડિયા – હિન્દનું હદ્ય નામના ટ્રેમાસિકમાં સ્લિવનબોર્ગ સોસાયટીના વૈચારિક લેખો, પ્રચાર સામયિકી કાન્તના હાથે તૈયાર થઈ એનો સંદર્ભ પણ અહીં પડેલો છે. આ ઉપરાંત આ પત્રોમાં વોદરા – કલાભવનથી કલાવિલાસ નામે સામયિક શરૂ કરવાની જંખના ઠાકોર સમક્ષ કાન્તે પ્રગટ કરી હતી. શુદ્ધ સાહિત્યિક નહીં પણ વ્યવહારુ વિવેચનલેખો આપવા કાન્ત ઠાકોરને પ્રેમાગ્રહ કરે છે. ‘સાહની જે પણ કરી લાભે તે મનને ગમે એવું જ હોય’ એમ કહેતા કાન્તે મિત્રની પ્રજ્ઞાનું ગૌરવ કર્યું છે. પરંતુ આવું કોઈ સામયિકનું પ્રકાશન કાન્ત કરી શક્યા નહીં. એ પછી એન. એમ. નિપાઠી કંપનીએ કાન્ત આગળ એક કિટીકલ મેગેઝિન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યાની નોંધ મળે છે ‘તે રચનાત્મક થઈ શકે. ગ્રાસહૂપરનું

મોં બંધ કરવાનો વખત પાક્યો છે’ એમ કહેતા કાન્ત દ્વેષથી કોને ગ્રાસહૂપર કહે છે એનો સંદર્ભ પ્રાપ્ત થતો નથી. કાન્ત ઠાકોર સમક્ષ સામયિકના તંત્રી થવાની સલાહ માગતા પણ દેખાય છે. વિશ્વનાથ ભંડ, કૃ. મો. જ્વેરી વગેરે વિદ્ધાનોએ વિવેચનાત્મક સામયિક સર્વોદય સહાય-માંડવીનું તંત્રીપદ સ્વીકારવા અને એ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની તૈયારી દાખલેવી. કાન્ત એવા વિચારથી સંમત થયેલા કે એક એવી જગ્યા મળી શકે કે જગ્યાં આપણે આપણા વિચારોને બહોળા પટમાં પ્રગટ કરી શકીએ. પણ કાન્તનું મન ધરે આવ્યા પછી અવઢવ અનુભવે છે અને જો ઠાકોર હા ભણે તો તંત્રીપદ સ્વીકારવાની હામ ભીડે છે. આવી દ્વિધા વચ્ચે પણ કાન્ત ઠાકોરને કંઈ પણ સામયિકી મોકલવાનું સૂચન કરે છે એ દર્શાવી છે કે કાન્તે જો સામયિક પ્રકાશિત કર્યું હોત તો એમાં ઠાકોરના પણ નિયમિત લેખો મળવાનું શક્ય બનત. કાન્તનો વીસમી સદી સામયિક અંગેનો વિચાર ઠાકોરને મળતો છે. કાન્ત વીસમી સદીના અંકની આકરી સમીક્ષા કરતાં લાભે છે કે : મિ. હાંગી મહિમાને હું મુંબદીમાં બેચાર વાર મખ્યો છું અને સારી રીતે ઓળખાંખું છું. ‘રજની’ના રિવ્યુ માટે હજુ તેણે લખ્યું નથી પણ આજે વીસમી સદી આવેલ છે. દોષેકદાસને તો કોઈ જ પસંદ કરે નહીં, પણ દોષ અને ગુણ બંને જોઈ, જો દોષ વધારે અને ગંભીર હોય તો તેની અનિષ્ટતા બતાવવાનો આપણો ધર્મ થાય છે, એમ હું સમજું છું. – સદીની Spiritને decadent લાગ્યો છે. રવિશંકરને પણ હું સારી રીતે ઓળખાંખું છું. એને બિચારાને હજુ ચિત્રના પ્રદેશનું ભાન નથી. કલાપીની દગ્દો એ નામની કવિતા ઉપરાંત તેનાં ચિત્રો હસવા જેવાં અને વર્થ છે અને સ્નેહસરિતા નાટકનાં જે ઘણાં ચિત્રો આય્યાં છે તે મને તો ગમતાં નથી. એકદરે આખા માસ્કિકમાં મને કશું ખાસ તારીફ કરવા લાયક લાગ્યું નથી.’ (પૃ. ૩૮૬). અન્ય પત્રમાં તો કાન્ત વીસમી સદીને કચરો કહેવા સુધી જાય છે એમાં કાન્તની ઉત્તાવળ દેખાઈ આવે છે.

આ પત્રસંચયમાં પૃ. ૩૮૨ પરનો બલવંતરાયને લખાયેલો પત્ર પુનરાવર્તિત થયો છે. લાંબા પત્રના અંશો પછી એમાંનો જ ટૂંકો પત્ર પાછળ લગાયો છે એ સંપાદકના ધ્યાનમાં આવ્યું નથી ! પૃ. ૪૫૫-૫૬ પર પણ એવી જ

સ્થિતિ છે. પત્રોમાં સ્પષ્ટ નજરે ચઢતા ભાષાદોષોને, શબ્દભૂલોને સુધારવાને બદલે સંપાદકે જેમનાં તેમ મૂકી દીધાં છે. પત્રોના રૂપને અખંડિત રાખવાનું પ્રયોજન એમાં હોય તો અને કૌસમાં પણ દર્શાવવું જોઈએ. વળી આ સંપાદનની એક મોટી મર્યાદા સંદર્ભના સંપૂર્ણ અભાવની છે. કિ. હું આવું છું. (બંડ : ૧/૨, સં. વિનોદ મેધાણી, હિમાંશી શેલ્ટ, ગુર્જર, નવસંસ્કરણ, ૨૦૦૩) પત્રસંચયને દર્શના ધોળકિયાએ જોયો હોત તો સંપાદકના અથાક પુરુષાર્થનો તેમ સંપાદકીય કુનેહનો એક અંદાજ એમને મળી શકત. એ સંચયમાં એકએક વ્યક્તિ, એકએક સ્થળ અને બધી ઘટનાનો સંદર્ભ ફૂટનોટમાં દર્શાવીને સમગ્ર હકીકતને સ્પષ્ટ કરી આપેલી છે. અહીં તો, પુસ્તકોના અનુવાદો, સર્જનાત્મક કૃતિઓ, વ્યક્તિઓ અને સ્થળોની વિગતો કોઈ પણ પ્રકારના સંદર્ભ વિના જેમની તેમ મૂકી દેવામાં આવી છે ! અહીં દેવશંકરભાઈ, બાબુ, કરુણાશંકર કોણ છે ? રજની કૃતિનો શો સંદર્ભ છે ? કવિરાજભી સંબોધાયેલ પત્રો નહાનાલાલને ઉદ્દેશીને લખાયાનો સંશય ઊભા કરે પણ કાન્તના પત્રોમાંથી એ વિગત છે કે છેડ છેડ પ્રાપ્ત થાય છે કે કવિરાજ એ ત્રિભુવન પ્રેમશંકર છે. સંબોધન વિનાના પત્રો કોને કોને લખાયા છે એ પણ શોધી કાઢવાનું રહે અને એનો સંદર્ભ આપવાનો રહે. ગોપનાથ કાન્તને રમણીય સ્થળ લાગે.

છે. આ સ્થળને તે અતીવ સુંદર કહે છે પણ એમની સાથે જો કલાપીનો સંદર્ભ પણ એકાદ પંક્તિમાં આયો હોય કે કલાપીને પણ ગોપનાથ અત્યંત પ્રિય રહ્યું છે. એ ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાનું સમુદ્ર સ્થળ છે. તો કદાચ વાચક કાન્તની સાથે જેટલો અહીં જોડાય છે એનાથી વિશેષ નિકટથી જોડાઈ શક્યો હોત.

કાશ્મીર પ્રવાસે ગયેલા કાન્ત પાણા ફરતી વેળા તા. ૨-૩-૬-૧૮૨૨ રોજ દુર્ભાર્યે મૃત્યુ પામ્યા. અહીં તા. ૨-૬-૧૮૨૨ તારીખ સુધીના પત્રો અને તારીખ વિનાના પત્રો કાન્તનો પત્રલેખનપ્રેમ પ્રગત કરી રહે છે. પત્રોના આ વિપુલ રચિયાં કાન્તની સ્વભાવગત નબળાઈઓનો ઢાંકપિઠોડો નથી. વસનનો ઉદ્દેશ, મહારાજા ભાવસિંહજી અને દીવાન પણણીજી સાથેની ઘટનાઓ, નોકરી અંગે સતત લટકતી રહેલી તલવાર, શાતિજનો અને કુટુંબીજનોની આકરી તાવડીમાં મુકતા કાન્ત સ્નેહી મનુષ્યનો અનુભવ આપે છે. એક સમર્થ પંડિત, એક ઉત્તમ કવિની તેમ એ વત્સલ મનુષ્યની ભયોજજવલ જીવનનિષ્ફળતા આ પત્રોમાં પામી શકાય એમ છે. એ દસ્તિએ એનું મોટું મૂલ્ય છે. પરંતુ આ દસ્તાવેજ મૂલ્યને અધિક વધારનાનું ‘સંપાદન’ પણ વધુ વ્યવસ્થાપન્યું હોત તો સારું.

□

**મરમી શબ્દનો મેળો : નિરંજન રાજ્યગુરુ ડેમી ૨૬૮, રૂ. ૧૪૦**

**ગુજરાતનો સમૃદ્ધ વાર્ષિકયવારસો : નિરંજન રાજ્યગુરુ ૩. ૧૪૪, રૂ. ૭૫**

બંનેના પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૧

### સંદર્ભ, સ્વાધ્યાય અને સૂઝના સવાલો

નરોત્તમ પલાણ

હજાર વર્ષની ગુજરાતી ભાષા, એને સંસ્કૃત, પ્રાકૃત, અપભંશ દ્વારા વારસામાં મળેલું સાહિત્ય અને પછી મર્યાદિમારી, પશુપાલન, ખેતીવાડી, વેપારવાણિજ્યના અનુભવથી ઉદ્ભવેલું લોકસાહિત્ય, વ્યક્તિવિશેષ એવા સર્જકો દ્વારા સર્જયેલું શિષ્ટસાહિત્ય, આ સાહિત્યના પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન પ્રવાહો, આ પ્રવાહોમાં

ચારણ, બારોટ, જૈન, વૈષ્ણવ, પારસી, મુસ્લિમ સર્જકોનો ફાળો, ભજનમંડળી અને ભવાઈમંડળીનાં વિશેષ પ્રદાનો, એના રાગઢાળ ગાન છંદ નર્તનના આભને આંબતા પ્રયોગો – આશરે બે લાખ ચો. ક્રિ.મિ.નો આ ‘ગુજરાત’ પ્રદેશ અનેકવિધ બોલીઓ, શબ્દો, સાહિત્ય અને સંસ્કૃતિથી છલકાતો નિધિ છે.

સંદર્ભ

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ ૨૫

પણ હાય, કમનસીબી : એના સંશોધકો ક્યાં ?

સંશોધનના નામે આજે આપણી યુનિવર્સિટીઓ ઘાસલેટી સાહિત્ય પ્રસિદ્ધ કરી રહી છે, ત્યારે યુનિવર્સિટી વિહીન અને સ્વેચ્છાએ સંશોધનને વરેલા નિરંજન રાજ્યગુરુ ‘રિચર્સ – આર્ટિકલ્સ’ના બે સંચયો લઈને આવે તે ભારે આવકાર્ય છે. આ કેતે કામ કરતા જે બે-ચાર મિન્ટો, તેમાં નિરંજન રાજ્યગુરુ (જ. ૧૮૫૪) પ્રમાણમાં યુવા અને મધ્યકાળીન પદ-ભજનના રાગઢાળથી જ્ઞાત અભ્યાસી છે. સ્વાભાવિક છે કે એમના તરફની આપણી અપેક્ષા ઘડી મોટી હોય.

‘મરમી શબ્દનો મેળો’ (ગુજરાતનું પરંપરિત સંતસાહિત્ય)માં ૨૧ અને ‘ગુજરાતનો સમૃદ્ધ વાડુમય-વારસો’ (ગુજરાતનું લોકસાહિત્ય અને ચારણસાહિત્ય)માં ૧૪ લખાણો છે. કુલ ઉપ લખાણોનાં આ ૪૧૨ પૂછો આપણી અપેક્ષા સંતોષવામાં થોડાં સર્ફણ, વધુ નિષ્ફળ રહે છે. અહીં અભ્યાસના બોગે યાદીઓ અને ગણતરીઓ વિશેષ છે, તેમ સંદર્ભ, સ્વાધ્યાય અને સૂર્યના સવાલો પણ છે.

આ બંને પ્રકાશનોનો ચાવીરૂપ પ્રથમ લેખ ‘મધ્યકાળીન ગુજરાતી ભક્તિ કવિતા’ સ્વાધ્યાયનો અભાવ સૂચવતો એક નિકૃષ્ટ લેખ છે. આરંભથી જ અહીં – ‘ભક્તિ’ ઉપર ઉિતરી જવાયું છે અને ‘અભ્યાસી’ના બદલે ‘ઉપદેશક’નો રોલ અદ્ય થતો જણાય છે ! સમગ્ર લખાણમાં ક્યાંય ‘ભક્તિકવિતા’ એરણ ઉપર આવતી નથી. દુઃખદ તો એ છે કે ‘ભક્તિ’ની કોઈ શાસ્ત્રીય ચર્ચા કે તેના વિકાસનાં બિન્દુઓ અહીં ચર્ચાતાં નથી. ‘ભક્તિ’માં શુંગાર કયારે, શુંગારમાં વાત્સલ્યની સ્થાપના કોનાથી – આના વિશે અહીં કશું જ નથી ! ‘ગૌણી’, ‘પરા’ / ‘વૈધી’, ‘શાગનુગા’ / ‘વિહિતા’, ‘અવિહિતા’ – આને લગતું ભક્તિસાહિત્ય કે એનો વિર્મશી તો શું, ભક્તિના આ પ્રકારોનો નામોલ્લેખ સુધ્યાં અહીં નથી ! આપણી રસશાસ્ત્રીય વિચારણામાં ‘ભક્તિ’ની ‘રસ’ તરીકેની ગણના એક બહુ મોટો વિકાસ છે. કાવ્યશાસ્ત્રના આપણા આચાર્યોએ ‘ભક્તિરસ’ને ઊર્ધ્વકૃત શુંગાર કહ્યો છે અને રહસ્ય તો એ છે કે એમાં શુંગાર કરતાં વાત્સલ્યની સર્વોપરિતા સ્વીકાર પામી છે ! નિરંજન રાજ્યગુરુ તો

‘આર્યધારા’ અને તેની સામે ‘બ્રાહ્મણોત્તર જાતિઓ – નીચલા ગણાતા થર’ની પરંપરાને (પૃ. ૨) મૂકીને એક અશાસ્ત્રીય અને ઊંચાઊચા ભેદભાવથી કલ્લુષિત ખ્યાલ રજૂ કરે છે. ‘ભક્તિ’માં જાતિપાતિની ગણના નથી ત્યાં ‘બ્રાહ્મણ-બ્રાહ્મણોત્તર’ શબ્દો યોજવા કે ‘દેવી-દેવલા, વીર-પીર, દાનવ, ડાક્ષા, ભૂત-પ્રેત, ભૈરવ’ (યાદ રહે : આ રાજ્યગુરુના શબ્દો છે.) તથા ‘પ્રકૃતિના જળ-સ્થળ-પથર-કુંગર-વૃક્ષ-અજિન-સૂર્ય-વાયુ-આકાશ’ આદિની અપ્રસ્તુત ગણતરી, સામાન્યતામાં સરી પડતી અનુભવાય છે. રાજ્યગુરુ આગળ લાખે છે : ‘ભક્તિ, પ્રકૃતિનાં ઉપર ગણાવ્યાં એ વિવિધ તત્ત્વો પ્રયેની હોય કે લૌકિક દેવી-દેવતા, કુળદેવી-કુળદેવતા, શૂરાપૂરા, મંદિર, મેળા, સમાવિ, મંડપ, પોતાના પૂર્વજીન-પિતૃઓ, વિધિ-વિધાનો, અનુષ્ઠાનો, લૌકિક કિયાંડાંડો, સંતો, ભક્તો, સંતસ્થાનો, ભૂત-પ્રેત-ડાક્ષા, વીર, મેલડી, ચુદેલ, ભૈરવ કે ભૂવા-ભગત પ્રત્યેની હોય.’ (પૃ. ૩) જોઈ શકાશે કે અહીં કોઈ વિવેક નથી કે નથી ‘ભાવ’ અને ‘ભક્તિ’ વચ્ચેના તંત્ત્રવતની જાહેરારી ! નિરંજન રાજ્યગુરુ પંક અને પંકજને એક ગણે છે !

‘ભક્તિપ્રધાન સંત કવિતા’, ‘સંતકવિતા’ : પ્રકારો અને લક્ષણો’, ‘સંત વાણીનું સત્ત્વ અને સૌંદર્ય’ તેમજ ‘સૌરાષ્ટ્રનું પ્રાચીન ભજનસાહિત્ય’ અનેકવિધ માહિતી અને સંખ્યાબંધ ભજનપંક્તિઓના ઉલ્લેખથી આ લખાણો ઉપાદેય તથા રોચક બનેલા છે. અહીં એમની રજૂઆત પણ સરળ અને પ્રવાહી છે. એમ લાગે છે કે નિરંજન રાજ્યગુરુ ભજનના માણસ છે, આ એમની ઓળખાણ છે. અલબંત, ‘ભક્તિપ્રધાન સંત કવિતા’ અસ્પષ્ટ પ્રયોગ જાળાય છે. હિન્દી વિવેચનાએ ‘શાગુણ્યધારા’ અને ‘નિર્ગુણ્યધારા’ એવી સંશાઓ યોજાને ‘ભક્તિપ્રધાન કવિતા’ તથા ‘શાનપ્રધાન કવિતા’ની ચર્ચા કરી છે. આપણે ત્યાં સુરોશ જોશીએ ‘પ્રેમાશ્રી’ અને ‘શાનાશ્રી’ એવી ભેદરેખા સ્વીકારી છે. અહીં ‘ભક્તિપ્રધાન’ અને તે પણ ‘સંત કવિતા’ સ્પષ્ટ થતું નથી. લેખકની મુજબશ કદાચ ‘સંત કવિતા’ને ભક્તિધારામાં મૂકવી કે શાનધારામાં તેની છે, વાત્સલ્યમાં સંતકવિતા ‘સ્વાનુભવની કવિતા’ છે, તે સ્વાનુભવ ભક્તિપ્રધાન અગુણધારાનો હોય કે શાનપ્રધાન નિર્ગુણધારાનો, એમાં મંત્ર-તંત્ર હોય કે હઠયોગ, ખુદની ‘સ્વાનુભૂતિ’ શું છે તે જ અહીં ગવાતું હોય છે.

‘મહાપંથ’ વિશેના બે લેખ, તેમજ પ્રથમ લેખમાં આવી જતી ‘સંત કવયિત્રીઓનો વાક્યો’ને જરા વિસ્તારીને મુક્યેલો ત્રીજો લેખ આડીઅવળી માહિતી અને પુનરૂક્તિથી દૂષિત બનેલા છે. ‘મહાપંથ’ને અતિ પ્રાચીન માનવામાં વૈચારિક સ્પષ્ટતા નથી. આપણે એમ કહીએ કે ‘આર્થસમાજનાં મૂળિયાં અતિ પ્રાચીન છે, કારણ કે એમાં વેદ-વેદાંતનો સ્વીકાર થયેલો છે, તો ?’ પુષ્ટિમાર્ગમાં ભાગવત કેન્દ્રસ્થાને છે એટલે ‘પુષ્ટિમાર્ગ’ને ભાગવત જેટલો જુનો માની શકશે ? આવી જ રીતે ‘મહાપંથ’માં શાક્તમત કે બીજમાર્ગનો સ્વીકાર હોવામાત્રથી તેને ‘અતિ પ્રાચીન’ માનવો દોષમુક્ત નથી. ઐતિહાસિક દસ્તિએ ૧૮૦પથી મહાપંથ, ૧૪૮૮થી પુષ્ટિમાર્ગ અને ૧૮૭૫પથી આર્થસમાજ છે. એમ લાગે છે કે સંશોધકે ‘માન્યતા’ તથા ‘ઈતિહાસ’ બંનેને નજર સામે રાખીને ચાલવું ઘટે.

‘વીજળીના જબકારે મોતીદાં પરોવવાં, પાનબાઈ !’ એવી સમર્થ કાવ્યપંક્તિ આપનાર, કવિ કલાપીનાં પૂર્વજ અને ૧૮૮૫માં લાઠીની ગાડીએ કલાપીનો રાજ્યાભિષક થયો તેના આગલા વર્ષે ૧૮૮૪માં સમાધિ લેનાર ગંગાસતી મધ્યકાલીન કવિતાધારાનાં એક તેજસ્વી કવિ છે. આ ગંગાસતી ‘મહાપંથ’માં દીક્ષિત હતાં કે નહિ તેની એક ચર્ચા અહીં ‘ગંગાસતી અને મહાપંથી પરંપરા’માં મળે છે.

ગંગાસતીનું ઐતિહયમૂલક જીવનચરિત્ર લખનાર મજબૂતસિંહજ જાડેજા, ગંગાસતીની રચનાઓનું ‘અધ્યાત્મ દર્શન’ કરાવનાર સુપ્રસિદ્ધ લેખક અને સાધક ભાષાદેવજી તથા અન્ય અભ્યાસીઓ, સાધકી વગેરે ગંગાસતીને મહાપંથ સાથે સંબંધ નથી એમ માને છે. આ મતની સામે અહીં ચર્ચા છે. લેખક માને છે કે ‘સતી’ એવું નામ, રચનાઓમાં ગુરુમહિમા તથા ભજનના પારિભાસિક શબ્દોનો વિનિયોગ વગેરે ગંગાસતી મહાપંથી હોવાનું સૂચવે છે. આ ચર્ચામાં લોયણ અને ગંગાસતીની રચનાઓનો જે તુલનાત્મક અભ્યાસ છે તે ઘણ્ણો સમર્થ અને સ્વતંત્ર અભ્યાસની ક્ષમતા ધરાવે છે. આ તુલનામાં પુનઃ ભજનિક નિરંજન રાજ્યગુરુનો અનુભવ થાય છે, પરંતુ ગંગાસતીને મહાપંથી સ્તિદ્વ કરવા જે મુદ્દાઓ છે તે નિર્ણાયક જગ્ઞાતા નથી. આપણા મધ્યકાલીન સાહિત્યમાં ‘સતી’ શબ્દ પાર્વતી, મદાલસા, મંદોદરી, સાવિત્રી, સુભ્રતા

તેમજ ઉજળી, રાણક, સોનલ વગેરે માટે યોજયેલો છે. ‘સાહેબ’ શબ્દ જેમ માત્ર કબીરપથી નથી, તેમ ‘સતી’ શબ્દ પણ માત્ર મહાપંથી નથી. સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ગરાશિયા પરિવારમાં, ‘સતી’ વિધવા માટે વપરાતો માનવાચક શબ્દ છે. વળી, ગુરુમહિમા-નિરૂપણ હોય કે ન હોય, નામાચરણમાં પણ ગુરુનામનિર્દેશ હોય કે ન હોય – આ પણ સામાન્ય પરંપરા છે, તે નિર્ણાયક મુદ્દો બની શકે તેમ નથી.

‘ગુજરાતનું ભક્તિસંગીત – થોડું સિંતન, થોડી ચિંતા’ એક સમૃદ્ધ લેખ છે અને નિરંજન રાજ્યગુરુ લખી શકે એવો લેખ છે. ઐતિહાસિક દસ્તિએ ગુજરાતના ભક્તિસંગીતનો આરંભ નરસિંહ મહેતાથી છે તે ભૂલવા જેવું નથી. બૈજુ બાવરો પણ ગુજરાતનો નાગર હતો અને ભજનગાયકીમાં અનિવાર્ય એકતારો તથા રાગ ‘પરજ’ સ્વામી હરિદાસ (ઈ. સ. ૧૫૦૦માં હ્યાત) પાસેથી બૈજુ ગુજરાતમાં લાય્યો તે માન્યતા પણ ગુજરાતનું ભક્તિસંગીત સ્પષ્ટ કરવા માટે ધ્યાનમાં લેવા જેવી હતી. અત્યારે ગાંધીજી અને ભજનિકોને યાદ કર્યો હોત તો આ ગ્રંથનો આ એક સંઘેડાઉતાર લેખ બનત.

સંતવાણીમાં પ્રેમતત્ત્વ, સંતપરંપરામાં શ્રીકૃષ્ણ, ભજનવાણીમાં શિવ તથા શક્તિઉપસના – સાવ સામાન્ય લખાણો છે. આ લખાણોનાં ઘણાં વિધાનો, લેખક પોતે જ આગળ કરેલાં વિધાનોની વિરુદ્ધમાં પડે છે. ‘શુદ્ધ ભક્તિમાર્ગ કવિઓ’ અને કબીર, રૈદાસ તથા રવિભાગ પરંપરાના કવિઓને યોગ્ય રીતે જ અહીં જુદા અને ‘સંત’ ગણાવ્યા છે, (પૃ. ૧૩૭) જ્યારે આગળ આવા ભેદોને ‘સંકુચિત વ્યાખ્યા’ કહીને હસી કાઢવામાં આવ્યા છે. (પૃ. ૧૬) એમ લાગે છે કે ‘સંતવાણી’નું કોઈ સ્પષ્ટ દર્શન લેખક પાસે નથી. ધર્મપંથોની લાંબી લાંબી યાદી મૂકી છે, પણ એની ઉપાસના પદ્ધતિ વિશે ભજસેણ, નવરાત્રિનો ઉત્સવ ૧૨મી સદીમાં ચાલુ હોવાનો ઉત્સવ ‘નારિદિન નારિરતા લોક પૂજે’ એમ ‘વિસલદેવરાસો’માં પ્રાત્ત હોવા છતાંય કવિ વત્તલભ ભજના સમયથી (૧૮મી સદી) ગુજરાતમાં નવરાત્રિના રીતસરના ઉત્સવો શરૂ થઈ ગયા – જેવાં અનૈતિહાસિક વિધાનો; કાળકમનો અભાવ (દ્યારામ પદ્ધી ભાલણ);

અધોરી અને વૈજ્ઞાવ બધા એક થેલામાં અને સતત આમતેમ થયા કરતી-ગુંચવાતી મતિ (ચંચલતા?) - અભ્યાસનો આકાર બંધાવા દેતાં નથી.

છેલ્લે મુકાયેલાં બે સંગીતરૂપકો અને ભોજા ભગતની રચનાના આસ્ત્વાદમાં પ્રયોજાયેલી શૈલી પણ આ ગ્રંથને અનુરૂપ નથી. પરિશિષ્ટ-એકની સંદર્ભસૂચિમાં ‘મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા’ વિરોના ગ્રંથો ખાસ કરીને આ જ શીર્ષકથી ૧૮૮૨માં પ્રસિદ્ધ થયેલો જગદીશ શાહનો મહાનિબંધ અને ગંગાસતીની રચનાઓનું તત્ત્વદર્શન ચર્ચતા ભાષાદેવજી તથા સ્વામી બ્રહ્મવિદાતાજીના ગ્રંથો જરૂરી હતા. પરિશિષ્ટ-બેમાં નરકિંહથી સાલવારીનો આરંભ થયો હોત તો એક ઉત્તમ કામ બની આવત. આ સૂચિમાં જે કવિ નથી તે જલારામની સાલવારી છે અને જે કવિ છે તે ભોજા ભગતની સાલવારી નથી ! અંદરની સામગ્રીમાં એક અને અહીં સૂચિમાં બીજી એમ વિરોધાભાસી સાલવારી પણ મળે છે. પૃ. ૨૨૨ ઉપર મૂળદાસ વિ. સં. ૧૬૦૫, ઈ. સ. ૧૫૪૮ છે, જ્યારે સૂચિમાં વિ. સં. ૧૭૧૧, ઈ. સ. ૧૬૫૫ છે ! અનુક્રમમાં અને મૂળ દેખમાં શીર્ષકભેડ પણ જોવા મળે છે. ખુદ ટાઈટલ પણ ‘મરમી શબદનો મેળો (ગુજરાતનું પરંપરિત સંતસાહિત્ય)’ અને અંદરના ટાઈટલમાં ‘મરમી શબદનો મેળો’ તથા ‘ગુજરાતનું સંત સાહિત્ય. સત્ત્વ, તત્ત્વ, સૌંદર્ય, કલા અને કસુબ’ એમ છે તથા નીચે ‘ગુજરાતી સંતવાણી – ભક્તિકવિતા વિરોના વકતયો – લખાણોનો સંચય.’ ક્યાંય એકવાક્યતા કે ફરી વિચારવાની ધીરજ નથી. આ બધું નિરંજન રાજ્યગુરુનું ગાંભીર્યના ભોગે ચબરાક્યાં વધું હોવાની પ્રતીતિ કરાવે છે.

□

નિરંજન રાજ્યગુરુનું બીજું પુસ્તક ‘ગુજરાતનો સમૃદ્ધ વાડુમય વારસો’ લોકસાહિત્ય, ભવાઈ, સંતસાહિત્યમાં ચારણસર્જકો અને ગાયકોનું પ્રદાન, બારોટી સાહિત્ય અને છીલ્લા ત્રણ લખાણોમાં એક વ્યક્તિવિશેષ કાનજીભાઈ બારોટ વિશે, એક વાર્તા અને એક ‘ચારણી સુદામાચારિત’નું અવલોકન છે. વચ્ચે ‘સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં અઝીણના સેવનની પ્રથા’ પણ છે. જોઈ શકાય છે કે આ કોઈ અભ્યાસગ્રંથ નથી, પણ સૌરાષ્ટ્રના કટાવ

ભરતકામ જેવું જુદીજુદી આકૃતિઓ અને રંગબેરંગી કાપડના ટુકડાઓ કાપીને એકબીજા સાથે જોડીને કે ચોંટાડીને બનાવેલો સંચય છે. કટાવકામમાં મૂળની સામગ્રી તો તેથાર હોય છે, એને કેવી રીતે કાપીને ક્યાં ચોંટાડવામાં આવે છે એમાં જ કલા અને કસુબ હોય છે. મેઘાણી, જ્યામલ્વ પરમાર, પુષ્કર ચંદ્રવાકર તથા જેનો નામોલ્લેખ નથી એવા બીજા ઘણા લોકગુજરેટી વિવેચની દ્વારા ચર્ચાઈ ગયેલા મુદ્દાઓ અહીં છે. નિરંજન રાજ્યગુરુની વિશિષ્ટતા અગાઉના મુદ્દાઓને સાંકળવામાં અને સંગીતતત્ત્વના ઉમેરણમાં રહેવી છે. એમણે આ ક્ષેત્રોના સંશોધનની અને સંપાદનની મુશ્કેલીઓની વાત પણ જાત-અનુભવ ઉપરથી કરી છે, તે ઉપરોગી છે. હસુ યાચિક જેવા લોકસાહિત્ય અને લોકસંગીતના જાણકાર આપણી પાસે છે, પણ નિરંજન રાજ્યગુરુ પાસે જે લોકસંપર્ક છે તે તેમાં લખાણોને જીવંત બનાવે છે. એમનાં અમુક નિરીક્ષણો નોંધવા જેવાં છે :

- વગ્કિકરણ ન થઈ શકે એટલું વૈવિધ્ય લોકસાહિત્ય જાળવે છે.
- લોકસંગીત – પશુપંખી પ્રકૃતિના – જુદાજુદા ધ્વનિ સંકેતો દ્વારા જન્મ પામ્યું છે.
- લોકગીતો બહુધા પાંચ કે તેથી ઓછા સ્વરોમાં સીમિત હોય છે.
- લોકસંગીતમાં શાસ્ત્રીય રાગોની છાયા દેખાય, પરંતુ એ શાસ્ત્રીય રાગોના શુદ્ધ બંધારણ મુજબના સ્વરો નથી.
- વીસમી સદીના અંત સુધીમાં લોકગીતોના ૪૦૦, લોકવાર્તાના ૩૦૦, લોકભવાઈ અને લોકકહેવતોના પાંપ સંગ્રહો પ્રકાશિત થયેલા જોવા મળે છે.
- લોકગીતો સમૂહગાન, ભજનો વ્યક્તિગાન છે.
- લોકગીતોમાં પાઠાંતર અનિવાર્ય, જ્યારે સંતવાણી – ભજનોમાં પ્રમાણમાં ઓછાં પાઠાંતરો.
- ભવાઈ – અસાઈના સમય પહેલાં પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં લોકનાટ્યની જૂની પરંપરા સચવાઈ હો એવા નિર્દેશો પ્રાચીન મંદિરોના શિલ્પ-સ્થાપત્યોમાં મળી આવે છે.
- સાહિત્ય અને સંસ્કૃતિને જાળવનારી પરંપરાઓમાં ચારણ એક એવી જાતિ છે જેણે એક તરફથી શુદ્ધ શાસ્ત્રીય અભિજાત સાહિત્ય સાથે તો બીજી તરફથી લોકજીવન સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સંબંધને કારણે

- લોકસાહિત્યને તથા લોકપ્રિય – લોકભોગ્ય સાહિત્યને પણ જીવતું રાખ્યું છે.
- ચારણોમાં બે પ્રકારના સર્જકોની ભજનવાળી આપણને પ્રાપ્ત થાય છે. એક તો પોતે જ સંતકવિ હોય, સંતસાધનાના ક્ષેત્રમાં સાધના કરીને અનુભૂતિ મેળવી હોય. બીજા એ કવિઓ છે જેમણે અધ્યાત્મસાધના નથી કરી પણ પોતાની કવિત્વશક્તિના બણે અનેક ઉત્તમ ભક્તિરચનાઓ આપી છે.
- બારોટ : જીવંત ઈતિહાસ ધરાવતી એક સમૃદ્ધ લિખિત પરંપરા.
- બારોટની વહીમાંનું લખાડા એટલું બધું સંક્ષિપ્તમાં અને સાંકેતિક ભાષામાં હોય કે બીજા કોઈ ઉકેલી શકે નહીં.
- કનજીભાઈ બારોટ : ટેરવાં ને તંતુની જુગલબંદી.

લોક, ચારણ, બારોટ, સંત એમ અનેક પરંપરાઓની સમૃદ્ધ જાણકારી નિરંજન રાજ્યગુરુ ધરાવે છે અને ‘જે પોષતું તે મારતું’નો ઘાટ પણ એમની સમજમાં તથા ભાષામાં પ્રશ્નો ઊભા કરે છે. ઉપરનાં નિરીક્ષણોમાં ‘સાહિત્ય અને સંસ્કૃતિ’ તથા ‘ચારણોના બે પ્રકારનાં અવતરણો જુઓ, સ્પષ્ટતા નથી. અહીં

બહુશુત્તતાના કારણે જન્મેલા દોષો વિચારોમાં સંકરતા પેદા કરે છે અને તે ભાષાને સરળ રહેવા દેતા નથી. એમને એકસાથે બધું કહી દેવું છે એટલે વારેવારે યાદીઓ ટપકી પડે છે ! સૌથી મોટી મુશ્કેલી સ્પષ્ટદર્શનની છે. અહીં લોકસાહિત્ય અને ચારણસાહિત્ય વિશે સ્પષ્ટતા નથી. લોક ‘વાર્તા’ (વૃત્તાંત) છે અને ચારણ ‘કથા’ છે. લોકવાર્તાનો કોઈ ખાસ કથક નથી તે પીપળાના થડ પાસે બેઠેલી તોશી પણ કહે અને ઢોર ચારતો ગોવાળ પણ કહે, જ્યારે ચારણ ‘કથા’ છે, કારણ કે તેનો ખાસ ‘કથક’ છે. ચારણીકથા માત્ર ડાયરાની ચીજ છે, જ્યારે લોકવાર્તા પાણીસેરડે, તુલસીક્ષ્યારે, વાટ કાપવા કે વનવગડે પણ સાંભળવા મળે, એનો કોઈ ખાસ ‘કથક’ નથી, માત્ર ‘વદકો’ છે !

અસ્તુ. લેખક પાસે જાણકારી ઘણી છે, પણ વર્ગીકરણ નથી એટલે સર્વત્ર સંકર રજૂઆત થઈ ગઈ છે. લોકબોલીમાં આને ખીચડો કહેવાય ! ખેર, ભલે ખીચડો પણ નિરંજન રાજ્યગુરુએ રંધી આપ્યો છે, તેનો પણ એક સ્વાદ છે. □

## ૨૪૩૭ = મુંબઈ : અમૃત ગુંગર

અરુણોદય પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૦. ડબલ તેમી ઉંદ્ર, રૂ. ૪૨૫

ઐતિહાસિક, કેલિડોઝોપિક, ધબકતું મુંબઈ  
વિનીત શુક્લ

મમ્માઈ, મન્બાઈ, મયામ્બુ, મોમ્બાઈમ, મોમ્બાય, બોઓ બાઈમ, બોઓવિડા, બોમ્બાહિયા, બામ્બાઈમ, બોમ્બેઈમ, બોમ્બે યે, બૂન બે, બમ્બાઈ, સ્લમ્બે, બોમ્બે, મુંબઈ, મુંબાઈ, મોંબાઈ.

આખા ભારતના માનીતા અને ગુજરાત તથા ગુજરાતીઓના થોડાક વધુ માનીતા, મુંબઈનાં આટલાં બધાં નામો આજ સુધીમાં પ્રચલિત થયાં છે એમ આપણને કહેવામાં આવે તો આપણા માનવામાં આવે ? નહીં ને ?

પરંતુ એ હકીકત છે અને આ પુસ્તક ખૂલતાં જ એ બધાં નામ આકર્ષક રીતે મુકાયેલાં નજરે પડે છે.

મુંબઈનાં ઈતિહાસ અને ભૂગોળની, સમાજ અને વ્યવહારની, એના મહત્વની ને એના પ્રદાનની કંઈ કેટલીય જાઇટી-ઓછી જાણીતી-અજાણી, ધ્યાનપાત્ર ને સ્મરણીય, આનંદપ્રેરક ને વિચારમાં દુબાડતી ને વિષાદપ્રેરક વાતોની હારમાળા આ પુસ્તક રજૂ કરે છે. હા, મુંબઈનું સર્વ અને સતત - ચોવીસે કલાક ને સાતે દિવસ.

‘મુંબઈ સમાચાર’માં દર શનિવારે પ્રગટ થતી એમની કટાર ‘ડીપ ફ્લોકસ’માં લખાયેલા લેખાંકોનું જરૂરી સુધારાવધારા, વિષયવાર વર્ગીકરણ અને આયોજન કરીને અમૃત ગંગારે અને આ પુસ્તકરૂપ આપ્યું છે.

પુસ્તકના લેખાંકો ૧૫ વિભાગોમાં ને એનાં, બધાં મળીને, ૧૧૦ જેટલાં પ્રકરણોમાં વિભાજિત છે. ને એ રીતે મુંબઈનું એક સર્વાશ્રેષ્ઠ દર્શન એમાં કરી શકાય છે. એમાં ‘મુંબઈ અને ગાંધીજી’ જેવો, પાંચ પ્રકરણોમાં મુકાયેલો ઐતિહાસિક વિભાગ છે તો ‘જૂનાં ઈરાની રેસ્ટોરાં અને બેકરીઓ’ જેવા વિલક્ષણ, રસપ્રદ માહિતીવાળો વિભાગ પણ છે, ‘ફિલ્મ સ્ટુડિયો’ (૧૨ પ્રકરણો !) અને ‘સિનેમા-સંગીત-નાટક-ચિત્રકલા’ જેવા વિભાગોની સાથેસાથે દેશી-વિદેશી લેખકોની નજરે મુંબઈ’ જેવા વિભાગો પણ છે. ‘ઈમારતો અને ઈતિહાસ’નાં નવ પ્રકરણોમાં ભૂતકાળથી વર્તમાન તરફ આવતો રસપ્રદ ઈતિહાસ છે તો સૌથી વધુ પ્રકરણો – ૨૨ પ્રકરણો – વાળા ‘થાપુ અને પરાં’ નામના વિભાગમાં ‘ફોર્ટ’થી લઈને ‘કાંદીવલી – અ સોનેટોરિયા સબર્બ’ સુધીનું ફ્લક આખા મુંબઈને એની લાક્ષ્ણિકતાઓ સાથે આવરી લે છે ! પરિશિષ્ટમાં, છેલ્લે સંદર્ભસૂચિ તથા વ્યક્તિ-ફિલ્મ-નાટક-સ્થળ-સંસ્થા નામોને સમાવતી શબ્દસૂચિ.

આના પરથી પુસ્તકનાં વ્યાપ અને વૈવિધ્યનો ખ્યાલ આવી જશે. એ બધું રસપૂર્વક વાંચતાં લેખકની અભ્યાસનિષ્ઠા, સમાજનિષ્ઠા અને સર્જકતા સાથેની જીવંત કરી સ્પષ્ટ થાય છે. દરેક વિભાગ સાથે મૂકેલી નાની ચિત્રતસવીર સાથેની વિગતવાર અનુકમણિકામાંથી પસાર થતો વાચક પોતાના મનપસંદ વિષય, સ્થળ કે વ્યક્તિ સુધી સીધો પહોંચી શકે છે.

ઊરીને આંખે વળજે ને દિવમાં ચોંટી જાય એવી વિગતો – વાતો આ પુસ્તકમાં ટેરટેર છે. થોડી જોઈએ :

- ૧૮૮૭માં મહારાઝના ગણેશોત્સવનો આરંભ નવા પાયે પણ મુંબઈની કેશવજી નામક ચાલમાં થયો હતો. [...] ૧૮૮૨માં આ ચાલવાસીઓએ ગણેશોત્સવની શતાબ્દી રંગેંગે મનાવી હતી. (પૃ. ૧૬૧)
- ૨૦૦૫માં ખુલ્લા મુકાયેલા મુંબઈના જે. જે. ફ્લાયઓવરને મહારાઝ સરકારે મખદૂમાલી

માહિતીના નામે કરીને (મૂળ કોંકણના) આ સૂક્ષી સંતને સલામી ભરી છે [...] ૨.૧ ડિ.મી. લંબાઈનો આ ફ્લાયઓવર ભારતનો સૌથી લાંબો માર્ગસેતુ ગણાય છે. (પૃ. ૧૭૯)

- પાછારે પ્રમુખો મુંબઈમાં સ્થિર થયેલા આરંભના લોકોમાંના એક પોતાને પાછારે કે પાછાને કહે છે કારણ કે તેમનાં મૂળ પાટણ (ગુજરાત)નાં હતાં, પૈઠણ (દાખણા)નાં નહીં (પૃ. ૧૮૦)
- કાંદીવલીમાંથી મળેલા ઘણા પથરો મધ્ય પેલિયોલિથિક યુગના મોટા પથરોના પાતળા કકડા કે તેની પતરીઓ છે, જે બ્રિટિશ મ્યુઝ્યુલિયમમાં જોઈ શકાય છે.’ (પૃ. ૧૮૫)

સાહિત્ય અને કળાઓ, ઈતિહાસ અને પુરાતત્વ, સમાજ અને નાગરિકધર્મ જેવા વિવિધ વિષયોમાં અમૃત ગંગરનાં જીવંત રસ અને જાગૃતતાના ફળસ્વરૂપે પુસ્તકમાં આપણને કેટલાંક રસપ્રદ નિરીક્ષણો મળે છે. એમાં એક કલારસિકની સંવેદનશીલતા પણ લિલાઈ છે :

- ભારી બજાર જવાનું થાય તો કાન જરૂર સરવા કરજો. ભૂતકાળના કોઈ ખૂણોખાંચરેથી આપણી નગરી મુંબઈના ભીડીબજાર ઘરાકાળના રાગો હોય અને એમની બંદિશો કદાચ સંભળાય. ઈતિહાસ ભવિષ્યના ભૂતમાં ગુજરતો હોય છે... હેમાયે... હેમ અને ખેમ. (પૃ. ૧૪૪)
- સવાલ એ છે કે શું આપણું શહેર દેખીતા ચણકાટ પાછણ માનવીય નિસાસા સંભળવાની સંવેદનશીલતાને કાયમ રાખી શકશે ? (પૃ. ૧૬૭, ‘ચિંચ પૂગળી’)
- સાયનના કિલ્વાની બાંધણી ખૂલ રસપ્રદ છે... કમનસીબે આપણી પ્રજાએ કે સરકારે આવાં ઐતિહાસિક સ્થળોની થોડીઘણી પણ સંભળ લીધી નથી અને પરિણામે તે બિસ્માર હાલતમાં પડ્યાં છે. (પૃ. ૧૭૭)
- આજે પણ મુંબઈ શહેરનાં પરાંઓની રાણી વાંદરામાં ફરવું એટલે શહેરના સદીઓજુના ઈતિહાસમાં મજાની ઠહેલ કરવા જેવું છે અને ચલતે ચલતે કદાચ આખરે ‘મુંબઈ શહેર કોનું’ એ પ્રશ્ન ઐતિહાસિક પરિપ્રેક્ષયમાં રહીને પૂછવાનું મન થાય (પૃ. ૧૮૨)
- ‘પરિશિષ્ટ’ વિભાગમાં ‘સાલવારી’ પ્રકરણમાં ઈ. પૂ. ૨૦૦૩થી ઈ. ૨૦૧૦ સુધીની ઐતિહાસિક વિગતો વર્ણનુકમે મૂળીને લેખકે મુંબઈના સમયપટ પર એક વિહંગ નજર નાખવાની ઉપયોગી સુવિધા કરી આપી છે. સંદર્ભની દસ્તિએ એ પ્રકરણ ઘણું મહત્વનું છે.

આ પુસ્તકની સમૃદ્ધ સંદર્ભસૂચિ જોતાં પણ, મુંબઈ અને મુંબઈના વિશેની વાર્તા-વિગતો એકઠી કરવામાં ને આયોજિત રીતે મૂકવામાં લેખકે કેટલી જહેમત ઉઠાવી છે એ સ્પષ્ટ થાય છે.

‘પરિશિષ્ટ’ વિભાગનું ‘મુંબઈ અને ગુજરાતીઓ’ પ્રકરણ વિશિષ્ટ છે. મુંબઈના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય જીવનમાં દરેક સ્તરે, ભૂતકાળમાં અને વર્તમાનમાં, ગુજરાતીઓના ગૌરવવંત પ્રદાનની વાત કરતાં એમણે નોંધ્યું છે : ‘આજે મુંબઈ ભારતની ફાઈનાન્સિયલ રાજ્યધાની બન્યું છે તેની પાછળ એક દીર્ઘ ઇતિહાસ સમાયેલો છે અને એ ઇતિહાસને ઘડનારા ગુજરાતીઓ હતા.’ (પૃ. ૨૬૬) અને મુંબઈમાં સર્વત્ર ગુજરાતીઓ વિશે રૂઢ થઈ ગયેલું એક ‘જૂઠ’ તોડતાં લેખક સાચું જ કહે છે કે, ‘બધા ગુજરાતીઓ પૈસાવાળા એ માન્યતા એક નથું મીથ છે, અસત્ય છે [...] અન્ય લોકો માને છે કે કે ગુજરાતીઓ એટલે કે ગુજરૂઓને પૈસા સિવાય કોઈ વિચારો જ નથી આવતા. તેઓ ખાણીપાણી અને પૈસા માટે જ જીવી જાણે છે. ખોટી વાત’ (પૃ. ૨૬૦)

વેપારઉદ્યોગ સિવાયનાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરનાર ગુજરાતીઓનાં નામો-વિગતો આપી તેઓ પ્રતીતિપૂર્વક કહે છે કે, ગુજરાતીઓએ મુંબઈનાં કલા, કિકેટ, શિક્ષણ અને વિશ્વાનનાં ક્ષેત્રોને વધારે માતબર બનાવ્યાં છે અને તેમનું મૂલ્યાંકન એ સંદર્ભે બંગાળી કે ભારતની અન્ય કોઈ પણ સંસ્કૃત, શિક્ષિત અને પ્રગતિશીલ પ્રજાની સરખામણીમાં જરાપણ ઓછું ન અંકી શકાય. (પૃ. ૨૬૧)

જોકે મુંબઈ જેવા ભારતના સૌથી પચરંગી શહેરના પચરંગીપણાને અમૃતભાઈએ ઠેરઠેર ઉપસાવ્યું છે. વર્તમાનમાં આ પચરંગીપણા પર થયેલા આઘાતોની તેમણે સાખેદ નોંધ લીધી છે. મુંબઈને મુંબઈ બનાવવામાં કયાંકયાંથી આવેલા, કયા કયા લોકોનું કેવું પ્રયંક પ્રદાન છે એની ઘણી જાણીતી - અજાણી વાતો - વિગતો આ પુસ્તકમાં મૂકીને લેખકે ચોક્કસ વિધાયક દસ્તિકોણ રજૂ કર્યો છે.

આ સાથે જ અલબત્ત એક બીજી વાત નોંધવી પડશે. કોઈ શહેર કે સ્થળ વિશેના પુસ્તકમાં ઐતિહાસિક વિગતોનું મહત્ત્વ વિશેષ હોય એ સાચું. મુંબઈ વિશેની ઘણી

જૂની (અને કેટલીક નવી પણ) વાતો આ પુસ્તક થકી એકસાથે હાથવગી થાય છે એ પણ સાચું. પરંતુ બહુધા ભૂતકાળની વિગતોમાં રસ ટકાવી રાખવા વાચકે મથવું પડે છે એય સાચું છે. ઇતિહાસના આવા ‘ઓવરડોઝ’ને સંતુલિત કરવા લેખકે સભાન પ્રયાસ કર્યા છે, પણ એ પૂરા સફળ નથી થઈ શક્યા.

વળી, ‘મુંબઈ સમાચાર’ની કટાર માટે જુદાજુદા સમયે લખાયેલા ને પ્રગટ થતા ગયેલા લેખોમાં ત્યારે નજરે ન ચઢેલાં પુનરાવર્તનો, એ લેખો એકસાથે પુસ્તકરૂપે પ્રગટ થયા છે ત્યારે તરત ધ્યાનમાં આવે છે. પુસ્તક કરતી વખતે આવાં પુનરાવર્તનો કાળજીથી નિવારી શકાયાં હોત. એવી સાફ્સૂહી જરૂરી હતી. ઉપરાંત, કેટલીક શાલ્ફિક અને છાપકામની ભૂલો પણ રહી જવા પામી છે. અમૃતભાઈ અનેક જગાએ ‘ફિલ્મ પ્રગટ થઈ હતી’ લખે છે ત્યાં ‘ફિલ્મ રજૂ થઈ હતી’ એમ ન હોવું જોઈએ ?

બે વાત મુદ્દણસજા અને ચિત્રો વિશે. દરેક વિભાગના આરંભે એક આખા પાના પર ગેટ બે ઓફ ઇન્ડિયાની એક કમાનનું ચિત્ર અને વચ્ચે તે તે વિભાગસંબંધી એક નાનકડું રેખાચિત્ર મૂકીને એમાં રસપ્રદ રીતે પ્રવેશ કરાવાયો છે. આખા પુસ્તકની મુદ્દણસજા (લેઆઉટ) કળાત્મક છે. દરેક પાના પર છેક નીચે ચોપાટીના દરિયામાંથી દેખાતા મુંબઈનું પાતળું રેખાચિત્ર મૂકીને શહેરની દર્શય અસરને પણ સતત સાથે રખાઈ છે.

પુસ્તકના આવરણ પર, મુંબઈની આગવી શાન સમા છન્નપત્ર શિવાજી રમ્ભિનસનું અને એની સામે ગતિશીલ વાહનો-માણસોનું સહેજ આઉટ ઓફ ફોકસ તસવીર જેવું બહુરંગી ચિત્ર છે. મુંબઈની ગતિને આ રીતે રજૂ કરવાનો વિચાર સૂચક છે (જોકે એની રંગયોજના આવરણની સુંદરતાને સહેજ જોખમારે છે.) વધુમાં, આવરણ પર પુસ્તકના શીર્ષકની ઉપર એક પંક્તિ મુકાઈ છે : ‘હર અંધેરે કે પીછે એક સરેરા યાહાં.’ આમ ચિત્ર, શીર્ષક અને પંક્તિના આ સંયોજનથી લેખકે મુંબઈના આત્માને સચોટ રીતે પ્રગટ કરી, પુસ્તકની અંદર જવાની ઉત્સુકતા જગાડી છે.

પણ, સાથે, એક બીજુ નોંધ પણ લઈએ. પુસ્તકમાં, કદાચ દરેક લેખનું બે પાનાંનું કદ રાખવાના આશયે, સુંદર, ઐતિહાસિક, શયામ-ચેત તસવીરોને નાના કદની કરીને મુકાઈ છે. અને એ નાની તસવીરોનું છાપકામ. આજના આધુનિક છાપકામમાં જોવા મળતું હોય છે એવું, એટલું ‘શાર્પ’ નથી, એ કહેવું જ પડે.

છેલ્યે, બે કવિઓની દસ્તિએ મુંબઈ-દર્શનની, લેખકે કરેલી નોંધ જોઈએ. એક તો, પુસ્તકના આરંભે જ અમૃતભાઈએ, કવિ નિરંજન ભગતના વિખ્યાત કાવ્યની પંક્તિઓ, ઉચિત રીતે નોંધી છે : ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુષ્ટ વિનાની મગરી !’ અને બીજું : મેક્ઝિસ્કોમાં જન્મેલા ને ૧૯૮૦માં નોબેલ પારિતોષિક મેળવનાર કવિ-નિબંધકાર ઓકતાવિયો પાઝ ૧૯૮૧માં મેક્ઝિસ્કોના એલચી તરીકે ભારત આવેલા અને દિલ્હી જતાં પહેલાં

મુંબઈ ઊતરેલા. એક આખો દિવસ અને રાતે પણ, મુંબઈમાં ભરચક્ક રખડપણી કરેલી. એ અનુભવને એમણે આમ રજૂ કરેલો : ‘મેં વિકરાળ આકૃતિઓ જોઈ અને સૌંદર્યના ચેલ્કાટે મને આંદ્ર દીઘો. બદનામ ગલીઓમાં હું ફર્યો. કોઠાઓ અને હાટડીઓ તરફ, રંગો ચોપડેલી વેશ્યાઓ તરફ અને કાચના મણકા અને ભભકદાર ઘાઘરા પહેરેલા વંડળો તરફ તાકીને જોયું. હું મલબાર હિલ તરફ ગયો અને એના સ્વસ્થ બગ્ગોચાઓમાં ફર્યો. એક શાંત શેરીના છેવાડે મેં વિબાન્તિ થાય તેવું દશ્ય જોયું – નીચે કંઠાના ખડકો પર ભટકાતો ને તેમને ઝીણની ચાદરથી ઢંકી દેતો કાળો દરિયો.’ (પૃ. ૨૫૫)

ટૂકમાં, મુંબઈને જોયું, જાણવું, જીવતું, પામવું, માણવું હોય તો એ આ ‘૨૪x૭ = મુંબઈ’માં ભરપૂર છે. રાહ છે માત્ર વાચકની તત્પરતાની.



## અભિનંદન

- સાહિત્ય અકાડેમી (દિલ્હી)નો અનુવાદ-પુરસ્કાર દર્શના ધોળકિયાને ‘કર્મલીન’ (કોંકણી લેખક દામોદર માઉંઝેક્ટ નવલકથાના અનુવાદ) માટે. દર્શનાબહેને સંશોધન-વિવેચન-ચારિત્રનાં પુસ્તકો પણ આપ્યાં છે. ‘નરસિંહ ચારિત્રવિમર્શા’ એમનો ધ્યાનપાત્ર ગ્રંથ છે.
- ધ્વનિલ પારેખ ને, ઉપથી નીચેની વયના લેખકો માટેનો, સાહિત્ય અકાડેમી (દિલ્હી)નો ૨૦૧૧નો યુવાગૌરવ પુરસ્કાર ‘અંતિમ યુદ્ધ’ નાટક માટે. ધ્વનિલ કવિ અને સમીક્ષક તરીકે પણ ઉલ્લેખનીય છે.
- જાણીતા કવિ હરિકૃષ્ણ પાઠકને ૨૦૧૧ના વર્ષનો ‘કવીશ્વર દલપત્રરામ પુરસ્કાર સર્જનક્ષેત્રે’ એમના મહત્વના પ્રદાન તરીકે મળ્યો છે. હરિકૃષ્ણની મરમાળી ‘સાક્ષરબોતેરી’ હમણાં વધુ ધ્યાનપાત્ર છે.
- વર્ષોથી ગૌરવવંત રહેલો કુમાર-ચંદ્રક ૨૦૧૧ના વર્ષ માટે ગજલકાર અને ગજલવિચારક રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ને મળ્યો છે.
- મહત્વના સાહિત્યિક પ્રદાન માટે અપાતું ‘સંચિદાનંદ સંન્માન’ ગુજરાતીના ત્રણ વરિષ્ઠ લેખકોને : સર્વોદય ચિંતક અને ‘હિંદરસ્વરાજ એક અધ્યયન’ તથા ‘આપણા ઉમાશંકર’નાં દસ્તિપૂર્ણ લેખન-સંપાદન કરનાર કાન્તિભાઈ શાહને (૨૦૦૭ માટે); પુરાતત્ત્વ તેમજ મધ્યકાલીન સાહિત્યના વિચારણ સંશોધક-વિવેચક, ‘સરવંગા’ (વિવેચન) અને ‘હૂં હૂં’ (નવલકથા)ના લેખક નરોત્તમ પલાણને (૨૦૦૮) માટે અને પીઠ ગજલકાર કવિ, ગજલ-વિવેચક તથા હમણાં જેમના ચાર નિબંધગ્રંથો પ્રગટ થયા તે નિબંધકાર રત્નિલાલ અનિલને (૨૦૦૯) એનાયત થયા છે.

સૌને અભિનંદન

## વરેણ્ય

આધ્યાત્મિક કાંતિનાં ફૂલો : અનુ. પ્રદીપ ખાંડવાલા

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૧



### કવિસ્પર્શ સાથેના આસ્તવાદ અનુવાદો

ચન્દ્રકાન્ત ટોપીવાળા

કવિતા અને અધ્યાત્મતત્ત્વ સંદર્ભે કવિ કાન્તે બહુ યોગ્ય રીતે ઉચ્ચારેલું કે કાવ્યના સૌન્દર્યમાં જો મેટાફિલિક્સ ઓગળ્યું ન હોય તો મારે એ સ્વીકાર્ય નથી અને એ જ વાતની પ્રતીતિ રાજેન્દ્ર શાહે પ્રથમ મુનરી સન્માનનો સ્વીકાર કરતાં આપેલા વક્તવ્યમાંથી મળે છે. કેદ્ધિયત આપતાં રાજેન્દ્ર શાહે જગ્ઘાવેલું કે ‘‘એ સમયે અમારી પ્રાર્થનાઓમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએનું કાયમી સ્થાન હતું. પણ મને એ બહુ સ્પર્શોંનું નહીં. પણ પછી નરસિંહ મહેતાનો મંત્ર મળ્યો : ‘‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’’ – આ ટૂંકો મંત્ર મારા ચિત્તનો કબજો લઈ બેઠો’’ આ બંને ઉદાહરણો મધ્યકાળીન કવિતામાંથી પસાર થઈએ છીએ ત્યારે અવશ્ય સંભારવા જેવાં છે. મધ્યકાળની રચનાઓને દર્શનથી દૂર કરી વાંચી શકાતી નથી પણ કેટલીક મધ્યકાળીન રચનાઓ આંતરિક ચેતનાનાં સ્કુલિંગોથી દર્શનને સજ્જવ રીતે પ્રત્યક્ષ કરે છે. આ વાત મધ્યકાળના ભક્તિ-આંદોલને ભારતીય ફલક પર જે નવોત્થાન આપ્યું એને તપાસતાં ખાસ જોવા મળે છે. એમાંય દક્ષિણ ભારતની અજાણી રહેલી ભાષાઓના ભક્તિસાહિત્યનો પણ હવે પરિચય થવા માંડચો છે. દક્ષિણ ભારતની દ્વારા ભાષાજૂથમાંથી એના અનુવાદો ઉપલબ્ધ થવા માંડયા છે. પ્રદીપ ખાંડવાલા જોવા સચેત અનુવાદકે આધ્યાત્મિક કાંતિનાં ફૂલોમાં મધ્યકાળીન કન્નડ વીરશૈવનાં વચ્ચનો અનુવાદ આય્યો છે.

પ્રદીપ ખાંડવાલા પોતે અંગેજ ભાષાના કવિ છે. ‘વાઈલ વર્ક્ઝુઝુ’ (રાઈટર્સ વર્ક્ષોપ, ૧૯૮૨), ‘આઉટ’ (રૂપા એન્ડ કુ. ૧૯૯૪) અને ‘ઈન્કાર્નેશન’ (નેશનલ પાબ્લિશિંગ હાઉસ’ ૧૯૯૭) – એ કાવ્યસંગ્રહોમાં એમની કવિયેતનાએ લઘુકાલ્યો (Cameo) પર ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું છે. અને ગુજરાતી ભાષાની કવિતાના એમના અંગેજ અનુવાદોના સંગ્રહ ‘બિયોન્ડ ધ બીટન ડ્રેક’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૮)માં પણ એમણે લઘુકાલ્યોના બે ખંડ (Cameo I, Cameo II)ને આમેજ કર્યા છે. શબ્દો અને કલ્યાણનાં સાહયર્યને કારણે સર્જનાત્મક લેખન પ્રસ્તારી અને તેથી શબ્દાણું બની જતાં હોય છે, એની સામે એમનું વલશ લઘુકાલ્યોના મહત્તમ પરિણામગામી પ્રયત્નો ભણી વળેલું છે. એમની આ ચિત્તવૃત્તિને દક્ષિણની કન્નડભાષાનાં વીરશૈવ ‘વચનો’ આકર્ષે એ સ્વાભાવિક છે. આજે ગુજરાતીમાં ‘મધ્યયુગીન ભારતીય કવિતા’ (શ્રીમતી નાથીબાઈ દામોદર ઠકરસી મહિલા વિદ્યાપીઠ, મુખાઈ-૨૦૦૮), જેવા ગ્રંથમાં નૂતન જાનીને પણ ‘કન્નડ સાહિત્ય પરપરા અને વીરશૈવ’, ‘વીરશૈવ કવિ અક્ક મહાદેવી’, ‘અક્ક મહાદેવીનાં વચન’ અને ‘આન્ડાલ’, અક્ક મહાદેવી, મીરાંની કવિતાની તુલના’ વગેરે લેખો દ્વારા આ જ વિષયને સ્પર્શ કર્યો છે. પણ વિવિધ ગ્રંથોમાંથી કરેલા ભાષાન્તરિત ઉત્તારાઓની અસંકલિત પુનરાવૃત્તિથી આ લખાણો

સાહિત્ય

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ ૩૩

અશાસ્ત્રીય રહ્યાં છે. નૂતન જાનીના ગ્રંથમાં રજૂ થયેલા અનુવાદોમાં ન તો અનુવાદકનું નામ આપ્યું છે, ન તો એના સોત બતાવ્યા છે. તે જોતાં પ્રદીપ ખાંડવાલાના અનુવાદોને મળોલો એમની કવિરૂચિનો લાભ આગળ તરી આવે તેવો છે.

કે. સાચ્ચિદાનંદે ‘ઓથર્સ, ટેક્સ્ટ્સ ઈસ્યૂઝ’ (પેનકાફ્ટ ઇન્ટરનેશનલ, દિલ્હી ૨૦૦૩) ગ્રંથમાં ‘ભક્તિ : પહેલાં આંદોલનો’ નામે લેખમાં તમિણ ભક્તિ-આંદોલન, કન્નડ વીરશૈવ (વિન્ગાવત) આંદોલન અને મરાಠી વારકરી આંદોલનને ‘કોઈ અન્ય જીવન, કોઈ અન્ય કાવ્યશાસ્ત્ર’ તરીકે ઓળખાવ્યાં છે એ જોતાં પ્રદીપ ખાંડવાલાના પુસ્તકનું શીર્ષક ‘આધ્યાત્મિક કાંતિનાં ફૂલો’ ઘણું સૂચ્યક છે. આધ્યાત્મિકતાની કાંતિ અને પદ્ધી કાંતિનાં ફૂલો – આ બને વિરોધની સર્જનાત્મકતા કે.સાચ્ચિદાનંદના અભિગમને જ પુરસ્કારે છે.

વીરશૈવ આંદોલનના ભક્તકવિઓએ મૌખિક કાવ્યશાસ્ત્ર અપનાવી, લોકબોલી અને લોકપરંપરાની નજીક સરકી અંગત ઉદ્ગારોની તરફેણ કરી છે. આ ઉદ્ગારો દ્વિવિદ કે સંસ્કૃત છાંદસ સ્વરૂપમાં નહીં પણ ત્રિપદીમાં રહી ગદ્યઓર્ભિકોના સ્વરૂપમાં મુકાયેલા છે. ‘વચનો’થી ઓળખાયેલાં આ ગદ્યઓર્ભિકો માટે કહેવાયું છે કે આ વચનો સહજતાનાં વચનો નથી પણ સહજતા માટેનાં વચનો છે. અલબત્ત આ વચનકારોએ સહસંબંધોના અને સહઅસ્તિત્વના પ્રાચીન અભિલ ભારતીય ભંડોળનો રૂઢ ઉપયોગ નથી કર્યો એમ નહીં પણ આ વચનકારોએ સર્વસામાન્ય સામગ્રીનો એવો ને એવો જ ઉપયોગ નથી કર્યો. એમાં ક્યારેક તાંત્રિક તત્ત્વવિચારનો કે યોગવિજ્ઞાનનો પણ પ્રવેશ થયો છે. વચનકારોની સૌથી વધુ પ્રચલિત રચનારીતિ તો વિસ્તારિત રૂપકીની, સાદશ્ય અને દસ્તાત્રેષીઓની રહી છે. આ સર્વ વચનકારોનાં કેટલાંક વચનોમાં શિવ પરતેની પ્રેમશ્રદ્ધા અને સમર્પિતતાનું, વીરશૈવ દર્શનનું સૌન્દર્યરૂપ નિખર્યું છે, એમાં વચનકારોનું દર્શન વૈયક્તિક સંવેદનની સરાણે ચન્દ્રનું છે.

પ્રદીપ ખાંડવાલાએ ‘આધ્યાત્મિક કાંતિનાં ફૂલો’માં વીરશૈવ કવિઓમાં અગ્રણી એવા દેવરા દાસિમયા, અલ્લમપ્રભુ, બસવાણ્ણા અને અક્ક મહાદેવી ઉપરાંત

કેટલાક પ્રકીર્ણ વચનકારોનાં વચનોના અનુવાદો આપ્યા છે. સાથે દરેક કવિના અનુવાદો પૂર્વે એની જીવનસંદર્ભ-સામગ્રી પણ મૂકી છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં, કન્નડ અને અંગ્રેજ કવિ એ. ડે. રામાનુજના ‘સ્પીકિંગ ઓવ શિવ’ અનુવાદગ્રંથમાં રજૂ થયેલા ૧૦મી અને પછીની સદીઓના વચનકારોનાં ‘સાહિત્યિક ઠઠારા વગરનાં અદ્ભુત’ ૧૫૭ કાવ્યોએ કેવી મજા આપી એની પ્રદીપ ખાંડવાલાએ કબૂલપત્ર કરી છે. એમણે ઉમેર્યું છે કે વર્ગ - નાત - જાતિ - વિંગ - સંપ્રદાય વગેરે પર આધારિત આપણા સમાજને બદલવો હોય તો વીરશૈવોની પ્રાબીર સમાનતા ખપ લાગે તેમ છે. આ સંદર્ભમાં એમણે ‘વીરશૈવ પંથ’ : એક જલક’માં એનો પરિચય પણ કરાવ્યો છે તો વળી, ગ્રંથને અંતે ‘રસસ્વાદ’ શીર્ષક હેઠળ ક્યારેક વચનોની થોડી ખૂલ્લીઓ પણ તપાસી છે. સંદિગ્ધપણે નિવેદન અને પ્રશ્નને રજૂ કરતું, ક્યારેક વૃત્તાન્તરૂપમાં રચાતું, ક્યારેક ધ્યુતપદને લઈને ચાલતું, ક્યારેક નાટકીય આરંભ બતાવતું, ક્યારેક ચિત્તપર્ક કયાક્ષનો ઉપયોગ કરતું, ક્યારેક અવળવાણી, હતાશાવાણી કે આક્ષેશવાણી પ્રયોજતું, ક્યારેક સાક્ષાત્કાર, જ્ઞાન કે માનવસંબંધોની મીઠાશ પ્રસ્તુત કરતું – વચનોનું આવું વિવિધ રૂપ એમણે સોદાહરણ દર્શાવ્યું છે.

પહેલાં, ટેવરા દાસિમયા લઈએ. આ વચનકારે રજૂઆતની તીવ્રતા સાથે અહિસાનું વ્યાપક સંવેદન ઊભું કર્યું છે, તે જોવા જેવું છે : ‘હું શા માટે / છરો વાપરું / ઓ ઈશ / ? શેમાંથી એને ખેંચી કાઢું / ને શેમાં એને ખોસી દઈ. જ્યારે તમે જ સમસ્ત વિશ છો / ઓ રામનાથ !’ (પૃ. ૭) આ જ કવિનું એક ‘વચન’ અનુવાદે પાછળના પૂંઠા પર મૂક્યું છે તેમાં સ્વીપુરુષની સમાનતાનો મુદ્રો કેવી પ્રશ્નન પિતૃસત્તાક ચેતનામાંથી ઊઠ્યો છે તે આજના સંદર્ભમાં જોવાનું રસપ્રદ બનશે :

ઉંચા વાંસના બે કટકા કરો,

નીચલાને સ્ત્રી કહો

અને ઉપરનાને પુરુષ

એકમેકને ઘસીને

આગ પ્રગટાવો

અહીં નીચલાને સ્ત્રી અને ઉપરનાને પુરુષ કહેવાને બદલે વાંસના બે ટુકડા જ રાખી શકાયા હોત. વાંસના બે કટકા થયા પછી ‘નીચલા’ અને ‘ઉપરા’ની જરૂર જ નથી. પણ

આ વચનમાં તત્કાલીન ચેતનાનું માળખું સંડોવાયેલું છે. શરીર સાથે શરીરની તમામ મર્યાદાને સ્વીકારતું અદ્ભુત શરીરસૂત્ર જુઓ :

શરીર છે તો ભૂખ લાગશે  
શરીર છે તો જુહુ પણ બોલાશે

.....

મારી જેમ  
એકવાર દેહ તો ધરો  
પછી કહો શું થાય છે,  
ઓ રામનાથ

(પૃ. ૭૭)

અત્યલમપ્રભુનાં વચનોમાંના અતિવાસ્તવ જેવા અંશ તરફ અનુવાદક સંકેત કર્યો છે તે બરાબર છે. હદ્યકમળમાંથી મધ્યમાંથી બધાર ઊડી આવે ને આખા આકાશને ગળી જાય; દેડકો આકાશને ગળી જાય; બિલ્લી જેને ખાઈ ગયેલી એ જ મૃત કૂકડો છઠી પોકરે; કાળી ક્રોયલ સૂર્યનો ભક્ષ કરી જાય; મંદિર દેવ તરફ દોડે, મગન હાલરંગ ગાય ને પવન પોઢી જાય; વગેરેમાં અત્યલમપ્રભુની અભિવ્યક્તિની અરૂઢતા અવશ્ય જોવાય છે. ક્યારેક બહુ દૂરવર્તી પદાર્થનું સહયોજન પણ આકર્ષે છે :

ટેકરાનાં કરમદાં  
અને સાગરનું લુણ  
ક્યાં ક્યારથી થઈ  
એમની સગાઈ ?

(પૃ. ૭૮)

ક્યાંક ઈન્જ્રિયાત્યય કરતું કૌતુક પણ જેવા જેવું છે : ‘પુષ્પોની સુવાસને દોડતી જોઈ’ (પૃ. ૩૦) ક્યાંક દશ્ય સાંકળીએ રહસ્યને તોળવાનો અનુભવ જુઓ : નગરની ભાગોળે / એક મન્દિર / મન્દિરમાં એક જોગણ / એના હાથમાં સોય / સોયની અણીએ / ચૌદ લોક (પૃ. ૩૧). ક્યાંક ‘મૃત્યુનું પંચતત્ત્વસંદર્ભે થતું રમખાણ પ્રત્યક્ષ થયું છે :

પાણીના હથપગ તોડવા  
અભિનાં નાકકાન વાણ્ણાં  
વાયુનો શિરચ્છેદ કર્યો  
આકાશને શૂળીએ ચગવ્યું... (પૃ. ૩૪)

ક્યારેક તર્કલાવણ્યનો પરચો પણ મળે છે : જો હું ઈશ્વર ન હોઈ / તો તું ખરો ? હું ઈશ્વર હોય તો / મારી સંભાળ તારે કરવાની ? તરસ્યો થાઉં તો / પાણીનો ઘડો તું લાવે, /

ભૂખ્યો થાઉં તો ભાતનો કોળિયો તું ખવડાવે. / એટલે જ ગુહેશર / હું જ ઈશ્વર હોઈ શકું’ (પૃ. ૩૮)

બસવણણાનાં વચનોમાં સાંસારિક-સામાજિક સામગ્રી સાથેની વક્તા એકદમ ધ્યાન બેંચે છે :  
પથ્થરના નાગને દેખી કહેશે  
‘એને દૂધ પાવ’  
પણ જીવતા નાગને દેખી કહેશે  
‘મારો એને મારો’

(પૃ. ૮૦)

● બ્રાહ્મણના ઘરમાં

અભિને દેવ ગણી પોંચે  
પણ જો આગ ભડકી ઉઠે  
તો એના પર તુરેત  
મોરનું પાણી અને શોરીની ધૂળ છાંટે !

(પૃ. ૬૮)

અહીં પરિચિત સામગ્રી એકદમ નવી સંવેદનામાં પરોવાતી જોવાય છે : ‘દૂધ તો વાછરડાનું ઓંકૃ / જલ મીનનું / કૂલ મધ્યમાખનું’ (પૃ. ૭૭). વચનકાર બસમણણાની ભક્તિની ખુમારીનો તારસ્વર પણ સાંભળવા જેવો છે : તમારી માયાએ વિશ્વને ધેર્યું છે / અને મારા ચિત્તે તમને ધેર્યો છે, ઈશ / વિશ્વથી તમે વધુ બળવાન / અને હું તમારાથી / જોમ હાથી / દર્પણમાં જડપાઈ જાય / તેમ તમે નાથ / મારામાં નંધી છો’ (પૃ. ૭૮)

અક મહાદેવી વચનકારોમાં એમની નારીચેતનાને કારણે ઓળખાઈ આવે છે. ચિત્ત મલિકાજુનને વર્યુ હોવા છતાં રાજા કૌશિક સાથેના બળજબરીથી થયેલા લગ્નને તોડી શ્રીશૈવ પર્વતમાં આખરે શિવને પામી શિવમાં સમાઈ જતાં મહાદેવીની મીરાં સાથેની સરખામણી જીવનની બાબતમાં અને કેટલીક વિરહસંવેદનાની બાબતમાં એકદમ બંધ બેસે તેવી છે. અલબત્ત ક્યારેક ક્યારેક મહાદેવીનાં વચનોમાં જેવા મળતી પ્રગલભતા અને મીરાંથી થોડી જુદી જરૂર પાડે છે :

આ સુંદરવરને ચાહવા છે, મા  
જેને નથી મૃત્યુ કે નથી જેનો કષય  
જેનું નથી રહેણા કે વલણ  
ને નથી આરંભ કે અંત  
કે રૂપ કે નિશાન.  
.....

એટલે જ ચેન મલિકાજુન  
મારા સ્વામી છે  
આ બધા મત્ય, ક્ષયગ્રસ્ત પુરુષોને  
પકડી પકડીને ફેંક ચૂલામાં  
ઓ મા (૫. ૧૦૩)

● ઓ શિવ,  
ક્યારે આવિંગન કરું તમને  
કુંભ સમા મારા કુચ વડે (૫. ૧૦૪)

મહાદેવીની અતિવ્યક્તિનો અવિસમરણીય પરિપક્વ  
ઉન્મેષ તો આ રહ્યો :

ફળને આંગળીઓ વડે દાબવાથી  
સ્વાદ થોડો પરખાય ?  
અને તો મમણાવવું પડે મોંમાં (૫. ૧૦૨)

એક જ ફળનાં બને સ્પર્શ-સ્વાદનાં પાસાંઓમાંથી નિકટતમ  
ને અંતર્ગત પાસાને જઈને અડતી આ પંક્તિ રચનાને  
અનુભવના કેન્દ્રમાં લઈ જાય છે. મહાદેવીની ઉત્કર  
ભક્તિની સર્જન-ઉક્તિઓ તો ઘણ્ણી છે :

- સુવર્ણના વર્ણ જેમ  
મારામાં હતા
- ઓ મા, મેં તો સદ્ગ્રા  
રક્ત વિનાનો ઘા
- ગગનનાં લોડાણ જે  
જે ચન્દ્રમા જાડો  
તે ચકરાતું ગીધ  
થોડું જાડી શકે ? (૫. ૮૧)

● ચેન મલિકાજુનની કટારનું પાનું  
મને વીધી શરીરમાં તૂટી ગયું છે  
જીમીન પર તરફદી આખોડું છું (૫. ૧૦૬)

છેલ્લાં ઉદાહરણ તો ‘મને લાગી કટારી પ્રેમની’ આગળ  
લાવીને મૂકી દે છે અને છત્યાં અહીં રજૂ થયેલી કટાર વધુ  
ઘાતક છે.

આ ગ્રંથમાં પ્રકીર્ણ વચનકારોનાં વચનોમાંથી ચેન,  
બસવણ્ણાના વચનનો પ્રારંભ સહાયક ઉપકરણનો  
આકર્ષક મહિમા કરે છે : જીતરી ગયેલા પાણીને / દોરડા  
કે પગથિયાં વિના / ઉપર બેંચી શકાય ? – અત્યાર સુધી

જેયેલાં ઉદાહરણોથી સ્પષ્ટ થશે કે પ્રદીપ ખાંડવાલાના આ  
અનુવાદો સંવેદનશીલ કવિ-સ્પર્શ સાથે સરલ અને  
આસ્વાદ બન્યા છે. ગ્રંથના ‘આભાર’માં એમણે ‘ભણતર  
અને વ્યવસાયે પણ અંગેજનો જ ઉપયોગ એટલો  
ગુજરાતીનો મહાવરો ઓછો’ એવું ભવે વિધાન કર્યું છે  
પણ ડો. માળગી અને વાસુકિ સુભારાવ જેવાની સહાય  
લેવાની એમની કાળજી તેમજ રાજેન્ડ્ર શુક્લનાં સૂચનોને  
અંકે કર્યાની વાત – અનુવાદક તરીકેની એમની નિષ્ઠા અને  
સૂઝને પ્રગટ કરે છે. અનુવાદકે મૂળનાં વચનોને આસ્વાદાં  
છે એની પરીજ એમના અનુવાદો જરૂર આપે છે.

આ ગ્રંથમાં તેમ છતાં, કેટલાંક સ્થાનો એવાં છે જે  
સંમાર્જન માગે છે :

- (૧) ‘ભૂખ રૂપી નાગો’ કહેવાને બદલે ‘ભૂખના નાગો’  
એવું કહી શકાય. (૫. ૫)
  - (૨) ‘જ્યારે કૃષ્ણાહીન અને તૃપ્શ્ણાહીન મૂર્તને’ અહીં ‘મૂર્તિ’  
હોવું જોઈએ (૫. ૧૨)
  - (૩) ‘ક્યાં આંબો / ને ક્યાં કોયલ / ક્યાં, ક્યારથી થઈ  
/ એમની સગાઈ ?’ – અહીં એ પછીની પંક્તિઓની  
ભાત જોતાં, વધારાનો ‘ક્યાં’ દૂર કરી ‘ક્યાં આંબો  
/ અને કોયલ’ એમ થવું જોઈએ (૫. ૧૮)
  - (૪) ‘મધમાખી’ અને ‘માખ’નું સાતત્ય જાળવવા કાં તો  
‘મધમાખ’ અને ‘માખ’ જોઈએ અથવા ‘મધમાખી’  
અને ‘માખી’ જોઈએ (૫. ૧૯)
  - (૫) ‘મેં નીરખ્યા’ એ રચનામાં આખો વાક્યવિન્યાસ  
કરુંનો અને નબળો છે. સુધારવો પડે. (૫. ૨૦)
  - (૬) ‘a winnowing fan’નું ‘સાવરણી’ એવું  
ભાષાન્તર થયું છે, ત્યાં ‘સૂપણું’ હોવું જોઈએ (૫.  
૧૬)
  - (૭) ‘વૃક્ષ ઘસાયું વૃક્ષ સાથે’ અને પછી ‘આસપાસનાં  
તરુવર ભસ્મ થયાં’ એમ કહેવામાં વૃક્ષ અને તરુવર  
– પર્યાયો વાપરવાની જરૂર નથી. કદાચ ‘વૃક્ષ  
ઘસાયું વૃક્ષ સાથે’ છે ત્યાં ‘ડાળ ઘસાઈ ડાળ સાથે’  
હોવાની સંભાવના છે. (૫. ૧૧૧)
- દક્ષિણાંતર બહુ ઓછી જાણીતી સપ્રાણ દ્વારા  
દિશાઓ આ રીતે ગુજરાતી ભાષામાં ખૂલે એ ગુજરાતી  
સાહિત્યને અને વિશેષે તો ગુજરાતી ભાષાના મધ્યકાળીન  
સાહિત્યને સમજવામાં નવું પરિમાણ ઉમેરે છે. □

## સંદર્ભવિશેષ

ગાંધીજીની દિનવારી - ચંદુલાલ ભગુભાઈ દલાલ

માહિતીખાતું, ગુજરાતરાજ્ય, ગાંધીનગર, સંવર્ધિત બીજી આ. ૧૯૯૦. ૩. ૩૨+૭૬૪, ૩. ૭૦



એક મૂલ્યવાન માહિતીકોશ, બલકે સંદર્ભકોશ

રાજેન્ડ્ર પટેલ

અત્યારે જાણો માહિતીયુગ ચાલી રહ્યો છે. હથેજીમાં સમાય એટલા પટ (સ્ક્રીન) ઉપર જગતભરની માહિતી ઉપલબ્ધ બની છે. ઇન્ટરનેટ આપણા સયમનાં (ને સમય અંગેનાં આપણાં) સમીકરણો બદલી રહ્યું છે. ન કલ્યા શકાય એટલા ને એવા માહિતીના ભંડાર બિલકુલ સહજ રીતે વિના શ્રમે, અવગત થવા માંડ્યા છે.

એવા સમયે, ૧૯૭૦માં પ્રકાશિત થયેલા આ પુસ્તક 'ગાંધીજીની દિનવારી' એ, અપાર ધીરજ ને સંનિષ્ઠ શ્રમ-સાધ્ય ગંજાવર માહિતીકોશને ફરીથી જોવાનો સમય પાકી ગયો છે. છે તો આ માહિતીકોશ, પણ એના સંગ્રહક-સંપાદકનાં લગન, ચીવટ અને કાર્યનિષ્ઠાએ આ માહિતીકોશને મૂલ્યવાન અભ્યાસગ્રંથમાં પલતાવી દીધો છે ! આજે સંશોધન-સંપાદનનો મહિમા વધીલો છે ત્યારે ૪૦ વર્ષ પહેલાં થયેલો આ ગ્રંથ સંશોધન માટે એક મહામૂલી મૂરી હોવાની પ્રતીતિ કરાવનારો ગ્રંથ છે.

ગ્રંથની પહેલી આવૃત્તિ ૧૯૭૦માં થયેલી. એ પછી પણ એના 'લેખક-સંગ્રહક' ચંદુલાલ દલાલ ૧૦ વર્ષ સુધી એમાંની વિગતોમાં 'અનેક સુધારા-વધારા' કરતા રહ્યા હતા. જુઓ - નવી આવૃત્તિમાં શારદાબહેન ચંદુલાલ

દલાલનું નિવેદન.] એ પછી ગુજરાત રાજ્યનું માહિતીખાતું બીજી ઔંકટો. ૧૯૮૪એ એની, આવી સંશોધિત આવૃત્તિ પ્રગટ કરવા વિચારાતું હતું, તે પાંચ વર્ષ પછી થઈ શક્યું - ૧૯૯૦માં આ ગ્રંથની સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ.

ગાંધીજી દક્ષિણ આફિકાથી ૮-૧-૧૯૧૫ના રોજ ભારત આચ્છા તે દિવસથી લઈને, ૩૦-૧-૧૯૪૮ના રોજ એમનું અવસાન થયું ત્યાં સુધીના દરેક દિવસની આ વિગતવાર, જીજાવટબારી, અનેક પાદનોંધોવાળી દિનવારી છે. ગ્રંથમાં ૫૮૦ પાનાંની દિનવારી પછી ૧૮૦ પાનાં વિવિધ સૂચિઓનાં છે. કુલ ૧૨૦૭૫ દિવસોની આ વિગતોમાં ૧૧૭૮ દિવસ, ગાંધીજી કદે દિવસે કદે સ્થળે / ગામે હતા એની ચોક્કસ માહિતી છે; ૧૨૪ દિવસોની વિગતો માટે લેખકે આધારો પરથી અનુમાન કરીને નિર્ણય કર્યું છે તો ૨૧૨ દિવસો એવા છે કે એમાં સ્થળ/ગામ વિશે અટકળો કરવી પડી છે.

ઇતિહાસ-સંશોધકો પણ ભૂલો કરી બેસે એવા, ગાંધીજીના આ સક્રિય ને વિસ્તૃત પટમાં માહિતી અંગેની આ લેખકની પ્રમાણભૂતતાએ અને શાસ્ત્રીય સમજે આ

ગ્રંથને માહિતીપ્રદ ઉપરાંત રસપ્રદ પણ બનાવ્યો છે. ગ્રંથના સ્વરૂપ અંગે પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે :

આ પુસ્તક એક સંગ્રહ છે; એમાં કશું નવું – મૌલિક નથી; એ ઈતિહાસ નથી; એ કોઈ અભ્યાસપૂર્ણ ગ્રંથ નથી કે નથી કોઈ મનનપૂર્ણ ગ્રંથ. એ કેવળ દિનવારી છે, સિલસિલાબંધ નોંધ છે. એ એક માહિતીકોશ છે. સંશોધન કરનાર વિદ્યાર્થીને જોઈનું સહેલાઈથી મળી શકે તે મુજબનો રસ્તો બતાવનાર માર્ગદર્શક છે. આમાં અભિપ્રાય આપ્યા નથી – હશે તો કવચિત જ હશે – પણ અભિપ્રાય બાંધવા માટેની સામગ્રી છે. વાચક એ વાંચીને પોતાનાં અનુમાન તારવે [સંગ્રહકની પ્રસ્તાવના, પૃ. ૨૮]

‘વાચક વાંચીને અનુમાન તારવે’ એવો આ કેન્દ્રીય ખ્યાલ જ દર્શાવે છે કે કે મનુષ્યમાત્રમાં શ્રદ્ધા ધરાવતનાર ગાંધીજીની દિનવારીમાં આવો અવકાશ મૂકવો એ કેટલું મહત્વનું છતાં સૂક્ષ્મ કાર્ય લેખકે આ ગ્રંથમાં કર્યું છે.

ચંદુલાલ દલાલે એક બીજું નાનકંડું પુસ્તક આ જ શીર્ષકથી ૧૮૭૬માં આપેલું. એમાં ગાંધીજીની જનતારીખ ૨-૧૦-૧૮૬૬થી ૮-૧-૧૮૧૫ સુધીના દિવસોને આવરી લેવામાં આવ્યા છે. અલબટ, ૧૮૮ પાનાના એ પુસ્તકમાં, કુલ ૮૨૧૭ દિવસોમાંથી માત્ર ૧૩૦૦ દિવસોની ચોક્કસ માહિતી છે ને ૬૯૧૭ દિવસોની સામગ્રી અટક્લો-સંભાવનાઓવાળી છે. આખા સમયગાળાને એમણે ચાર વિભાગમાં વહેંચ્યો છે : (૧) ગાંધીજીના જન્મથી લઈને, પહેલીવાર તે દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા ત્યાં સુધીનો, (૨) દક્ષિણ આફ્રિકામાં એમના પર ગોરાએ કરેલા હુમલા સુધીનો, (૩) ત્યાર પછીનો ત્યાનો વસવાટ અને (૪) ટૂંક સમય માટે તે હિંદ આવીને પણ ગયા અને પછી સદાનો માટે દ. આફ્રિકા છોડી ભારત પણ ફર્યા ત્યાં સુધીનો. એ પુસ્તકની પ્રસ્તાવનામાં પણ લેખકે નોંધિલું કે, આમાં અભિપ્રાય આપ્યા નથી [...] પણ અભિપ્રાય બાંધવા માટેની સામગ્રી છે.’ ઈતિહાસનાં તથ્યો અભિપ્રાયો / અર્થઘટનો માટે ઉપયોગી થાય કે થશે એવી લેખકની સમજ મહત્વની બને છે. માહિતીકોશ પાણનું એમનું સ્પષ્ટ પ્રયોજન પણ આમાં દેખાય છે.

આ બંને ગ્રંથો – ખાસ કરીને ૧૮૧૫-૧૮૪૮ વાળી પ્રસ્તુત દિનવારી ઉપર નજર ફેરવતાં જ ગાંધીજીનું સક્રિય, સંકલ્પવાળું, હાડમારીઓ વેઠીને ધ્યેય સિદ્ધ કરવા માટે

મથનારું, વિભૂતિમત્ર ચરિત્ર આપણી સામે સાક્ષાત્ થતું રહે છે. આ મહામાનવ, ઉત્ત વર્ષના આ ગાળામાં બે હજાર ઉપરાંત ગામોમાં ફર્યા હતા. કુલ બાર હજાર દિવસોમાંથી ૨૧૫૧ દિવસ એમણે અમદાવાદમાં (મુખ્યત્વે કોચરબ આશ્રમ ને સાબરમતી આશ્રમમાં) ગાળેલા, ૨૫૮૮ દિવસ વર્ધામાં (મુખ્યત્વે વર્ધા અને સેવાગ્રામ આશ્રમમાં) ગાળેલા અને ૨૧૧૮ દિવસ જેલમાં ગાળેલા. બાકીના દિવસો દરમિયાન એ પ્રવાસમાં રહ્યા હતા – પ્રવાસો મુખ્યત્વે આગગાડી, મોટરગાડી, ઘોડાગાડી, બળદગાડી, સાઈકલ, હોડી, આગબોટ, ઘોડો, હાથી, બીટ વગેરે દ્વારા અને અલબટ પગપાળા પણ, કર્યા હતા. નશ્યૂટે ક્યારેક પગરિક્ષામાં કે પાલખીમાં બેઠેલા – એવી નોંધ પણ મળે છે. (ગાંધીજી વિમાનમાં બેઠા હોય એવી કોઈ માહિતી અહીં મળતી નથી.)

વાચક જાડો ગાંધીજી સાથે ગામડે-ગામડે, નગરે-નગરે, સ્થળો-સ્થળો ફરતો રહે છે. ગાંધીજીનું આ સાતત્ય, કર્મઠિતા, અજંપો, એમની સાઢગી, પહેરવેશ, આહારનિયંત્રણ (આહારમાં મીઠાનો સર્ટર ત્યાગ કરનાર આ કર્મવીરે મીઠાનો સત્યાગ્રહ કરી ચેતના જગાડી !) – એ બધું જીણવટથી તાદેશ થતું જાય છે.

ગાંધીજીએ જેલની અંદર તેમજ જેલની બહાર અનેક વખતે, જુદાંજુદાં કારણોસર, ઉપવાસ કરેલા. એમણે કુલ ૧૫૦થી વધુ ઉપવાસ કર્યાની લેખકની ધારણા છે. પણ એ લખે છે : ‘ધતાં એ યાદી સંપૂર્ણ છે એવો દાવો કરી શકું નહીં.’

હવે આ ગ્રંથની શાસ્ત્રીયતા વિશે. દરેક અભ્યાસી સંશોધકે એ જીણવટથી જોવા જેવી છે. કેટલીક બાબતો આપું :

લેખકે આ દિનવારી માટે માહિતીના ૧૦ સોતોનો ઉપયોગ કર્યો છે : (૧) છાપાં – દૈનિકો, સામયિકો, વાર્ષિકો, (૨) ગાંધીજીનો પત્રવ્યવહાર – છાપાયેલો, વણછાપાયો; (૩) માનપત્રો, સ્થળ પરની તકતીઓ વગેરે; (૪) આત્મકથા (૫) એ વખતની મુંબઈ સરકારના પોલીસ ખાતાના – છૂપી પોલીસ સુધ્યાંના – તથા બીજા અવિકારીઓના અહેવાલો, (૭) કેટલીક રાજ્યસરકારોએ પોતાની પાસેની માહિતી ઉપરથી તેથાર કરેલાં પુસ્તકો; (૮) કેટલાક અહેવાલો,

પ્રવાસવર્ષનો, લડતના ઠિઠિઠાસો, સાથીઓનાં સંસ્મરણો, રોજનીશીઓ વગેરે (૮) મહાદેવભાઈની ડાયરીઓ - પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ, (૧૦) સંસ્થાઓ સાથે ચલાવેલા પત્રવ્યવહારો. (જુઓ) : રસ્સિકલાલ પરીઝે લખેલું 'પુરોવચન', પૃ. ૮)

આટાટલા સંદર્ભો તપાસતાં આ લેખક નમ્રભાવે લખે છે :

પુસ્તક તૈયાર કરવામાં મેં મારા ચાલુ કામ ઉપરાંતનો ફાજલ સમય વાપર્યો છે, અને એમાં આશરે નવ વર્ષ ગયાં છે. માહિતી એકઠી કરવા માટે મુંબઈ, પુના, મદ્રાસ, કલકત્તા, પટણા વગેરે સ્થળોએ જઈને રહ્યો છું અને ત્યાંની લાઇબ્રેરીઓની દિવસોના દિવસો સુધી મુલાકાત લિધી છે. (સંગ્રહકની પ્રસ્તાવના, પૃ. ૨૮)

વર્ષ-માસ ને તારીખવાર માહિતી - સ્થળ, સમય, વિગત, (હોય ત્યાં) ગાંધીજીના ઉદ્ગાર, વાતચીત - આપવાની સાથે જ, એક જિજ્ઞાસુ સંશોધકની જેમ લેખકે તે તે વિગતની નીચે, જરૂર પરી ત્યાં, પાદનોંધો (ફૂટનોટ્સ) કરી છે ને એમાં વિગતોની પૂર્તિ, પૂર્વ-વિગતનો નિર્દેશ, પ્રતિનિર્દેશ (કોસ રેફરન્સ) આપ્યાં છે એ બાબત પરથી લેખકે કેટલા ઊંડા ઊતરીને સમગ્રપણે કામ કર્યું છે એ સમજારો. નમૂના દાખલ એક-બે વિગતો જોઈએ.

૧૨મી માર્ચ ૧૯૮૦ની નોંધ આમ છે. (પૃ. ૨૭૨) :  
અમદાવાદ : આશ્રમની એક માંત્રી છોકરીની ખબર કાઢી દાંડીકૂચ શરૂ. નીકળ્યા સવારે સાડા છ વાગ્યે; પગપાળા; ૭૮ સાથીઓ સાથે, વ્રત લીધું 'સ્વરાજ ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં આતું' □ અસલાતી

હવે જુઓ એ વિગત માટેની, એ પાના નીચેની, નોંધ : SPANના સને ૧૯૬૪ના ઓંકોબરના અંકના પાના ૩૭-૪૦ ઉપરના Gandhi, India's Great Dissenter નામના લેખમાં જણાવ્યું છે કે આ ૭૮ જણાની ટુકડી આશ્રમવાસી સ્ત્રી-પુરુષોની બનેલી હતી. પરંતુ આ બરાબર નથી. આ ટુકડીમાંના બધા જ આશ્રમવાસી નહોતા અને એમાં એકેય સ્ત્રી નહોતી.

એમ અન્ય સંદર્ભને પણ એમણે વિગતકોષ-મુક્ત કર્યો છે.

વળી, પૃ. ૫૬૮ ઉપરની એક વિગતનોંધ અને એની નીચેની પાદનોંધ જોઈએ :

૨૨ જુલાઈ ૧૯૪૭

દિલ્હી : 'હવે તો સ્વરાજ મળ્યું છે, તો સાબરમતી આવો'<sup>૩</sup> એ મતલબના એક પત્રના જવાબમાં લખ્યું : 'પૂર્ણસ્વરાજ હજુ દૂર જ છે - મારે સારુ સાબરમતી દૂર છે, નોઓખલી નજીક છે.'

હવે ત્યાં પાદનોંધમાં, પૂર્વનિર્દેશ મૂક્યો છે :

૩. જુઓ. તા. ૧૨-૩-૩૦

જેથી આ 'સાબરમતી આવો' એનો પૂર્વસંદર્ભ વાચકને મળી શકે.

ગાંધીજીની મહત્વની, ને મોટી વિગતો તો આપણા સ્મરણમાં પડેલી હોય - પણ જીડી ને તેથી ખૂબ લાક્ષણિક વિગતો આ હિન્વારી આપે છે વળી, એ જાણકારી ઉપરાંત ગાંધી-ચરિત્રનો રોમાંચ પણ આપે છે. જોઈએ :

ઓંગસ્ટ ૧૯૪૭ [પૃ. ૫૭૦-૭૧]

૮. પટણા : ઉતારો ડૉ. સૈયદ મહેમૂદને ત્યાં. સાંજે યુનિવર્સિટીના મેદાનમાં પ્રાર્થનામાં બોલ્યા : ૧૫મી ઓંગસ્ટ તો આપણી પરીક્ષાનો દિવસ છે; કોઈએ તોણન કરવાનું નથી; આ જે સ્વરાજ આવ્યું છે તે કોઈ દીવાબતી કે રોશની કરી ઊજવવા જેવું નથી આવ્યું; આજની અનાજ, કપડાં, ઘી, તેલ વગેરેની તંગીમાં ઉત્સવ શો ઊજવવો ? એ દિવસે તો ઉપવાસ, કાંતવાનું અને ઈશ્વરને પ્રાર્થના કરવાની.

૧૪ કલકત્તા : બોલ્યા : આવતી કાલે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈએ છીએ, પણ આજ ચાતના બાર વાગ્યાથી હિંદુસ્તાનના ટુકડા થાય છે. એટલે કાલનો દિવસ ખુશીનો તેમજ ગમગીનીનો છે.

૨૪ કલકત્તા : ગાંધીજીને કોઈએ ગોળી મારી છે એવા સમાચાર મળતાં ગૃહપ્રધાન ગભરાતા પાદનોંધ. ૨. અમૃતસર જિલ્લામાં, સરદાર બલદેવસિંહ ઉપર આજે ભૂલથી ગોળીબાર થયો હતો પરંતુ કોઈને વાગ્યું ન હતું કદાચ આ બનાવ આની સાથે લેળવી ટેવામાં આવ્યો હોય.

ગભરતા આવ્યા તો ગાંધીજી કહે :  
‘એવાં ભાગ્ય મારાં ક્યાંથી કે મને કોઈ  
ગોળી મારે.’<sup>2</sup>

અગાઉ નોંધ્યું એમ, આ ગ્રંથમાં સંદર્ભગ્રંથોની  
ક્ષતિઓ તો દર્શાવી છે, પણ સ્વયમ્મ ગાંધીજીની સ્થળ,  
સમય, તારીખ, પ્રસંગની થોડીક ભૂલોની પણ નોંધ  
કરવામાં આવી છે. બેઝેક ઉદાહરણ :

- શ્રી જમનાલાલ બજાજને લખેલા એક પત્રમાં સ્થળ  
અને તિથિ અનુકૂળ રંચી અને ભાડરવા સુદ્ધ દાખલા  
છે. પણ આ ટિપ્પણી ગાંધીજી અમદાવાદમાં હતા. રંચી  
નહોતા. પહેલાં, આસો સુદ્ધ દના રોજ રંચી હતા.  
આમ તિથિ લખવામાં ગાંધીજીની એક મહિનાની ભૂલ  
થઈ છે.
- એક વ્યક્તિને ૧૪-૭-૩૭ના રોજ લખેલા પત્રમાં એક  
બહેનના વિવાહ વિશે લખ્યું, “...Will be an ideal  
husband for him.” એવી himને બદલે her  
જોઈએ. લખવામાં ભૂલ થઈ હશે. પત્રો છાપાય તેમાં  
સુધારી લઈ ‘her’ છાપવામાં આવ્યું છે.

ગાંધીજીની આવી ઘણી ભૂલોને દર્શાવતાં લેખક  
કહે છે – ‘આવી ભૂલો કેમ થઈ હશે ? એ તો કેવળ  
કલમદોષ હશે ? કે બેદરકારી હશે ? કે જે તે સમયે  
ગાંધીજીના મગજ ઉપર બોજો હશે ? કે શું હશે ? એ  
શોધવું ઈતિહાસકારનો અને મનોવિજ્ઞાનશસ્ત્રીનો વિષય  
છે. અહીં તો મેં ફક્ત વિષય જ પૂરો પાડ્યો છે.’

લેખકની આ પ્રમાણભૂતતા માટે પુસ્તકના  
પુરોવચનમાં રસિકલાલ છો. પરીખ લખે છે :

ગાંધીજીની જાતે જ થયેલી સરતચૂકોની આ નોંધ કિગતે  
યંકી છે તે ઈતિહાસ સંશોધકને સાવધ કરવા માટે છે.  
ઈતિહાસ સંશોધનમાં ખતોનું પ્રમાણદસ્તિએ મૂલ્યાંકન  
કરવામાં આવે તેમાં વ્યક્તિના પોતાના હાથે લખેલા ખતને  
સૌથી વધારે વિશ્વસનીય ગણવામાં આવે છે. અહીં આપણે  
જોઈએ છીએ કે ગાંધીજી જેવી ચીવટવાળી વ્યક્તિને હાથે  
પણ કેવી સરતચૂકી થઈ ગઈ છે ! ઈતિહાસ સંશોધનમાં  
કર્યું જ પરીક્ષણ અને સમર્થન વિના પ્રમાણભૂત ન ગણાય  
એ નિયમ સર્વોપરી છે – પ્રાચીન ઈતિહાસ માટે કે અધ્યતત્ત્વ  
ઈતિહાસ માટે. આવું પરીક્ષણ અને સમર્થન શ્રી ચંદુભાઈએ  
આ દિનવારી તૈયાર કરવામાં કર્યું છે એ નોંધપાત્ર છે.

‘દિનવારી’ને અંતે, અગાઉ કર્યું એમ, ૧૮૦ ઉપરાંત  
પાનાંની સૂચિઓ આપવામાં આવી છે. એ સૂચિઓ પાંચ  
પ્રકારની છે : સ્થળવાર, પ્રકોઇઝ, કારાવાસની, ઉપવાસની  
અને આધારોની. આવું જીણું વર્ગીકૃત સૂચિકરણ પણ આ  
‘સંગ્રાહક’ને સંશોધકનો દરજો આપે એવાં ચીવટ ને  
સૂઝાનો પરિચય કરાવનાર છે. એથી ગ્રંથનું મહત્વ  
અનેકગણ્યું વર્ધી જાય છે.

૧૯૭૦ની પહેલી આવૃત્તિ ગાંધીજનમશતાબ્દી  
(૧૯૬૮)ની ઉજવાણીના પ્રસંગે ‘ગુજરાત રાજ્ય મહત્વમાં  
ગાંધી જનમશતાબ્દી સમિતિ’એ પ્રકાશિત કરેવી. ૧૯૮૦ની  
આ સંવર્ધિત આવૃત્તિ (સદ્ગત) ચંદુલાલ દલાલના પુત્ર  
કશ્યપભાઈએ, પિતાએ કરેલા સુધારા-વધારા આમેજ  
કરીને આપેલી તે, ચિમનભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં  
માહિતીખાતાએ પ્રગટ કરી હતી..

આજે સમાજમાં જ્યારે આદર્શ જીવન લગભગ લુપ્ત  
થતું જાય છે, પ્રખર વ્યક્તિત્વવાળી મેધાવી વ્યક્તિઓ  
દસ્તિગોચર થતી નથી ત્યારે ‘ગાંધીજીની દિનવારી’ પુસ્તક  
એક અર્થમાં આ જીવનઘડતરનાં મૂલ્યોને પુનઃ ધબકતાં  
કરનારું છે. ગાંધીવિચારથી આચરણ સુધીના સેતુ સમાન છે.  
‘દિનવારી’ માત્ર ‘દિનવારી’ નથી પરંતુ એક એવી દીવાદાંડી  
છે જે આપણું ધ્યાન આ અમૂલ્ય મૂડી તરફ દોરતી રહેશે.

લેખક આ પુસ્તક સંદર્ભે પ્રમાણભૂત ઈતિહાસ અને  
સાચા જીવનચિત્રની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે.  
એટલે આવી જે કોઈ માહિતી આજે મળી શકે એમ હોય  
એ એકઠી કરવી અને સાચવવી ખૂબ જરૂરી છે. “નહિએ  
તો માણસની માફક, માહિતી પણ ભવિષ્યમાં જોવાઈ  
જવાનો ડર છે.” આ ગ્રંથ પાછળનો આ પણ એક મૂળભૂત  
હેતુ છે એ જીથી વાચક ગાંધીજી ઉપર વારી જાય એટલો  
જ આ સંગ્રાહક ઉપર પણ વારી ગયા વગર રહી શકતો  
નથી.

વૈચિકીકરણના આ સમયમાં ‘ગાંધીજીની  
‘દિનવારી’ નામનો આ ગ્રંથ સૌકોઈને, હવે ઉપલબ્ધ ન  
હોય એ સંજોગોમાં, ફરી ઉપલબ્ધ થાય અને ગાંધી-  
ચેતનાનાં સ્પંદનો વધુ ને વધુ વહેતાં થાય એવું શાશ્વી  
ગુજરાતના શાશ્વત માણસો નહીં વિચારે ? □

## સામયિક લેખસૂચિ : ૨૦૧૧

**૧. 'કવિતા : આસ્વાદ'થી 'કવિતા : અભ્યાસ' સુધી**

### કિશોર વ્યાસ

- ૨૦૧૧ના વર્ષમાં (જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન) ગુજરાતી સાહિત્યનાં સામયિકોમાં પ્રગટ થયેલાં સાહિત્યિક આસ્વાદ, અવલોકન, સમીક્ષા, લેખ, સિદ્ધાંતવિચાર, ચર્ચા, ઊઠાપોહ અંગેનાં લખાણોને સ્વરૂપ-અનુસાર, અને તે સ્વરૂપ-અંતર્ગત સમીક્ષા, આસ્વાદ, અભ્યાસલેખ એવા પેચાબીએ અનુસાર, અકારાદિકમે ગોઠવીને આ સૂચિ કરી છે.
- અડધાક પાનામાં પ્રગટ થયેલા પુસ્તક-પરિચયો, પરિસંવાદોના અહેવાલો, પ્રાસંગિક નોંધો, ઈત્યાદિ સામગ્રીનો સમાવેશ આ સૂચિમાં કર્યો નથી. એ અર્થમાં આ સંપાઠિત સૂચિ છે
- આસ્વાદ અને સમીક્ષાઓની સૂચિ કૃતિનામના ક્રમે કરી છે - શીર્ષકનામને તાં સમાવ્યું નથી. એ સિવાયનાં લખાણોની સૂચિ શીર્ષકનામથી કરી છે.
- કમ આ મુજબ છે : કૃતિનામ / લેખશીર્ષક - (લેખક/અનુવાદ/સંપાદક) - સમીક્ષક / આસ્વાદક / વિવેચક, સામયિક, માસ પૃષ્ઠ (- થી -)
- સમાવિષ્ટ સામયિકો (અકારાદિકમે) અર્થાત્, ઉદ્દેશ, એતદ્વારા, કવિતા, કવિલોક, કુમાર, તથાપિ, તાદર્થી, દલિતચેતના, ધબક, નવનીત-સમર્પણ, પરબ, પ્રત્યક્ષ, કંઈસસભા, ટ્રેમાસિક, બુદ્ધિપ્રકાશ, રાજભાષા, વિ..., વિવિધાસંચાર, શબ્દસર, શબ્દસૂચિ, સંખ્ય, સમીપે, હ્યાતી : કુલ ૨૩ સામયિકો.

### કવિતા આસ્વાદ

- અનહંદ અપાર વરસે (નયના જાની) - રમણીક અગ્રાવત,  
વિવિધાસંચાર, જૂન-એંગેસ્ટ, ૬૧-૨  
અમે ઈડારિયા પથરો (ઉમાશંકર જોશી) - નરોતમ પવાણા,  
શબ્દસૂચિ, માર્ચ, ૬૬-૮  
અમે પોતે અમારે અગરાજ રે (લખિત નિવેદી) - અચિન  
ચંદ્રારાણા, ઉદ્દેશ, જાન્યુ., ૦૪૫-૪૬  
અદ્યા મેહુલા । (રાજેન્ડ શાહ) - યોગેશ જોપી, કવિલોક,  
જાન્યુ.-ફેબ્રૂ., ૬૬-૭  
અવિવા દિલ્હી (ઉમાશંકર જોશી) - રવીન્દ્ર પારેખ, પરબ,  
જાન્યુ.-ફેબ્રૂ., ૩૦૮-૧૫  
અવિવાહિતનું કાબ્ય (અરવિંદ ભણ) - દક્ષા વ્યાસ, તાદર્થી,  
એપ્રિલ, ૪૪-૫  
અહીંથી અલવિવા (રમેશ જાની) - રાજેન્ડ ઉપાધ્યાય, વિ..., ફેબ્રૂ.,  
૩૮-૮  
અંધ થતાં (રેઠનર મારિયા રિલ્કે) - પ્રબોધ ર. જોશી, ઉદ્દેશ,  
માર્ચ, ૪૬૫-૬૬  
આત્માના ખંડેર : સોનેટ માળા (ઉમાશંકર જોશી) - ચન્દ્રકાન્ત  
ટેપીવાળા, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૧૩૫-૫૦  
આપણા દુઃખનું કેટલું જોર ? (રાજેન્ડ શાહ) - રઘુવીર ચૌધરી,  
કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૬૪-૫

આપની યાદી (કલાપી) - રાજેશ વ્યાસ 'મિસ્કીન', પરબ, મે,  
૪૧-૫૦

આયુષ્ણના અવશેષ (રાજેન્ડ શાહ) - ધીરુ પરીખ, કવિલોક,  
જાન્યુ.-ફેબ્રૂ., ૨૩-૮

આવ્યો છું મેહિરો જોવા (ઉમાશંકર જોશી) - પારુલ કંદર્પ  
દેસાઈ, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૧૭૮-૮૬

અષાઢ (નિરંજન ભગત) - રમણીક અગ્રાવત, કવિલોક, મે-જૂન,  
૩૪-૫

અંસુ (ઉશનસ્ય) - ચન્દ્રકાન્ત ટેપીવાળા, શબ્દસૂચિ, જાન્યુ.,  
૩૧-૪

દુંધણા વિશેવા જૈતી (રાજેન્ડ શાહ) - હરિકુષ્ણ પાઠક,  
કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૬૨-૩

ઉપેક્ષિતનું અવિંગન (રાજેન્ડ શાહ) - રાજેન્ડ પટેલ, કવિલોક,  
જાન્યુ.-ફેબ્રૂ., ૧૧૨-૧૪

ઉમાશંકર જોશીનાં કેટલાંક મુક્તકો વિશે - યોસેફ મેકવાન,  
પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૩૬૬-૭૧

ઉંગી ગંગો (એસ. એસ. રાહી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ,  
દિસે., ૨૮-૩૦

ગેડે રે તારી ચૂંદી (ઉમાશંકર જોશી) - લાભશંકર દાકર,  
પરબ, એપ્રિલ, ૨૬-૩૧

માસિક

જાન્યુઆરી-માર્ચ  
૨૦૧૨ માસ

૧૧

- એક જાડ (ઉમાશંકર જોશી) – રમણીકલાલ સોમેશ્વર, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૮૮-૮૦
- એક પંખીને કંઈક (ઉમાશંકર જોશી) – રાજેશ પંડ્યા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૮૪-૮૮
- એક બાળકોને સ્મરણ લઈ જતાં (ઉમાશંકર જોશી) – પ્રબોધ ર. જોશી, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૭૩-૭૫ – હર્ષ બ્રહ્મભટ્ટ, પરબ, જૂન, ૫૦-૩
- એક સાંજ (રાજેન્દ્ર શાહ) – નરોત્તમ પલાણા, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૧૮-૧૮
- એમ પણ બને (મનોજ ખંડરિયા) – રમણીક અગ્રાવત, ઉદ્દેશ, ઓક્ટો., ૧૨૧
- ઓંધાળી રહી નહીં (રાજેન્દ્ર શાહ) – ભગવતીકુમાર શર્મા, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૧૫-૧૭
- કચ (ઉમાશકર જોશી) – અનિલા દલાલ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૪૮-૬૧
- કણી (રાજેન્દ્ર શાહ) – મણિલાલ હ. પટેલ, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૮૨-૫
- કર્ણ-કૃષ્ણ (ઉમાશંકર જોશી) – યજોશ દવે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૧૫૪-૬૮
- કર્માંથી (મનહર મોદી) – યોસેફ મેકવાન, તિ., સપે., ૨૬
- કળતર (મોહન પરમાર) – રાજેશ વણકર, તાદર્થી, ઓગસ્ટ, ૩૬-૪૧
- કહીં તવ જરૂર ? (રાજેન્દ્ર શાહ) – દેવેન્દ્ર દવે, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૨૦-૪૧
- કાગળ (નીતિન મહેતા) – લાભશંકર ઠાકર, સંધી, જુલાઈ-સપે., ૫૦-૪
- કાલિન્દીની કેડીએ (રાજેન્દ્ર શાહ) – કીર્તિદા શાહ, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૨૬-૨૭
- કાળનો કલવ (રાજેન્દ્ર શાહ) – ધીરુભાઈ ઠાકર, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૨૮-૨૮
- કૂકા (રાધેશ્યામ શર્મા) – યોસેફ મેકવાન, ઉદ્દેશ, એપ્રિલ, ૫૨૮-૨૮
- કેવળ વાદન-વિવાદા (હરિશ્ચંદ જોશી) – નીતિન વડગામા, કવિલોક, માર્ચ-એપ્રિલ, ૩૭-૮
- કેવળ હું એક અંખ (રાજેન્દ્ર શાહ) – રાજેશ વ્યાસ, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૩૭-૩૮
- કોઈ રે ખોલો (હિલીપ ઝવેરી) – રાધેશ્યામ શર્મા, પરબ, જુલાઈ, ૪૨-૪
- ગજવે ઘાલી ફું (મુકુંદ પરીખ) – રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૨૯૦-૦
- ગબડાવી દે, ફેંગોળી દે... (જ્યદેવ શુક્લ) – લાભશંકર ઠાકર, પરબ, નવે., ૪૫-૮
- ગયાં વર્ષો (ઉમાશંકર જોશી) – ધીરેન્દ્ર મહેતા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૨૭-૩૦
- ગાણ્યું અધ્યુરું (ઉમાશંકર જોશી) – અનિલ જોશી, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૧૫૧-૫૩
- ગામને કૂવે (ઉમાશંકર જોશી) – દલપત પઢિયાર, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૧૮૭-૧૮૮
- ગુજરાત મોરી મોરી રે (ઉમાશંકર જોશી) – ભાગ્યેશ જહા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૮૫-૮૭
- ગુલામ (ઉમાશકર જોશી) – હરીશ વટાવવાળા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૩૫-૩૭
- ગૃહિણી (હરીશ મીનાશ્રુ) – જ્યદેવ શુક્લ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૭૭-૮૧
- ગોકળગાય (ઉમાશંકર જોશી) – પ્રદીપ ખાંડવાળા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૮૮-૩૦૧
- ગોળારી વાવ (મનીષા જોખી) – રમણીક અગ્રાવત, વિવિધસંચાર, જૂન-ઓગસ્ટ, ૬૩-૫
- ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય (ઉમાશંકર જોશી) – વિનોદ જોશી પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૪-૧૯૬
- ઘટમાં જાલર બાજે (ઉજમશી પરમાર) – રમણીક અગ્રાવત, ઉદ્દેશ, મે, પદ્ધત
- ચંદ્રવદન એક (ઉમાશકર જોશી) – પ્રવીજ પંડ્યા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૩૧૬-૨૦૦
- ચૈત્રની રાત્રિઓમાં (ઉમાશંકર જોશી) – જ્યદેવ શુક્લ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૩-૦૭
- છિન્નાભિન્ન હું (ઉમાશંકર જોશી) – લાભશંકર ઠાકર, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૩૨૧-૨૮
- જઠરાજિન (ઉમાશંકર જોશી) – નીરવ પટેલ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૩૮-૪૦
- જળાશયની અચાનક પાળ (રમણીક સોમેશ્વર) – માવજી મહેશ્વરી, દલિતચેતના, ઓગસ્ટ, ૧૮-૨૧
- ઝંખના (ઉમાશંકર જોશી) – હર્ષદ ત્રિવેદી, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૪૧-૪૪
- ડોશીની વાતો (બાબુ સુથાર) – લાભશંકર ઠાકર, સંધી, ઓક્ટો.-નિસે., ૧૦૨-૮
- તને જોઈ જોઈ તોય તું અજાણી (રાજેન્દ્ર શાહ) – નીતિન વડમામા, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૫૬-૫૮
- તરસ (રાજેન્દ્ર શાહ) – નાલિની દેસાઈ, કવિલોક, જા.ફ., ૧૩૦-

તીર્થોત્તમ (बालમुકुंદ દવે) – દેવેન્દ્ર દવે, ઉદ્દેશ, સાએ. ૮૮	પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાળા (ઉમાશંકર જોશી) – દક્ષા વ્યાસ, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૧૨૮-૩૦
તૃપાણિ વર્ષા (કિશોરસિહ સોલંકી) – રાધેશ્યામ શર્મા, કવિલોક સાએ. ઉર-ઉર	પ્રશાન્ત કાણ (ઉશનસ્ય) – સુરેશ દલાલ, કવિતા, ડિસે. ૪૦-૧
થોડો એક તડકો (ઉમાશંકર જોશી) – કિશોર વ્યાસ, પરબ જા.ફે. ૨૦૮-૧૦	પ્રશ્નો (ઈન્દ્ર શાહ) – લાભશંકર ઠાકર, સંધી, જુલાઈ-સાએ., ૫૪-૮
દ્યારામનો તંબૂર જોઈને (ઉમાશંકર જોશી) – બોળાભાઈ પટેલ, પરબ ૧૬૬-૭૮	પ્રાસાનુપ્રાસ (રાજેન્દ્ર શાહ) – યોસેફ મેકવાન, કવિલોક, જાન્યુ.- ફેબ્રૂ., ૨૮-૩૫
દર્શન (ઉમાશંકર જોશી) સિલાસ પેટેલિયા પરબ જા.ફે. ૨૧૧- ૧૮ જાન્યુ.-ફેબ્રૂ. ૧૬૬-૭૮	પ્રેમની પાટી (દ્યાનંદ મુંદિયા સ્વામી) – કારુક શાહ, નવનીતા સમર્પણ, ડિસે., ૩૦-૫
દળણાના દાણા (ઉમાશંકર જોશી) – મનોહર ત્રિવેદી, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૫૮-૬૧	બળતં પાણી (ઉમાશંકર જોશી) – ભાનુપ્રસાદ પંડ્યા, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૬૮-૭૨
ધારાવસ્ત્ર (ઉમાશંકર જોશી) – આજિત ઠાકોર, પરબ, જાન્યુ.- ફેબ્રૂ., ૩૦૨-૦૫	બાઅદબ આ શાબ્દને (સંલીમ શેખ ‘સાલસ’) – શૈલેષ પંડ્યા, ધબક, સાએ., ૪૩-૫
ન વાત વ્યતીતની (રાજેન્દ્ર શાહ) – ચિમનલાલ ત્રિવેદી, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૮૭-૮	બીડમાં (રાજેન્દ્ર શાહ) – ભાનુપ્રસાદ પંડ્યા, કવિલોક, જાન્યુ.- ફેબ્રૂ., ૮૬-૧૦૦
નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા (ઉમાશંકર જોશી) – રમેશ એમ. ત્રિવેદી, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૧૧૮-૨૦	બીડમાં સાંજવેળા (ઉમાશંકર જોશી) – નીતિન વડગામા, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૬૫-૬૭
નિરુદ્ધે (રાજેન્દ્ર શાહ) – ચંદ્રકાંત શેઠ, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૨૦-૨	બોલીએ ના કંઈ (રાજેન્દ્ર શાહ) – હર્ષદ ત્રિવેદી, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૭૧-૩
નિશિ અંધારે (રાજેન્દ્ર શાહ) – લાભશંકર ઠાકર, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૧૨૦-૨૨	ભલે શુંગો લોચાં (ઉમાશંકર જોશી) – ઉષા ઉપાધ્યાય, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૨૨૪-૨૬
નોશિયાળ અવસાદ (ભાનુપ્રસાદ પંડ્યા) – રાધેશ્યામ શર્મા, ઉદ્દેશ, ફેબ્રૂ., ૪૦૮-૧૦	ભૌમિયા વિના (ઉમાશંકર જોશી) – મણિલાલ હ. પટેલ, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૫૫-૫૭
પરંપરા (હર્ષદ ત્રિવેદી) – રાધેશ્યામ શર્મા, એતદ્દ, જુલાઈ-સાએ., ૮૨-૫	મધ્યરાનીએ મુંબઈ (રાજેન્દ્ર શાહ) – યશવંત ત્રિવેદી, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૭૪-૮
પત્રાનુભૂતિ (ભગવતીકુમાર શર્મા) – સંધ્યા ભણ, બુદ્ધિગ્રંથ, ઓક્ટો., ૩૨-૩	મધ્યાત્ (ઉમાશંકર જોશી) – પ્રસાદ બ્રહ્મભણ, પરબ, જાન્યુ.- ફેબ્રૂ., ૧૮૭-૧૧
પંખીલોક (ઉમાશંકર જોશી) – ચંદ્રકાંત શેઠ, પરબ, જાન્યુ.- ફેબ્રૂ., ૩૫૧-૬૫	મળી ન્હોતી જ્યારે (ઉમાશંકર જોશી) – દર્શના ધોળકિયા, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૮૦-૮૫
પંચમી આવી વસ્તંતની (ઉમાશંકર જોશી) – પ્રકુલ્લ રાવલ, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૨૦૦-૦૨	મહેક (રાજેન્દ્ર શાહ) – કુમારપાળ દેસાઈ, કવિલોક, જાન્યુ.- ફેબ્રૂ., ૧૦૧-૦૨
પાનખરની સંધ્યા (રાજેન્દ્ર શાહ) – નાલિન રાવળ, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૫૦-૨	મંગલ શાબ્દ (ઉમાશંકર જોશી) – ધીરુ પરીખ, પરબ, જાન્યુ.- ફેબ્રૂ., ૨૩-૨૭
પીઠું (ઉમાશંકર જોશી) – રમણીક અગ્રાવત, પરબ, જાન્યુ.- ફેબ્રૂ., ૬૨-૬૪	મંથરા (ઉમાશંકર જોશી) – પરેશા નાયક, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૨૩૧-૪૮
પુલક પુલક અંગે (રાજેન્દ્ર શાહ) – પ્રસાદ બ્રહ્મભણ, કવિલોક, જાન્યુ.-ફેબ્રૂ., ૧૩૪-૩૬	માઈલોના માઈલો મારી અંદર (ઉમાશંકર જોશી) – રધુવીર ચૌધરી, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૨૮૪-૮૭
	માતૃલહરી (રસિક કવિ) – દીક્ષા એચ. વાંગેલા, દવિતચેતના, મે, ૧૧-૫

માટેલે

જાન્યુઆરી-માર્ચ  
૨૦૧૨ ૫૩

- માનવીનું હૈયું (ઉમાશંકર જોશી) – ભગીરથ બહાબહુ, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૮૪-૮૬
- માય મિસ્ટ્રેસ (રોક્સપિયર) – રાજેશ્વરી પટેલ, શબ્દસૂચિ, જાન્યુ., ૧૫-૭
- મીનકેતુ (રાજેન્ડ શાહ) – મહેશ દવે, કવિલોક, જાન્યુ.-હેલ્પુ., ૧૦૩-૦૪
- મુર્ધન્ય કવિ (ઉમાશંકર જોશીને શતાબ્દી વંદના (યશવંત ત્રિવેદી)) – રાહેશ્યામ શર્મા, કવિલોક, મે-જૂન, ૩૬-૮
- મૂળિયાં (ઉમાશંકર જોશી) – સુમન શાહ, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૨૮૧-૮૩
- મ્હોર્યા માંડવા (ઉમાશંકર જોશી) – હરિકૃષ્ણ પાઠક, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૧૩૧-૩૪
- યામનીને છિનાર (રાજેન્ડ શાહ) – ચન્દ્રકાન્ત ટોપીવાળા, કવિલોક, જાન્યુ.-હેલ્પુ., ૫-૧૫ – નિરંજન ભગત, કવિલોક, જાન્યુ.-હેલ્પુ., ૫-૧૮
- રડો ન મુજ મૃત્યુને (ઉમાશંકર જોશી) – રાજેન્ડ પટેલ, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૨૨૦-૨૩
- રહસ્યો તારાં (ઉમાશંકર જોશી) – ભાનુપ્રસાદ પંડ્યા,, શબ્દસૂચિ, જૂન, ૧૦-૩
- રાણિણી (રાજેન્ડ શાહ) – પ્રવીષ દરજી, કવિલોક, જાન્યુ.-હેલ્પુ., ૭૮-૮૬
- રાજસ્થાનમાં પસાર થતોં (ઉમાશંકર જોશી) – યોગેશ જોપી, શબ્દસૂચિ, સાપે., ૮-૧૨ – સતીશ વ્યાસ, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૨૬-૨-૬૫
- રાધાકાવ્ય (રમાકાન્ત રથ, અનુ. ઉર્મિલા બળવંત જાની) – તૌશિક પંડ્યા, કવિલોક, નવે.-દિસે., ૩૩-૭
- રોજરોજે શું નવું આપું તને ? (કિશોર મોટી) – એસ. એસ. રાહી, કવિલોક, જુલાઈ-ઓગસ્ટ, ૩૭-૮
- લાખા સરખી વાર્તા (રમેશ પારેખ) – શક્તિસિંહ પરમાર, શબ્દસૂચિ, એપ્રિલ, ૬-૫-૮
- લોકલમાં (ઉમાશંકર જોશી) – નિરંજન ભગત, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૧૨૧-૨૭ – સુરેશ દલાલ, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૧૨૭-૨૮
- વહ દિન કબ આયેગા (ઓમપ્રકાશ વાલ્મીકિ) – સિલાસ પટેલિયા, વિવિધાસંચાર, સાપે.-નવે., ૬-૨-૫
- વંધ્યાવિલાપ (રમેશ પારેખ) – પરેશ કળસરિયા, તાદર્થ્ય, મે, ૪૭-૮
- વાસણ (રવીન્દ્ર પારેખ) – ચન્દ્રકાન્ત ટોપીવાળા, સામીપે,
- એપ્રિલ, ૮૬-૮ – ધીરેન્દ્ર મહેતા, ઉદ્દેશ, જૂન, ૬-૫૩-૫૫  
વાંસળી વેચનારો (ઉમાશંકર જોશી) – પ્રવીષ ગઢવી, પરબ,  
જાન્યુ.-હેલ્પુ., ૧૧૪-૧૭
- વિજન અરણ્યે (રાજેન્ડ શાહ) – કનુભાઈ જાની, કવિલોક,  
જાન્યુ.-હેલ્પુ., ૩૬-૪૪
- વિરતિ હું અને તું (મહેન્દ્ર અમીન) – દિનેશ દેસાઈ, શબ્દસર,  
જુલાઈ, ૩૧-૪
- વિશ્વમાનવી (ઉમાશંકર જોશી) – રાહેશ્યામ શર્મા, પરબ,  
જાન્યુ.-હેલ્પુ., ૪૫-૪૮
- વિશ્વશાંપાત્રી (ઉમાશંકર જોશી) – ઉશનસૂ, પરબ, જાન્યુ.-હેલ્પુ., ૨૮-૩૪
- વૃક્ષ (કૃષ્ણ દવે) – રમણીક અગ્રાવત, ઉદ્દેશ, ઓગસ્ટ, ૩૧-૨  
વૃક્ષ મારામાં (ફ્લિપ કલાર્ક) – રાહેશ્યામ શર્મા, બુદ્ધિગ્રંથ,  
નવે., ૩૬-૭
- વૃષભાવતાર (ઉમાશંકર જોશી) – રત્નિલાલ બોરીસાગર, પરબ,  
જાન્યુ.-હેલ્પુ., ૨૬૬-૮૦
- શાંત કોલાહલ (રાજેન્ડ શાહ) – પ્રકુલ્લ ચાવલ, કવિલોક,  
જાન્યુ.-હેલ્પુ., ૮૦-૧
- શું શું સાચે લઈ જઈશ હું ? (ઉમાશંકર જોશી) – પ્રવીષ દરજી,  
પરબ, જાન્યુ.-હેલ્પુ., ૨૮૧-૮૩
- શું હું ગુજરાતી હું ? (કમલ વોરા) – લાભશંકર ઠાકર) નવનીત  
સમર્પણ, નવે., ૩૨-૪
- શોધ (ઉમાશંકર જોશી) – સિતાંશુ યશશ્વરી, પરબ, જાન્યુ.-હેલ્પુ.,  
૩૨૯-૪૩
- શ્રાવણ હો (ઉમાશંકર જોશી) – સંજુ વાળા, પરબ, જાન્યુ.-હેલ્પુ.,  
૧૮૨-૮૩
- શ્રાવણી મધ્યાક્ર (રાજેન્ડ શાહ) – ચિનુ મોટી, કવિલોક, જાન્યુ.-હેલ્પુ., ૪૫-૫
- શ્રુતિહીન સૂર (રાજેન્ડ શાહ) – પ્રબોધ ર. જોશી, કવિલોક,  
જાન્યુ.-હેલ્પુ., ૧૩૨-૩૩
- સખી મેં કલ્પિતી (ઉમાશંકર જોશી) – માધવ રામાનુજ, પરબ,  
જાન્યુ.-હેલ્પુ., ૮૮-૮૮
- સદ્ગત મોટાભાઈ (ઉમાશંકર જોશી) – ચિનુ મોટી, પરબ,  
જાન્યુ.-હેલ્પુ., ૮૭-૧૦૪
- સફ્ફર (હેમન્ત દેસાઈ) – દેવેન્દ્ર, ઉદ્દેશ, નવે., ૧૮૪
- સમરકંદ-બુખારા (ઉમાશંકર જોશી) – રાજેન્ડસિંહ જ. ગોહિલ,  
પરબ, જાન્યુ.-હેલ્પુ., ૪૮-૫૪
- સંગમાં રાજી રાજી (રાજેન્ડ શાહ) – રાહેશ્યામ શર્મા, કવિલોક,  
જાન્યુ.-હેલ્પુ., ૫૮-૬૧

સંગ્રહ (રાજેન્દ્ર શાહ) – અશોક ચાવડા, કવિલોક, જાન્યુ.-ફેબ્રુ., ૧૦૫-૦૭

સાબરનો ગોઠિયો (ઉમાશંકર જોશી) – મહેન્દ્રસિંહ પરમાર,  
પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૧૦૫-૧૧૩

સામરસ્ય (રાજેન્દ્ર શાહ) – વિનોદ અધ્વર્યુ, કવિલોક, જાન્યુ.-  
ફેબ્રુ., ૧૦૮-૧૧

સાસણગીરમાં સિહમય રાત્રિ (ઉમાશંકર જોશી) – લાભશંકર  
પુરોહિત નવનીત સમર્પણ, એપ્રિલ, ૮૪-૬

સીમ અને ઘર (ઉમાશંકર જોશી) – રમેશ ર. દવે, પરબ, જાન્યુ.-  
ફેબ્રુ., ૩૦૬-૦૮

સુકાન પર ટેકવી (કૃષ્ણલાલ શ્રીધરાણી) – નીતિન વડગામા,  
તાદર્થ્ય, જૂન, ૩૦-૨

સૈયર મોરી (રાજેન્દ્ર શાહ) – ભગીરથ બ્રહ્મભણ, કવિલોક,  
જાન્યુ.-ફેબ્રુ., ૧૨૩-૨૫

સ્વખોને સળગંબ હોય તો (ઉમાશંકર જોશી) – ચંદ્રકાન્ત શેઠ,  
પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૩૪૪-૫૦

હરિજનગાથા (નાગાર્જુન) – ઓમપ્રકાશ વાલ્મીકિ, દાખિતના,  
નવે., ૨૧-૭

હા..હું સાક્ષી છું (રાજેન્દ્ર શાહ) – પ્રવીણ પંડ્યા, કવિલોક,  
જાન્યુ.-ફેબ્રુ., ૧૪૨-૫૧

હું ગૂર્જર ભારતવાસી (ઉમાશંકર જોશી) – ભગવતીકુમાર  
શર્મા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૬૬-૬૮

હું મુજથી અણાણા (રાજેન્દ્ર શાહ) – નલિન પંડ્યા, કવિલોક,  
જાન્યુ.-ફેબ્રુ., ૬૮-૭૦

**કાવ્યસંગ્રહ સમીક્ષા**

અનસ્ત સૂર્ય (કિસન સોસા) – દાન વાદેલા, તાદર્થ્ય, જૂન, ૨૩-  
૧૫

અનુવિધાન (હેમાંગ દેસાઈ) – સિલાસ પટેલિયા, બિ. મે, ૧૫-  
૧૬

અંતઃસ્વર (કિશોર ભૂપતાણી) – નરેશ શુક્લ, શબ્દસૂચિ, ડિસે.,  
૭૫-૬

અરોમની કિવિતા (ધનજી પીઠવા અરોમ) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૫૩

આવતી કાલે (નીલેશ કાથડ) – કરસનદાસ લુહાર,  
દાખિતચેતના, જૂન, ૧૫-૮

આંખોના આકાશમાં (લાલિત રાણા) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૫૧-૩

ઉર્મિની ઈમારત (રાજ નવસારવી) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, જૂન, ૫૮-૦

એક અલ્લા છોકરી (દિલીપ મોટી) – ગુણવંત ઉપાધ્યાય,  
પરબ, જુલાઈ, ૬૫-૮

એક ચંદ ઓછો પડે (ભૂપેન્દ્ર વાસ) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, સપ્ટે., ૪૮

એક પીછું હવામાં તરે છે (હિતેન આનંદપરા) – જિગર જોશી,  
બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૪૭-૮

ઓથાર ૨૦૦૨ (અદમ ટેકારવી) – દાઉદભાઈ ઘાંચી, તાદર્થ્ય,  
માર્ચ, ૩૪-૬

કલાન્ત કવિ (બાળશંકર કંથારિયા, સં. ઉમાશંકર જોશી) –  
રતિલાલ બોરીસાગર, શબ્દસૂચિ, જુલાઈ, ૩૫-૪૨

કામાખ્યા (ચંદ્રકાન્ત ટેપીવાળા) – રાહેશયામ શર્મા, પ્રત્યક્ષ,  
જાન્યુ.-માર્ચ, ૭-૮

કાવ્યસુષ્પામા (મનસુખલાલ ઝવેરી, સં. અનંતરાય રાવળ વ.) –  
ચંદ્રકાન્ત ટેપીવાળા, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૫૦-૩

કયાંક હશે (પીયૂષ પંડ્યા) – મધુ કોઠારી, તાદર્થ્ય, જુલાઈ, ૩૧-  
૫

કે લાગ્યો રંગ હારિ (પીયૂષ પંડ્યા) – રક્ષાબહેન પ્ર. દવે, પરબ,  
સપ્ટે., ૫૮-૬૩

કોડિયાં (કૃષ્ણલાલ શ્રીધરાણી) – મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ,  
માર્ચ, ૧૦-૮

ગરમાળો (વિવેક મનહર ટેલર) – રાહેશયામ શર્મા, કુમાર,  
જુલાઈ, ૭૭૧

ગુજરાતી કવિતાચયન ૨૦૦૬ (સં. વિનોદ જોશી) – ગુણવંત  
વાસ, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૧૭

ગુજરાતી કવિતાચયન ૨૦૦૭ (સં. સંજુ વાળા) – ગુણવંત  
વાસ, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૭-૧૧

ગુજરાતી દાલિત કવિતા (સં. નીરવ પટેલ) – રમણ સોની,  
પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૭-૧૧

ઘરજુરાપો (બાબુ સુથાર) – રાહેશયામ શર્મા, એતદ્દ, માર્ચ, ૪૭-  
૫૦

જદરાણિ (દાન વાદેલા) – મોહન પરમાર, દાખિતચેતના, જૂન,  
૨૦-૫

જવવાનો રિયાજ (હર્ષ બ્રહ્મભણ) – નરેશ શુક્લ, શબ્દસૂચિ, મે,  
૮૮-૯૦ – રશીદ મીર, ધબક, માર્ચ, ૭૪-૭

ટકોરા મારું છું આકાશને (યોગેશ જોશી) – ચિનુ મોટી, પ્રત્યક્ષ,  
ઓક્ટો.-ડિસે., ૫-૮

- ટહુકે વરસ્યું આબ (પીતમ લખલાણી) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, જૂન, ૬૦ – મધુ કોઠારી, કવિલોક, જુલાઈ-  
ઓગસ્ટ, ૩૫-૬
- ટાપુઓ પર કૂદાડી (વિપાશા) – સેજલ શાહ, એટાંદ, જૂન, ૬૩-  
૭૦
- તણખલાં (રવીન્દ્રનાથ, અનુ. જ્યંત મેઘાણી) – ભાનુપ્રસાદ  
પંડ્યા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૪૮
- તત્ત્વ (લક્ષ્મી ડેબરિયા, અન્ય) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, ૪૧-૨
- તમને મળ્યાંનું યાદ છે (નરેન્દ્ર જોશી) – રશીદ મીર, ધબક,  
ડિસે., ૫૩-૪
- ધનિ (રાજેન્દ્ર શાહ) – કુમાર જૈમિની શાસ્ત્રી, શબ્દસર, ફેબ્રુ.,  
૨૭-૩૦
- નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદો (સં. શિવલાલ જેસલપુરા) –  
પ્રકૃત્ય મહેતા, બુદ્ધિપ્રકાશ, નવે., ૫૩-૪
- નારી : લીલાછમ કયારી (મધુ કોઠારી) – અરુણ જે. કક્કડ,  
તાદર્થ્ય, ઓક્ટો., ૨૬-૮
- નિશીથ (ઉમાશંકર જોશી) – જ્યંત ઉમરેઠિયા, વિવિધસંચાર,  
સપે.-નવે., ૪૨-૬
- પવનની પાલખીમાં (દિવ્યાક્ષીબહેન શુકલ) – મધુ કોઠારી,  
તાદર્થ્ય, ફેબ્રુ., ૩૬-૮
- પેન્સિલવેનિયા એવન્યુ (નટવર ગાંધી) – મધુસૂદન કાપડિયા,  
પ્રત્યક્ષ, જુલાઈ-સપે., ૫-૧૦
- પ્રીતની બારાબરી (વિષ્ણુ પાઠક) – ગંભીરસિંહ ગોહિલ,  
તાદર્થ્ય, એપ્રિલ, ૩૮-૪૨
- ફાર્બસવિલાસ (દલપત્રામ) – ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ,  
ઓક્ટો.-ડિસે., ૨૦-૨
- બચાવનાંનું (રઘુનીર ચૌધરી) – લોળાભાઈ પટેલ, બુદ્ધિપ્રકાશ,  
જાન્યુ., ૮-૧૨
- બહિજીત કૂલો (નીરવ પટેલ) – રાજેન્દ્રસિંહ ગોહિલ, શબ્દસર,  
મે, ૧૭-૨૧
- બૃહદ પરિક્મા (બાલમુકુંદ દવે, સં. હરિકૃષ્ણ પાઠક) – નરેશ  
શુકલ, શબ્દસૂચિ, સપે., ૮૮-૮૦
- ભાણે તુકો (તુકારામ, અનુ. અરુણા જાડેજા) – અરુણા જાડેજા,  
ઉદ્દેશ, નવે., ૧૬૮-૭૩
- મધુકાન્ત કલ્પિત એક અફ્વા છે (મધુકાન્ત કલ્પિત) – અશોક  
ચાવડા, કવિલોક, સપે.-ઓક્ટો., ૩૪-૭
- મધુકોષ (નાનાલાલ) – નવીન કા. મોદી, વિવિધસંચાર, ફેબ્રુ.-  
માર્ચ-મે, ૧૧-૭
- માવડી મીઠી છાંય (સં. દીપક બારડોલીકર) – ભાનુપ્રસાદ  
પંડ્યા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૪૭-૮
- મિત્ર (ભાબાશંકર પણ્ણી) – વિનોદ જોશી, શબ્દસૂચિ, એપ્રિલ,  
૭૦-૬
- મોંઘેરી મિચાત મીરાં (સં. પ્રદીપ રાવલ) – મધુસૂદન પારેખ,  
બુદ્ધિપ્રકાશ, નવે., ૫૨-૩
- લઈ જિસસામાં તડકો (મનોજ શુકલ) – કમલેશ સોલંકી,  
તાદર્થ્ય, ઓક્ટો., ૩૪-૪૦
- લય-શિલ્પ (મહેન્દ્રસિંહ પઢ્યાર) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, સાપે., ૪૮-૮
- લાપતાની શોધ (રશીદ મીર) – આહમદ મકરાણી, ધબક,  
ડિસે., ૪૬-૮ – ભાનુપ્રસાદ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૪૪
- વિશ્વાંતિ (ઉમાશંકર જોશી) – રમેશ મ. ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ,  
એપ્રિલ, ૨૭-૩૧
- શાલ્દ બાંધો સૂરજ (સં. ચંદુ મહેરિયા, અન્ય) – મધુસૂદન  
પારેખ, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૪૧-૩
- સત રે બોલો નહીંતર મત બોલો (કાન્તિલાલ મકવાણા) –  
નાથાલાલ ગોહિલ, દાલિતચેતના, એપ્રિલ, ૨૦-૭
- સપ્તપદી (ઉમાશંકર જોશી) – યોગેન્દ્ર વાસ, શબ્દસૂચિ, સાપે.,  
૬૫-૭૫
- સમાણને સથવારે (પૂનમંદ પરમાર) – નાથાલાલ ગોહિલ,  
દાલિતચેતના, માર્ચ, ૧૮-૨૧
- સાધના (ભોગીલાલ ગાંધી) – દક્ષા પટેલ, કવિલોક, જુલાઈ-  
ઓગસ્ટ, ૧-૮ – હરિકૃષ્ણ પાઠક, પરબ, માર્ચ, ૩૮-૪૨
- સાક્ષરબોતેરી (હરિકૃષ્ણ પાઠક) – મુનિકુમાર પંડ્યા, પરબ,  
ઓક્ટો., ૬-૧-૩
- સૂર્યાંગની સાખે (વાલજ કાનપરિયા) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, ડિસે., ૪૩-૪
- સ્વર્ણિમ કાવ્યદુભ (સં. નીતિન વડગામા) – મુનિકુમાર પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, ડિસે., ૨૬-૮
- સ્વર્ણિમ ગુજરાત સુષ્મા (જ્યંત જી. ગાંધી) – ભાનુપ્રસાદ  
પંડ્યા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૪૨
- હંસમાનસ (સં. કાલિન્દી પરીખ) – ભાનુપ્રસાદ પંડ્યા,  
બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૬૦-૧
- હાઈન્કા (કિશોરસિંહ સોલંકી) – એલ. એસ. મેવાડા, શબ્દસર,  
મે, ૧૪-૬
- નરેશ શુકલ, શબ્દસૂચિ, ફેબ્રુ., ૮૮-૧૦
  - રમેશ પટેલ, શબ્દસર, જાન્યુ., ૧૮-૨૦
  - સિલાસ પટેલિયા, ઉદ્દેશ, ઓક્ટો., ૧૫૮-૬૦

હાર્યે હાર્યું બોલનાથું ફાડ્યા ? (શંકર પેન્ટર) – નાથાલાલ ગોહિલ, દવિતચેતના, ઓગસ્ટ, ૧૦-૭

હું નિર્મિશ (નિર્મિશ ઠાકર) – નરેશ શુક્લ, શબ્દસૂચિ, એપ્રિલ, ૧૧૨-૧૧૩

### કવિતા અભ્યાસ

અક્ષા મહાદેવી અને શરણપથ – વીરશીવ પરંપરા – પ્રદીપ ખાંડવાળા, પરબ, જૂન, ૨૧-૨૬

અદમ ટંકારવીનું ગજલકર્મ – દક્ષેશ ઠાકર, તાદર્થ્ય, મે, ૨૮-૭૪ (પીત કવિ) અનિલ જોશી – મેરુભાઈ એચ. વાહેણ, વિવિધસંચાર, જૂન-ઓગસ્ટ, ૪૧-૮

અભાવાણીના સંશોધકશ્રી ઉમાશંકર જોશી – હર્ષદ જે. શાહ, વિવિધસંચાર, જૂન-ઓગસ્ટ, ૩૬-૪૦

આધુનિક ગજલમાં અસ્તિત્વવાદ – હનીફ સાહિલ, ગજલવિશ્વ, જૂન, ૬૬-૬૭

આધુનિક ગુજરાતી કવિતાનું વિહેંગાવલોકન – રિનુ મોદી, સાચિ, એપ્રિલ-જૂન, ૬૮-૭૭

ઇન્દૃ ગોરવામીની કવિતાઓ – દિનેશ દેસાઈ, શબ્દસૂચિ, મે, ૭૭-૮૧

ઈસ્માઈલી રિનાન અંતર્ગત આગમવાણી : પરંપરા અને નવું રૂપ – હસુ યાશીક, શબ્દસૂચિ, સપ્ટે., ૫૬-૬૪

ઈસ્માઈલી પીર કૃત રિનાન રચનાઓ : બહુરાંસ્કૃતિક સંદર્ભ – બળવંત જાની, ઝર્ણસત્રૈમાસિક, જાન્યુ., માર્ચ, ૧૭૩-૨૦૦

(કવિ) ઉમાશંકર જોશી – ઇન્દ્રનાથ ચૌધરી, અનુ. કીર્તિંદ્ર શાહ, પરબ, એપ્રિલ, ૩૧-૮

– ઉમાશંકર જોશી – ગુણવંત શાહ, નવનીત સમર્પણ, એપ્રિલ, ૩૧-૩

– મણિલાલ હ. પટેલ, વિ., ફેબ્રૂ., ૩૨-૩

– યોગેશ જોશી, પરબ, જાન્યુ-ફેબ્રૂ., ૬-૨૨

– સુમન શાહ, શબ્દસૂચિ, સપ્ટે., ૩૮-૪૫

– સુરેશ દલાલ, નવનીત સમર્પણ, એપ્રિલ, ૪૧-૩

ઉમાશંકર જોશીનાં પદ્યરૂપકો – સતીશ ડણક, તાદર્થ્ય, માર્ચ, ૧૫-૩૪

ઉમાશંકર જોશીનું છંદોવિધાન – ભાનુપ્રસાદ પંડ્યા, શબ્દસૂચિ, માર્ચ, ૭૦-૬

(કવિ) ઉશનસ – કુમાર જૈમિની શાસ્ત્રી, તાદર્થ્ય, નવે., ૧૧-૬ – રમણ સોની, ઉદ્દેશ, ડિસે., ૨૨૪-૨૭

કવિતામાં ગેયત્રા – ભગવતીકુમાર શર્મા, પરબ, જાન્યુ.-ફેબ્રૂ., ૭-૮

(કવિ) કિસન સોસા – દાન વાધેલા, દવિતચેતના, માર્ચ, ૧૩-૧૭

(કવિ) કૃષ્ણલાલ શ્રીધરાડી – ચન્દકાન્ત વેપીવાળા, સમીપે, જાન્યુ., ૫૪-૭

– ધીરુ પરીખ, સાચિ, એપ્રિલ-જૂન, ૭૮-૮૩

– પ્રફુલ્લ રાવલ, કુમાર, ઓગસ્ટ, ૮૬૦-૬૫

– બોળાભાઈ પટેલ, શબ્દસૂચિ, ઓગસ્ટ, ૪૬-૫૮

કાવ્યઆસ્વાદની પ્રક્રિયા વિશે – બિપિન આશર, શબ્દસર, ઓક્ટો., ૪૨-૪

ગુલામ મોહમ્મદ રેખની કવિતામાં પ્રકૃતિચિત્રો – હિતેન્દ્ર જોશી, વિવિધસંચાર, જૂન-ઓગસ્ટ, ૪૮-૫૨

ચન્દ્રશેખર કમારની કવિતા – ઓ. એલ. નાગભૂષણસ્વામી, અનુ. હરીશ મીનાશ્રી, સમીપે, એપ્રિલ, ૩૬-૪૭

ચૌધરી ગીતો અને સંસ્કૃતિજલક – બકુલાબહેન આર. ચૌધરી, વિવિધસંચાર, જૂન-ઓગસ્ટ, ૨૭-૩૫

(સ્રુતી કવિયત્રી) જેબુનિસા – સાંકળંદ જે. પટેલ, કુમાર, જુલાઈ, ૭૩૩-૩૭

ઢાકોરભાઈ દેસાઈ પરિમલાની કવિતા – નરેન્દ્ર જોશી, ધબક, સપ્ટે., ૪૭-૫૦

ડાલ્યાભાઈ પટેલ ‘માસૂમ’નાં ગીતોમાં નિરૂપિત ગેયતા – રાજેન્દ્રસ્તિહ વાંદેલા, પરબ, સપ્ટે., ૪૩-૮

(કવિ) દાને – ધીરુ પરીખ, પરબ, જુલાઈ, ૩૧-૩૮, ઓગસ્ટ, ૩૦-૪૨

(સ્વામી નારાયણ સંત કવિ) દેવાનંદ સ્વામી – જે. એમ. ચંદ્રવાડિયા, તાદર્થ્ય, સપ્ટે., ૮-૧૩

(કવિ) પાબ્લો નેરુદા – રાજેન્દ્ર પટેલ, કુમાર, જાન્યુ., ૪૭-૮

બાઉલ ગીતો – કારુક શાહ, હયાતી, ડિસે., ૧૬૭-૭૪

બારમાર્સી : સાહિત્ય સ્વરૂપ વિચારણા – બળવંત જાની, તથાપિ, જૂન-ઓગસ્ટ, ૭૪-૮૫

ભરત વાળાની ગજલો – કેસર મક્કવાણા, ગજલવિશ્વ, જૂન, ૫૭-૬૫

મહ્લા-મક્તા અને રદ્વિઝ-કાફ્ઝિયા – રાજેશ પંડ્યા, શબ્દસૂચિ, જાન્યુ., ૪૭-૫૬

મનહર મોદીની કવિતા – યોગેશ જોશી, ઉદ્દેશ, એપ્રિલ, ૫૧૨-૧૬

મહાપંથી સાધના અને દવિત સંત-ભક્ત કવિઓ – નિરંજન રાજ્યગુરુ, રાજભાગ, ફેબ્રૂ., ૧૭-૨૧

મારા સમકાળીન કવિ : શૂન્ય પાલનપુરી - ચિનુ મોટી, પરબ, મે, ૨૫-૮	ગસ : સાહિત્ય-સ્વરૂપ અને વિકાસ - હસુ યાણિક, વિવિધાસંચાર, ફેબ્રૂ.માર્ચ-મે, ૩-૧૦
રતનબાઈ : ગુજરાતી ભાષાનાં આદ્ય કવિયત્રી - નિરંજન રાજ્યગુરુ, શબ્દસૂચિ, ફેબ્રૂ., ૪૫-૫૫	લીરબાઈની રચનાઓ - ફારુક શાહ, નવનીત સમર્પણ, નવે., ૩૫-૮
રમેશ પારેલની ગજલસૂચિ - રાજેશ વ્યાસ મિસ્કીન, ગજલવિશ્વ, માર્ચ, ૭૬-૮૮	વખાર (સિતાંશુ યશશેંદ્ર) સામાજિક નિસબ્બતના પરિપ્રેક્ષમાં - કાન્તિ પટેલ, એટાફ, જૂન, ૫૦-૬૨
(કવિ) રાજેન્દ્ર શાહની પ્રસંગસપ્તકની રચનાઓ - વિનોદ ગાંધી, તાદર્થી, મે, ૧૪-૨૦	વિપાશાની ચાર રચનાઓ - લાભશંકર ઠાકર, ઉદ્દેશ, ઓગસ્ટ, ૨૦-૨૨
રાજેશ વ્યાસ 'મિસ્કીન'ની ગજલો વિશે - પૂર્વી ઓઝા, તાદર્થી, એપ્રિલ, ૧-૨	સ્વર્ણિમ ગુજરાતની છાંદસ કવિતા - મણિલાલ હ. પટેલ, શબ્દસૂચિ, એપ્રિલ, ૫૫-૬૪
રચણની કવિતામાં આધુનિકતા - કેતન કાનપરિયા, શબ્દસર, સપે., ૩૪-૮	હિન્દુઓની પડતી (નર્મદા) : કવિ પ્રતિભાનો ઉત્તમ ઉન્મેષ - દક્ષા વ્યાસ, શબ્દસૂચિ, ફેબ્રૂ., ૩૫-૪૪

### સાહિત્ય અકાદેમી પુરસ્કાર મોહન પરમારને

ગુજરાતીના એક ઉત્તમ વાર્તીકાર મોહન પરમાર (૧૯૪૮)ને એમના 'અંચળો' વાર્તાસંગ્રહ (૨૦૦૮) માટે 'સાહિત્ય અકાદેમી' (નવી દિલ્હી)નું ૨૦૧૧ના વર્ષનું સર્વોચ્ચ પારિતોષિક મળ્યું એ આનંદની ઘટના છે. છેલ્લાં ત્રીસેક વર્ષની એમની વાર્તા-સર્જન-સાધના દરમિયાન 'કોલાહલ' (૧૯૮૦), 'નકલંક' (૧૯૯૧), 'કુલ્લી' (૧૯૯૬), 'પોઠ' (૨૦૦૧), વગેરે વાર્તાસંગ્રહો એમણો આપ્યા. નવલકથા ને નાટક જેવાં સ્વરૂપોમાં પણ કૃતિઓ આપી.

દવિત-સંવેદના અને તણ-ભાષા એમની વાર્તાઓના મુખ્ય વિશેષો હતા પણ એમાં જ એમની વાર્તા પરિસીમિત રહી નથી. સંવેદનનિરૂપણ અને વાર્તાકર્મ-પ્રયુક્તિમાં એ વધુ ખુલ્લા, વધુ વ્યાપ ધરાવનાર રહ્યા. પારિતોષિકના સ્વીકાર-વક્તવ્યમાં એમણે કહેલી બે વાત ધ્યાનપાત્ર છે : 'આ અવોર્ડ 'અંચળો' નિમિત્ત મારી ગુજરાતી ભાષાની વાર્તાને મળ્યો છે' તથા સર્જનના આર્થિક ગાળામાં જ 'ગુજરાતી સાહિત્યના મહત્વના તમામ વાર્તાકારોની વાર્તાઓ હું વાંચી શક્યો હતો' (ને પછી, અનુવાદ દ્વારા અન્ય ભારતીય ને વિદેશી વાર્તાઓ). આ 'ભાવકનિષ્ઠા'એ પ્રેરેલી જિજ્ઞાસાએ, કોઈ વ્યાવસાયિક જરૂર ન હતી તો પણ, એમની પાસે 'સુરેશ જોખી પછીની વાર્તાનાં વિશેષ પરિમાણો' (૨૦૦૧) શોધપ્રબંધ કરાવ્યો.

ભાવક-વિસ્મયની જેમ જ આ સંપ્રક્રિતા પણ એમની સર્જકતાને બળ આપતી રહી હશે.  
એમને હઠયપૂર્વક અભિનંદન.

## પત્રચાર્ય

લેખકોનાં નામની જોડણી

દીપક મહેતા • હેમન્ત દવે • રમણ સોની

### પ્રિય રમણભાઈ

પ્રત્યક્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૧ના અંકમાં ભાઈ હેમન્ત દવેએ અને તમે લેખકોનાં નામ કેન લખવાં તે વિશે જે લખ્યું છે તેના અનુસંધાનમાં થોડુંક : લેખક પોતે જે રીતે પોતાનું નામ લખતા હોય તે જ રીતે આજે લખવા જતાં સાર્થ ગુજરાતી જોડણીકોશના જોડણી અંગેના નિયમોનો અનાદર થતો હોય તો તેની પરવા ન કરવી ? જેમ કે નિયમ ૮ : “નાનું, મોઢું, બીક, સામું, ઊનું, મોર, મોં, મોવું, જ્યાં, ત્યાં, ક્યારે, ત્યારે, માસું, તમાસું, તાસું, તેનું, અમાસું, આસું વગેરેમાં હકાર ન દર્શાવવો (એટલે કે, હ જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દલ ન દર્શાવવો; ‘હ’ને આગલા અક્ષર સાથે જોડવો નહિ.)” ‘નહાનાલાલ’ લખીએ તો ઉપવા નિયમોનો અનાદર થાય છે તેનું શું ? પછી પુસ્તકોનાં નામનું શું કરવું ? ‘નહાના નહાના રાસ’ લખશું, કે ‘નાના નાના રાસ’ લખશું ? ‘નાના નાના રાસ’ લખશું તો પછી એ સગવડિયો ધરમ નહીં થાય ? ‘નહાના નહાના રાસ’ લખશું તો તો જોડણીકોશને તડકે મૂકવો પડશે.

બીજી ભાષાના લેખકોનાં નામ અંગે શું કરશું ? મરાಠી જોડણી(શુદ્ધલેખન)ના નિયમ પ્રમાણે અંજલી, જ્યાતી, કવી એમ લખશું ? હિન્દી પ્રમાણે નહેરુ નહીં પણ નહેરુ લખશું ? પંજાબીમાં ભીષમ સાહાની લખાય છે તો તેમ જ લખશું કે ભીષ સાહાની ? લેખક પોતે લખે તે રીતે લખવું એ માત્ર ગુજરાતી લેખકને જ લાગુ પાડી નામ લખવા અંગે લેખકોમાં વહેરો-વંચો કરશું ? કે બધા લેખકોનાં નામને જોડણીકોશની ઐસી તૈસી કરીને લખશું ?

મને લાગે છે કે આ આખી વાત વધુ સ્વસ્થ, સમતોલ, સુતાર્કિક વિચારણા માગી લે છે.

કુશળ હશો.

મુંબઈ,

૧૬ જાન્યુ. ૨૦૧૨

દીપક મહેતાના પ્રશ્ના

### પ્રિય દીપકભાઈ

તમે એ ચર્ચામાં રસ લીધો અને પત્ર લખ્યો એ માટે આભાર.

મારી વાત તો ત્યાં ગુજરાતી પૂરતી મર્યાદિત હતી. બંગાળી નામમાં પણ એ પ્રશ્ન આવે કે ઓરોબિન્દો લખવું કે અરવિન્દ, વગેરે. ચકવર્તી અને મુકરજી જેવી અટકો અંગ્રેજીમાં લખાય ત્યારે એ લેખકો જે રીતે જોડણી કરતા હોય છે તે રીતે લખાય છે (અને તેમાં સાત આઈ જુદાજુદા સ્પેલિંગ જોવા મળે.) આ તો માત્ર ભારતીય આર્ય ભાષાની વાત થઈ. દ્રાવિડી ભાષાઓમાં કેટલાયે ધ્વનિઓ એવા છે જે ગુજરાતીમાં નહીં બતાવી શકાય. દા.ત., મોટો એ અને ઓ, અથવા તમિઝા, , જે retroflex central approximant છે, જેને માટે કેટલાક ગુજરાતીમાં, હિન્દીથી દોરવાઈ, (નુક્તાવાળો) ‘ષ’ લખે છે અને જેને માટે રોમનમાં zh લખાય છે.

પરદેશી નામોનાં લિપ્યંતરણ વળી જુદો, દૂરનો મુદ્દો થયો.

જેમ પરદેશી શાહેરોનાં નામ આપણે એના અંગ્રેજી પ્રચલિત રૂપે લખીએ છીએ (પેરીસ પણ પારી નહીં, મ્યુનિક પણ મ્યુનશન નહીં, વગેરે), તેમ ભારતીય નામો વિશે કરવું એમ હું માનું છું.

હું તથાકથિત ‘રોશનાવિસ્ટ’ જેવો હરેશનલ નથી એટલે દરેક વસ્તુને તેના લોજિકલ ઓક્સિસ્ટ્રીમ મુદ્દી લઈ જ જવી જોઈએ તેવો હઠાગ્રહ-દુરાગ્રહ રાખતો નથી. (નહાનાલાલ જેવાં, જોડણીના નિયમો રચાયા તે પહેલેથી પ્રચારિત નામોને જાળવી રાખીએ તો, એથી તો એ સગવડિયું વલાણ છે તેમ હું માનતો નથી.)

જોડણીના ‘નિયમો’ બહુ જટિલ, સમય લેનારી અને જુદી વાત છે એટલે એમાં પડવું સલાહભરેલું સમજતો નથી.

કુશળ હશો.

નડિયાદ,

૨૩ જાન્યુ. ૨૦૧૨

હેમન્તનાં વંદન

દ્રિય દીપકભાઈ,

મને લાગે છે કે ‘જોડણીકોશ’ના નિયમો વ્યક્તિનામો અંગે લાગુ પાડવાનો આગ્રહ બરાબર નથી. વ્યક્તિનામ એ જેમ શબ્દાર્થસૂચક (થથા ગુણ, તથા નામ) નહીં પણ માત્ર ઓળખસૂચક સંજ્ઞા છે ને એથી આપણે શબ્દકોશમાંના અર્થ(પર્યાય)ને વ્યક્તિનામમાં જોવાનો આગ્રહ રાખતા નથી એ જ રીતે જોડણીનું પણ - તે તે વ્યક્તિએ પોતે પોતાના નામની જે જોડણી કરી હોય (ને એ જ રીતે, એનાં પુસ્તકો આદિ દ્વારા પ્રચાલિત થઈ હોય) એ સહજ રીતે - ને સાર્વત્રિક રીતે - સ્વીકારવાની હોય. એટલે ન્હનાલાલ, બલવંતરાય, ચિમનલાલ (ત્રિવેદી), (જહંગીર) સંજાના વર્ગે નામો, જોડણીકોશના નિયમો આગળ ધરીને સુધારી(!) લઈએ તો એ શાસ્ત્રીય રીતે પણ, ‘ખોટું નામ લખયું’ ગણપાય અને વળી, ‘મૂળ’ કે ‘સુધારેલું’ બેમાંથી કોઈ એક, જ્યારે જેમ સૂઝ્યું તેમ, યાદચિક

રીતે લખીએ તો અરાજકતા આવે.

બીજી ભાષાઓમાંથી આવેલાં નામ - ભીષમ કે અવની કે નેહરુ - આપણી ભાષામાં કેવી રીતે લખવાં એ નક્કી કરી લેવું પડે ને પછી એકવાક્યતા-સાર્વત્રિક સ્વીકૃતિ જાળવવી પડે. પંજાબીમાં ‘ભીષમ’ લખાતું હોય, હિન્દીમાં ‘નેહરુ’ સર્વત્ર પ્રચાલિતાં હોય તો કઈ મૂળવણી ? આપણે તો સંજ્ઞા તરીકે જ એને સ્વીકારવા-લખવાનું હોય છે ને ? - એમ પણ હું તો કહું.

મૂળ વાત તો સરળ, ને એટલી જ છે કે, લેખકે લખ્યું - પ્રચાલિત કર્યું એ પ્રમાણે જ એમનું નામ લખવું - એનો બંગ કે અનાદર કે ઐસીતેસી ન કરવાં.

વડોદરા;

૨૫ જાન્યુ. ૨૦૧૨

- રમણ સોની

પ્રતિભાવ બીજા અંક સુધી ન ડેલાય ને ચર્ચા એકસાથે રજૂ થાય એ માટે દીપકભાઈનો e-mail ડેમન્ટ ફર્વેને forward કરેલો. - સંપા.

## ઇ-બુક્સ : ફાર્બેસ ગુજરાતી સભા

ફાર્બેસ ગુજરાતી સભાએ, દીપક મહેતાના આયોજન અને સંયોજનમાં ૧૮મી સદીનાં ૧૦૦ પુસ્તકો; ‘કૌમુદી’ (વિજયરાય વૈદ્ય) તેમજ ‘ફાર્બેસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ - ૭૫ વર્ષ - એ સામાચિકો ઇ-બુક્સ રૂપે પ્રકાશિત કર્યા છે : એ CDSની સંપૂર્ણ વાદી અને વધુ માહિતી માટે સંપર્ક :

ફાર્બેસ ગુજરાતી સભા, કીર્તન કેન્દ્ર, ત્રીજે માળે, ઉત્પલ સંઘવી સ્ક્લુલ સામે, સંત શાનેશ્વર માર્ગ, જૂહુ, વિલે પાર્ટી, (પશ્ચિમ), મુંબઈ ૪૦૦૦૫૬ ઈમેલ : forbes\_gs@yahoo.co.in ફોન : ૦૨૨ ૨૬૨૫૦૮૧૦.

## પરિચय મિતાક્ષરી

સ્વીકાર-સમીક્ષા માટે પ્રકાશકો / લેખકોએ મોકલેલાં તથા સંપાદકે નવાં ખરીફેલાં પુસ્તકીની પરિચયનોંધ

### કવિતા

અંતરાલ - સુસ્પિત્તા જોશી. પ્રકા. લેખક, વડોદરા, ૨૦૧૧, પ્રાપ્તિસ્થાન પાર્શ્વ, અમદાવાદ, રૂ. ૧૪૪, રૂ. ૧૨૦ □ ૮૦ અછાંદસ કૃતિઓ.

આમ લખવું કરાવે અલખની સફર - રઈશ મણિયાર. શબ્દ પ્રકાશન, પીપળોદ, સુરત-૭, ૨૦૧૧, પૂ. ૧૦૪, રૂ. ૧૫૦ □ ૬૦ ગજલ-રચનાઓ.

આવતી કાલની શોધમાં - પ્રફુલ્લ રાવલ. કવિલોક ટ્રસ્ટ, અમદાવાદ, ૨૦૧૧, કા. ૮૬, રૂ. ૬૦ □ અછાંદસ રચનાઓ.

નિર્વચિત કવિતા - અનુ. ભોગભાઈ પટેલ. ગુજરાત સાહિત્ય અકાડમી, ગાંધીનગર, ૨૦૧૧, રૂ. ૧૭૨, રૂ. ૫૦ □ જાણીતા ઓડિયા કવિ સીતાકાન્ત મહાપાત્રનાં કાવ્યોનો અનુવાદ, મૂળ કૃતિઓ (દેવનાગરી લિપંતરણ) સાથે. ...પાછો ઉંઘાડ નીકળ્યો આ - પ્રબોધ ર. જોશી. ઠંડેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૧૨, રૂ. ૧૧૮, રૂ. ૧૫૦ □ ૬૦ અછાંદસ કાલ્યકૃતિઓ.

મારી હૃદ્દાળીમાં - નીતા રામૈયા. શુભમ્ર પ્રકાશન, મુંબઈ, ૨૦૦૮, રૂ. ૧૧૨, રૂ. ૧૨૫ □ અછાંદસ રચનાઓ.

હું રોજ કરું હું મોજ કરું - નીતા રામૈયા શુભમ્ર પ્રકાશન, મુંબઈ, ૨૦૧૧, ડબલ ડેમી, રૂ. ૭૦ □ બાળ-રચનાઓ.

### દુંકી વાર્તા

એક અજાણ્યો મારી નાવમાં - અનુ. નીતા રામૈયા શુભમ્ર પ્રકાશન, મુંબઈ, ૨૦૦૮, રૂ. ૧૨૬, રૂ. ૧૦૦ □ વિવિધ લેખકોની વાર્તાઓના અનુવાદ.

ગુજરાતી નવવિકાચયન ૨૦૦૭ - સંપા. ડિમાંશી શેલત. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૮, રૂ. ૧૫૨, રૂ. ૭૫ □ ૨૦૦૭ના વર્ષમાં સામયિકોમાં પ્રગત થયેલી વાર્તાઓમાંથી ૧૮ વાર્તાઓનું ચયન, સંપાદકીય લેખ સાથે.

ગુજરાતી નવવિકાચયન ૨૦૦૮ - સંપા. અજિત ઠાકોર. ગુજ. સાહિ. પરિષદ, અમદાવાદ, ૨૦૧૧, રૂ. ૨૪૮, રૂ. ૧૬૦ □ ૨૦૦૮ના વર્ષમાં સામયિકોમાં પ્રગત થયેલી વાર્તાઓમાંથી ૨૧ વાર્તાઓનું ચયન, સંપાદકીય લેખ\* સાથે (એ લેખમાં અજિત ઠાકોરની વાર્તા વિશેનું લખાણ હેમત દરેનું છે.)

ગુજરાતી નવવિકાચયન ૨૦૦૯ - સંપા. પારુલ કંદ્ર્પ દેસાઈ.

ગુજ. સાહિ. પરિષદ, અમદાવાદ, ૨૦૧૧, રૂ. ૧૪૪, રૂ. ૧૦૦ □ ૨૦૦૮ના વર્ષમાં સામયિકોમાં પ્રગત થયેલી વાર્તાઓમાંથી ૧૮નું ચયન, સંપાદકીય લેખ સાથે

ઘટના પણી - ડિમાંશી શેલત. ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૧, કા. ૧૨૮, રૂ. ૧૨૫ □ ૧૪ વાર્તાકૃતિઓનો સંગ્રહ

ગોધૂલિ વેળા - રમેશ ર. દવે. ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૧, કા. ૨૧૬, રૂ. ૧૨૬ □ ૧૫ વાર્તાકૃતિઓનો સંગ્રહ

તામસાસન - મધુસૂહન ઢાંકી. ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૧, રૂ. ૧૭૬, રૂ. ૧૩૦ □ ૧૦ લાંબી વાર્તાકૃતિઓનો સંગ્રહ

### નાટક

ચકથી ચરખા સુધી - નાટ્યચરૂપ ચંજૂ બારોટ. અહેમેદાબાદ થીએટર ચૂપ, ૪૫/૨, બીમાનગર, અમદાવાદ-૧૫, રૂ. ૧૨૦, રૂ. ૧૬૦ □ દિનકર જોશીની કૃતિનું નાટ્યચરૂપ.

પંચવરી - અનુ. યોગેશ ત્રિકમાણી. પ્રકા. ડી. વિજય ભાસ્કર, હેઠરાબાદ, ૨૦૧૧, મુખ્ય વિ. ડિવારીન, અમદાવાદ, રૂ. ૨૮૬, રૂ. ૧૭૫ □ ડી. વિનય ભાસ્કરનાં પાંચ તેલુગુ નાટકોનો (હેઠી દ્વારા) ગુજરાતી અનુવાદ.

### નિબંધ, સંસ્મરણ

અણસરખી રેખાઓ - પ્રવીણ દરજી ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૧, રૂ. ૨૧૦, રૂ. ૧૨૫ □ ૪૮ નિબંધોનો સંગ્રહ

એતાનશી સુરત બંદરેથી; નિબંધોત્સવ; પડણયાની બાધાદોડ; શિખરનું એકાંત - રતિલાલ 'અનિલ'. કંકાવરી પ્રકાશન, ૧૩૧૪ સાંઈસમર્પણ સોસાયટી, ઉધના, સુરત, ૨૦૧૧ (અનુક્રમે) રૂ. ૨૪૦, રૂ. ૨૦૦; રૂ. ૧૧૮, રૂ. ૧૦૦; રૂ. ૧૩૮, રૂ. ૧૨૫; રૂ. ૮૬, રૂ. ૧૦૦ □ રતિલાલ 'અનિલ'ની નિબંધકૃતિઓ, એકસાથે.

જિલ્લાની ડાયરી - કેટન નરેન્દ્ર ફણસે ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૨, રૂ. ૩૨૦, રૂ. ૩૫૦ □ ભારતીય સેનામાંની, યુદ્ધો દરમિયાનની, કામગીરીના અનુભવોની સંસ્મરણ-કથા.

દિગીશ મહેતાના શ્રેષ્ઠ નિબંધો - સંપા. ઉત્પલ પટેલ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૧૧, કા. ૧૦૦, રૂ. ૧૮૦ □ દિગીશ મહેતામાંથી, ઉત્તમ લાગેલા ૧૮ નિબંધોનો સંચય - વિસ્તૃત અભ્યાસલેખ સાથે.

સાહિત્ય

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ પૃ. ૫૧

મધ્યદરિયે મહેક્ષિક - સંપા. હિમાંશી શેલત. ગુજરાત, અમદાવાદ,  
૨૦૧૧, પૃ. ૧૫૨, રૂ. ૧૦૦ □ 'સમુદ્ર સફર દરમિયાન  
વિનોદ મેઘાણી પર મકરંદ દવેના પત્રો'નું સંકલન -  
સંપાદકીય પરિચયલેખ સાથે.

### વિવેચન, આસ્ત્રવાદ

અંગળી ચીધ્યાનું પુષ્ય - વિનોદ ભટ્ટ. ગુજરાત, અમદાવાદ,  
૨૦૧૦, રૂ. ૨૨૨, રૂ. ૧૫૦ □ વિવિધ વિષયોનાં ૭૨  
પુસ્તકોના ટૂંકા, આસ્ત્રવાદ કરાવતા, પરિચયો.

તાણવાણાં-૨ - હેમંત ધોરડા નવભારત, મુંબઈ-અમદાવાદ,  
૨૦૧૧, રૂ. ૧૮૬, રૂ. ૧૭૦ □ ગજલ-સ્વરૂપ અને ગજલ-  
કૃતિઓ વિશેના, લાંબા વિશ્વેષણલક્ષી એ વિવેચનલેખો.  
(પૂર્વસંગ્રહ 'તાણવાણાં'નું અનુગામી પુસ્તક)

ત્યારે ગજલ બને છે - સ્નાગર નવસારવી સાગર પ્રકાશન,  
નવસારી, ૨૦૧૨, રૂ. ૩૮૮, રૂ. ૩૫૦ □ ગજલસ્વરૂપ  
અને ગજલના છંદો વિશે પરિચય આપણું પુસ્તક.

ત્રજા કવિ-વાર્તાકારો : તુલનાત્મક દસ્તિપત્ર - કે. જે. વાળા  
'શૂલભેશ'. પ્રકા. લેખક, ઊના, ૨૦૧૨, વિતરક ગુજરાત,  
અમદાવાદ, કો. ૮૮, રૂ. ૬૦ □ સેહરાશિમ, સુંદરમુ,  
ઉમાશંકરની 'વાર્તકલા' વિશે.

સાહિત્યસંનિધિ - રવીન્દ્ર ઠાકોર. પ્રકા. લેખક, અમદાવાદ,  
૨૦૦૩, વિકેતા ગુજરાત, અમદાવાદ, કો. ૨૮૦, રૂ. ૧૧૦ □  
પુસ્તક સમીક્ષાના અને રંગભૂમિ વિશેના લેખો.

સંદન - રવીન્દ્ર ઠાકોર. પ્રકા. લેખક, અમદાવાદ, ૨૦૧૧, કો.  
૧૬૪, રૂ. ૧૦૦ □ ટૂંકાં ગ્રંથવલોકનો, અભ્યાસલેખો.

### ભાષાવિચાર, સૂચિ

તળાની બોલી - સંપા. દલપત ચૌહાણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,  
અમદાવાદ, ૨૦૦૮, રૂ. ૧૪૦, રૂ. ૧૩૦ □ ઉત્તર  
ગુજરાતના દોટોર વિસ્તારને કેન્દ્રમાં રાખીને, અપરિચિત  
અને વીસરાતા જતા વિવિધ શાસ્ત્રિઓ-વ્યવસાયના વિવિધ  
શાસ્ત્રિઓ અને વ્યવસાયોના, બોલીગત શબ્દોના સમજૂતી  
સાથેના અર્થો બતાવતો સંકલિત કોશ.

ભાષાવિમર્શ લેખસંચય - સંપા. હર્વદન તિરેદી. ગુજરાતી  
સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૧૧. રૂ. ૨૧૬, રૂ. ૧૪૦  
□ ૧૮૭૮-૮૮ દરમિયાન પ્રકાશિત થયેલા  
ભાષાવિજ્ઞાનના ટ્રૈમાસિક 'ભાષાવિમર્શ'નાંથી પરંદ કરેલા  
૧૫ અભ્યાસલેખો - સંપાદકના લેખ ઉપરાંત લેખકસૂચિ,  
પારિભ્રાષ્ટક શબ્દસૂચિ અને ગ્રંથસૂચિ સાથે.

માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ - સંપા. યોગેન્દ્ર વ્યાસ,  
પાસુલ દેસાઈ, પિંડી પંડ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ,  
અમદાવાદ, ૨૦૧૧, રૂ. ૨૦૮, રૂ. ૧૬૦ □ ગુજરાતી-  
ભાષાશિક્ષણનાં વ્યાકરણાદિ ઘટકો, માતૃભાષા-મહિમા  
આદિ વિશેના વિવિધ લેખકોના વક્તવ્ય-લેખોનું સંકલન-  
સંપાદન.

સામયિક લેખ સૂચિ ૨૦૦૬-૨૦૧૦ - સંપાદક કિશોર વ્યાસ.  
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૧૧. રૂ. ૩૧૬,  
રૂ. ૨૦૦ □ એ દરમિયાનનાં ૩૦ જેટલાં ગુજરાતી સાહિત્ય-  
સામયિકોમાં પ્રગટ થયેલા લેખોની, સ્વરૂપવાર ૧૪ વિભાગો  
- પેટાવિભાગોમાં વર્ગીકૃત કરેલી લેખ-નિર્દેશક સૂચિ.

### અન્ય : વિચાર, ચિંતનાદિ વિષયો

ઈલામનો પયંગબર - વિનોભા. યજ્ઞ પ્રકાશન, વડોદરા,  
૨૦૧૧. રૂ. ૮૦, રૂ. ૪૦ □ વિનોભા ભાવેના તદ્વિષયક  
૧૫ લેખોનું, કાન્તિ શાહે કરેલું સંકલન-સંપાદન.

ઔતરેય ઉપનિષદ - મૃદુલા મારફતિયા ગુજરાત, અમદાવાદ,  
૨૦૧૨ રૂ. ૮૮, રૂ. ૫૦ □ તદ્વિષયક અભ્યાસપુસ્તક.

મન સાથે મૈત્રી - અનુ. અરુણા જાડેજા. ગુજરાતી સાહિત્ય  
પરિષદ, અમદાવાદ, ૨૦૧૧. રૂ. ૮૮, રૂ. ૬૦ □ સમર્થ  
રામદાસ સ્વામી કૃત 'મનાચે શ્લોક'ના ૨૦૫ (મચાઈ)  
શ્લોકો અને એનો ગદ્યાનુવાદ - સંપાદકની અભ્યાસ-  
પ્રસ્તાવના સાથે

વાલજીભાઈની વાતો - વાલજીભાઈ પટેલ અક્ષરભારતી, ભૂજ,  
(પુનઃ) ૨૦૧૦, રૂ. ૧૧૮, રૂ. ૫૦ □ જીવનચિંતનનાં અને  
અધ્યાત્મ સંદર્ભ ધરાવતી સંજ્ઞાઓ પરનાં ટૂંકાં, સરળ,  
લાખાણો.

વિષયાન્તર - વિજય શાસ્ત્રી. સાહિત્યસંગમ, સુરત, ૨૦૧૧. રૂ.  
૧૫૬, રૂ. ૮૦ □ શિક્ષણ, સાહિત્ય, વ્યક્તિચિત્ર,  
આદિવિષયક લેખોનો સંચય

વેદામૃત - વિનોભા યજ્ઞ પ્રકાશન, વડોદરા, ૨૦૧૧. રૂ. ૧૧૮, રૂ.  
૫૦ □ ઋગવેદમાંથી ચૂટેલા ૮૭ મંત્રો અને એ વિશેનું  
ચિંતન.

સર્વોદયનાં ૧૦૦ વરસ એક દસ્તિપત્ર - કાન્તિ શાહ યજ્ઞ  
પ્રકાશન, વડોદરા, ૨૦૧૧. રૂ. ૧૪૮, રૂ. ૫૦ □ 'સર્વોદય  
અંદોલન' અંગે વિહંગાવલોકન.

સ્વકેળવણી - વિમલા કકર. સુરેશ - સુશીલા માનવીય સંબંધ  
પ્રતીજ્ઞાન, વલ્લભવિદ્યાનગર, ૨૦૧૨, રૂ. ૪૮, રૂ. ૩૦ □  
વિમલા ઠકરાના મૂળ પુસ્તકનો શીલા વ્યાસે કરેલો  
સારાનુવાદ.

## આ અંકના લેખકો

રાધેશયામ શર્મા	: ૨૫, ભુવાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ ૩૮૦૦૨૨
વિનોદ ગાંધી	: ૮૩, સુવિધાનગર, ભુરાવાવ, ગોધરા ૩૮૬૦૦૧ □ ૯૭૨૬૧૬૬૦૩૧
ગુજરાતન્ત્ર વ્યાસ	: ૬, શયામકુટિંગ બંગલો, “શાખ્યપ્રાસ”, દર્શન સોસાયટી સામે, લાંબવેલ રોડ, બાકરોલ-આણંદ ૩૮૮૩૧૫ □ ૯૪૨૮૩૧૭૯૧૩
ઇલા નાયક	: ૧૬, સંસ્કારભારતી સોસાયટી, નારણપુરા, અમદાવાદ ૩૮૦૦૧૩ □ ૦૭૯-૨૭૪૫૨૬૩૩
નરોત્તમ પટ્ટાજા	: ૩, વાડી ખોડ, પોરબંદર ૩૬૦૫૭૫ □ ૦૨૮૬-૨૨૪૭૭૦૭
વિનીત શુક્લ	: J-૨૦૩, Sumer Nagar, S. V. Rd., Nr. Flyover, Borivali (w), Mumbai-૪૦૦૦૦૮૨ □ ૦૨૨-૨૮૬૧૮૧૩૪
કિશોર વ્યાસ	: ૬/બી, મહેતા સોસાયટી, કાલોલ (પંચમહાલ) ૩૮૮૩૩૦ □ ૯૯૨૪૭૩૫૧૧૧
ચંદ્રકાન્ત ટોપીવાળા	: ડી-૬, પૂર્ણશ્વર ફ્લેટ્સ, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૧૫ □ ૦૭૯-૨૬૩૦૧૭૨૧
રાજેન્દ્ર પટેલ	: ૭૮, નિહારિકા બંગલોઝ, હિંમતલાલ પાર્ક સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫ □ ૯૩૨૭૦૨૨૭૫૫

### ગુજરાતી સાહિત્ય પરિષદ □ ગુજ. યુનિ. માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગાનું સત્ર ૧૫ જૂન, ૨૦૧૨થી શરૂ થશે. અભ્યાસક્રમમાં જોડાવા ઠથથતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. વર્ગી સોમધી ગુરુ સાંજના સમયે લેવાશે.

પ્રવેશ માટેની યોગ્યતા : કોઈ પણ વિદ્યાર્થીએ સ્નાતક (બી.એ.) સંપર્કસૂત્ર કાર્યાલય : (૦૭૯) ૨૬૫૮૭૮૪૭ શ્રી ચંદ્રકાન્ત ભાવસાર (મ્ભ.) ૮૫૩૭૬૭૧૦૭૩. ગુજરાતી સાહિત્ય પરિષદ, વાઈમ્સની પાછળ, નાદીકિનારે, આશ્રમ રોડ, અમદાવાદ પો. બો. નં. ૪૦૬૦

જૂનાં ગુજરાતી પુસ્તકો-સામયિકોની ડીજીટલ આવૃત્તિઓ

वितरक : प्रसार भावनगर

સહુ પહેલું ગુજરાતી પુસ્તક ૨૦૩ વરસ પહેલાં, ૧૮૦૮માં છાપ્યું હતું. ૧૮મી સત્તિનાં (અને અન્ય અલખ્ય બનેલાં) કેટલાંક પ્રકાશનો ડીજિટલ સ્વરૂપે સાચ્ચી લેવાનો પ્રકલ્પ જીર્ભસ ગુજરાતી સભાએ હાથ ધર્યો છે. એ કાળનાં ભાષા અને મુદ્રાણનાં અભ્યાસ-અવલોકન માટે આ સામગ્રી અત્યંત મહત્વની છે. શ્રી દીપક મહેતા સંયોજિત આ પ્રકલ્પ હેઠળ તૈયાર થયેલો આ સીરીની સંગ્રહ આપણાં થોડાં અલખ્ય પ્રકાશનો ફરી સુલભ બનાવે છે. આ ૧૦૦ સીરીની બાદી અહીં આપી છે. કેટલાંક મહત્વનાં સામગ્રીકો પણ આ રીતે ડીજિટલ સ્વરૂપ પામ્યાં છે. તેની વિગત પણ અહીં છે. આ નવતરાં સામગ્રીનું વિતરણ કરતાં પ્રસાર આનંદ અનુભવે છે.

- ઠાંકસ્ટેશન ઓફ ધ ગ્રામોટિકલ પાર્કર્ષ ઓફ ધ ગુજરાતી, મહરક (મચરી) એન્ડ ટંગ્લીસ કેન્યાનેઝસ / રેબટ ડ્રેન (૧૮૦૮).
  - ઉનાની હોમ લોકોનો ઉહવાલ / અણાજા લેખક-અનુવાદક (૧૮૧૮)
  - શ્રી હંકેન્ડ દેશની મુખતોશ અને શેહેર વારતા / શેહીઆરજ પેશતનજી (૧૮૩૮)
  - ગુજરાતી ભાષાનું વ્યાકરણ / ગંગાધર શાસ્ત્રી ફડક (૧૮૩૮)
  - મધ્યો વિદ્યા / હેનરી ગીન, અનુવાદ : મેતેજથ હુગર્સમ
  - હિંદુસ્થાનની ઈતિહાસ / એફિન્સ્ટન (લોર્ડ), અનુવાદક : રણાંદ્રભાઈ વિરબભાઈ (૧૮૫૧).
  - ક્રાપતન ગ્રાન્ડ ડફી મચરાણાની બખર / ગ્રાન્ટ ડફ, અનુવાદક : મોહનલાલ રખાણેંદ્રસ (૧૮૫૬)
  - જરતોશી લોકોના ધરમ પુત્તકો તથા એ પુત્તકોનો ભાષા અને પુરાતનપણ વિરો નિબંધ / શોરાબજી શાપુરજી (૧૮૫૮)
  - રાજાયમોહનસયનું જીવનચરિત / પ્રકાશક : એન એક્સાન્ડ્રેન ઓફ ધ એફિન્સ્ટન કોલેજ (૧૮૫૮).
  - અવંકાયવેશ / નર્મદ (૧૮૫૮)
  - મનહર પદ / સંયાદક : નર્મદ (૧૮૬૦)
  - સદગુણી સ્વીઓ / અણાજા લેખક (૧૮૬૧) - જીવનચરિતો.
  - ગેરેટ બરીટન ખાતેની મુસાફરી / ડેસાભોય ફસ્મજી (૧૮૬૧)
  - નર્મગીતાવળી / નર્મદ (૧૮૬૨) - શાણા-કન્યાઓ માટે ગીતો.
  - મુંબઈ શહેરનું વર્ણન / મગનલાલ નગેતમદાસ પટેલ (૧૮૬૨)
  - ગજલસતાન / સંપા : નશરવાનજી ટેમ્પુલજી દુર્લીન (૧૮૬૨)
  - ગુલાબ નાટક પાંચ અંદી પવામાં તથા ગવામાં / નગીનદાસ મારફિતયા (૧૮૬૨) - ગુજરાતીનું પહેલું મુદ્રિત નાટક.
  - નામાંભોધ / કવિ હીરાયંદ કાનજી (૧૮૬૪) - પવામાં કોશ.
  - અમેરિકાની મુસાફરી / અણાજા પારસી લેખક. (૧૮૬૪)
  - આજા ભક્તની વાણી / સંયાદક : હીરાયંદ કાનજી (૧૮૬૪)
  - સિગારાઈ બ્રાજાભાસ મેં / હીરાયંદ કાનજી (૧૮૬૪)
  - બૃહિવર્ધક ગ્રંથ / દલપત્રામ (૧૮૬૫)
  - કહેવત મુલ / પેસ્ટનજી કાવસજી રબાડી (૧૮૬૫)
  - શેક્સ્પેનર નાટક (અંક ૧) / અનુવાદક : નાનાભાઈ રાણીના (૧૮૬૫)
  - દ્વારામકૃત ક્રાયસ્ટ્રેટ / સંયાદક : નર્મદ (૧૮૬૫)
  - શેર ને સંક્રામક / મનચેરજી કાવસજી શાપુરજી (૧૮૬૫)
  - ગીદ્ધિદ્ધ પરદ / ગોવિંદ નારાયણ (૧૮૬૫) - ધાન્ય, દાણા, કંદ, ફળ, ભાજુ, ભાજાયાદો ઠાંકાઈનું વર્ણની.
  - કાબદ્દોહન (ભાગ ૨) / સંયાદક : દલપત્રામ (૧૮૬૫)
  - અભિશાન શર્કુતલ નાટક / અનુવાદક : જવેરીલાલ ઉમિયાશંકર યાણીક (૧૮૬૭)
  - ભૂગોળનો ઉપયોગ કરવાની રીતનો ગ્રંથ / હિવાલ મોહનલાલ (૧૮૬૭)
  - ઠંકણ્ઠમાં પ્રવાસ / કરસનદાસ મૂળજી (૧૮૬૭).
  - મુંબઈનો લોમિયો / શાંકરસાય દલપત્રામ હિવાનજીના (૧૮૬૭).
  - શાર્કુતલ બાય કાવિદાસ / અનુવાદક : દલપત્રામ પ્રાણજીવન ખાખર (૧૮૬૭) - મૂળના મચરી અનુવાદ પરથી.
  - ગુજરાતી ભાષાનું વ્યાકરણ / જોસેફ ટેલર (૧૮૬૭)
  - ક્રાંકસ જીવનચરિત્ર / મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી (૧૮૬૮)
  - મુંબઈ યુનિવર્સિટી વિરો / નગીનદાસ મારફિતયા (૧૮૬૯)
  - દિક્ષા દિક્ષુતનામાં મુસાફરી / દિનશાહ તાવેયારાં (૧૮૭૦).
  - મુંબઈનો બાધાર (ભાગ ૧) (૧૮૭૪)
  - ગુજર અભેસર મેંડાણી શિત્રાંબી / કેશવલાલ હરિવિહલદાસ (૧૮૮૮).
  - ઠાંજિત / મણિશંકર રતજી ભણ (૧૮૮૩) - જ્યોર્જ રોવિન્સના પુસ્તકને આધારે.
  - ચામસણા (ભાગ ૧-૨) / એલેક્ઝાન્ડર કિનલાક કાર્બસ ; અનુવાદક : રખાણેંદ્રભાઈ ઉદ્યરામ. ૧૯૨૨, ૧૯૨૭ [૨ સીરીઝ]
  - Gujarat Portrait Gallery / Keshavlal Harivithaldas. 1889
  - સચિત્ર સાક્ષરમણા (આલબમ) / જ્યસુખરામ પુરુષોત્તમરાય જોષીપુરા. ૧૯૧૨
  - પૃથ્વીની પ્રદક્ષિણા વાને દુનિયાનાં નામીયાં શહેરો અને અદ્ભુત કુદરતી દેખાવોવાના મુખુકો ખાતેની હજુ સુલેમાન શાહમહમદની મુસાફરીની નોંધો. ૧૮૮૫
  - ઠિચાનામાં મુસાફરી / શાપુરજી દીનશાહજી કેઅસના. ૧૮૮૨
  - Journal of Travels in India (Volume 1) / Ardaseer Framjee Moos. 1871
  - સુરત-નોટેન્ટનું દેશી રાજ્ય / રહેમાનખાં કાલેખાં પદાણ, વજેરામ પ્રાણશંકર ઉપાધ્યા. ૧૮૮૦
  - ધૂરોપ, અમેરિકા, જાપાન અને ચીન તરફની મુસાફરીની નોંધ / ફરમજી દીનશાહજી પીટ. ૧૮૮૮
  - જાપાનનું વર્ણન / વાસુદેવ નરહર ઉપાધ્યા. ૧૮૮૫
  - મુંબઈથી કાશ્મીર / જંહાગીર બેહરામજી મરજબાન. ૧૮૮૭
  - પ્રવાસવર્ણન / કવિતામાં રચનાર : શિવલાલ ધેનેશર ૧૮૮૬.
  - ભરતસંડેનો પ્રવાસ / શંસુપસાદ બેચરદાસ લક્ષ્મિની. ૧૮૮૭
  - બોળાનાથ સાચાભાઈનું જીવનચરિત્ર / કૃષ્ણાવ બોળાનાથ.
  - એક્સો નર : સોરબાજ શાપુરજી બંગાલી સી.આર્ટ.ચ. ચિરિત્ર / મંગળદાસ કરસનદાસ મૂળજી. ૧૮૮૩
  - The Life of Rao Bahadur Ranchorelal Chhotalal / Bhagwanlal R. Badshah. 1899
  - કરસનદાસ મૂળજી ચિરિત્ર / મહીપત્રામ રૂપરામ.

૫૮. ડિસ્ટેન્સા હાડેમ માર્ટિંગ સ્કુલર્સ એલ્ફિંક્સટન / કે. એસ. કોટન; ભાષાંતરકર્તા : ચુનીવાલ માર્કેટલાલ ગાંધી. ૧૯૮૪

૫૯. ઉત્તમ કપોય કરસનદાસ મુળજી ચિત્રન / મહીપત્રચમ ઉપયામ. ૧૯૭૭

૬૦. દ્વારામની સંપૂર્ણ અવકથા / તિભુવન જમનાદાસ શેડ. ૧૯૮૮

૬૧. એક હિંદી સુધારક નિ. વેદેશમજુ મન્ત્રબારી. ૧૯૮૫

૬૨. ફરદુનજી મર્યાદાનજી : ગુજરાતી ધાપાના સ્થાપક, એક ક્રિલસૂફ, એક સુધારક, એક કાવિ / કેદોબાદ વેદેશમજુ મર્યાદાન. ૧૯૮૮

૬૩. સુરતીની તવારીખ / એદલજી બરજોરણ પટેલ. ૧૯૯૦

૬૪. કાઠીયાવાડ સર્વસંગ્રહ. ૧૯૯૬

૬૫-૬૬. શ્રી કૃષ્ણસ ગુજરાતી સભાનાં હસ્તકોની સચિવસ્તર નામાવલી (ભાગ ૧-૨) / અંબાવાલ બુ. જાની. ૧૯૨૩, ૧૯૨૮ [ ૨ સીડી]

૬૭. ગુજરાતી શબ્દમૂળઘરક ક્રીષ / છોટાવાલ સેવકરામ. ૧૯૭૮

૬૮. રૂઢિપોગ કોશ / ભોગીવાલ ભીજાભાઈ ગાંધી. ૧૯૮૮

૬૯. કથનાવળી / ભગનવાલ વખતચેંડ (આ. ૫). ૧૯૮૩

૭૦. ગુજરાતી કહેવતો / દામુભાઈ દાખાભાઈ મહેતા. ૧૯૮૩

૭૧. A Collection of Gujarati Proverbs with Their English Equivalents / Desai. 1900

૭૨. સર્વ નિધા-માણા અથવા ગુજરાતી ‘સ્થાકવો-પીડચા’ (ભાગ પહેલો) / મારોકજી એદલજી વાણી, અરદેશર ફરામજી સોલન. ૧૯૯૧

૭૩. મુંબઈ સમાચારનો ગાયન સમુદ્ધય : ૧૯૮૬

૭૪. સંગીતમણા (દ્વિતીય ગુણ્ય) / R.B.T. ૧૯૮૮

૭૫. હરિશ્ચંગ નાટક તથા તારામતીસ્વયંબર / રાણાઓડાઈ ઉદ્યયામ. ૧૯૮૬

૭૬. મનુષ પરેમી ઈંચાને ચગલી ગનેઆતના ગુજરાતી વાંચનારોને ફુરસતની રેણૂએ વાંચવાની હોંક, ગમત અને માણસોનો પેખાર મેલવનારી કેતાબ / એ. પણતનજી કાવશજી રબાની. ૧૯૮૪.

૭૭. બાણશાની આખા ભક્તના ત્રણા ગુજરાતીમાં તથા બુલલશાહની સી હરકી પંજાબી ભાષામાં / પુજારા કનાન ભીમજી. ૧૯૮૮

૭૮. ઠીરાણ તથા તુચાજી દેશની વારતા / ઠંગેજી ઉપરથી ભાષાંતર કરનાર : જાનામાઈ ખરશેદજી કાપડિયા, હોરમશજી દોરાણજી ચીનાઈ. ૧૯૬૮

૭૯. મહારાજાના લાંબાલનો મોટો મુક્કમો. ૧૯૬૨

૮૦. સચિત્ર દેશી રમતો / છગનવાલ ઠાકોરાસ મોઈ, ૧૯૮૩

૮૧. કુંબલ મિત્ર / કરસનદાસ મુળજી. આ. ચોથી, ૧૯૮૫

૮૨. પ્રેમચય અને ચાચમતી / રણાઓડભાઈ ઉદ્યયામ. ૧૯૭૬

૮૩. અરેલીયન કીસ્થા / ઉત્તમ ઠંગાની. ૧૯૮૫

૮૪. માહરી મજેહ તથા લીજા કાવિતાઓ / જમશેદજી પિતીત. ૧૯૮૨

૮૫. એક પુનર્વિવાહીની કહાણી / માધવદાસ રૂળાનથાસ. ૧૯૯૧

૮૬. સરસવતીયંત્રનું અવલોકન / વિશનાથ તિ. પ્રભુરામ. ૧૯૮૦

૮૭-૮૮. ગુજરાતના ઐતિહાસિક લેખ (ભાગ ૧-૩) / ગિરજાશંકર વલભજી. ૧૯૮૩-૧૯૮૪ [ ૩ સીડી]

૮૯-૯૦. ગુજરાતના ઐતિહાસિક લેખ (ભાગ ૪-૫) / હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી. ૧૯૮૮-૧૯૮૯ [ ૨ સીડી]

૯૧. ગુજરાતના ઐતિહાસિક કેટલાએક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓ / દલપત્રામ દાખાભાઈ, ૧૯૩૩

૯૨. ગુજરાતનાં ઐતિહાસિક સાધનો (વિભાગ ૧ અને ૨) / નર્મદાશંકર વલભજી દ્વિતીય, ૧૯૮૮

૯૩. ચૂંણી કાહડેલાં લાણાશો : (દક્ષતર ૧) / શોરાબજી બંગાતી. ૧૯૮૦

૯૪. નવી અરેખણ વાર્તાઓ (તદ્દન નવી સંપૂર્ણ ઉદ્વારાઓનો સંગ્રહ) / મારોકજી એદલજી વાણી, તેસાભાઈ ફરામજી લંગરાના.

૯૫. નિબંધમણા : (પુસ્તક ૧) / કરસનદાસ મુલજી. ૧૯૭૦

૯૬. નાચપાકશા / અનુ. : રાણાઓડભાઈ ઉદ્યયામ. ૧૯૮૦

૯૭. માલવિકાજી મિત્રનાટક / અનુ. : રાણાઓડભાઈ ઉદ્યયામ. ૧૯૭૦

૯૮. મેધદૂત / ભાષાંતર : ભીમરાવ લોળાનાથ. ૧૯૭૮

૯૯. વિક્રમોદીશીય નાટક / સંસ્કૃત ઉપરથી ભાષાંતર : કિલાભાઈ ઘનશ્યામ ભડ. ૧૯૮૮

ਦੱਕ ਸੀਰੀ : ਰੁ. 100.

કુરીયર ખર્ચ : ૧-૫ સીડી : રૂ. ૨૫. ૬-૧૦ સીડી : રૂ. ૫૦. ૧૧-૫૦ સીડી : રૂ. ૭૫. ૫૧-૧૦૦ સીડી : રૂ. ૧૨૫.

આ ઉપરાંત, ગુજરાતી ભાષાનાં બે અગત્યનાં સામયિકોના તમામ અંકો ક્ષાર્બસ ગુજરાતી સભાએ સીડી પર તૈયાર કર્યા છે :

કૌમુદી

પુસ્તક ૧-૫, સંવત ૧૮૯૧-૧૯૮૪, નંતું પુસ્તક ૧-૧૬,  
૧૯૩૦-૧૯૩૭ ૧૫ સીડી : ૩. ૩૦૦૦. કુરીયર ખર્ચ :  
૩. ૧૦૦. ક્રિલ ૩. ૩૧૦૦

કાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક

સંપર્ણ આઈલ : પસ્તક ૧-૭૫ (૧૯૭૬-૩૦૧૦)

੩੬ ਸੀ.ਬੀ. : ੩, ੪੦੦੦, ਕਰੀਧੁਰ ਖਰ੍ਚ : ੩, ੧੦੦,

₹ 9.00

અને, નીચેનાં આમયિકોના અંકો, પણ, શ્રી હીરાલદ્રામાણિ, કાઉન્ટેશન, તરફથી સીડી, ઉપે પ્રાય્, બન્યા, છે,

ਪ੍ਰਕਤਿ : ੧੯੪੩-੧੯੬੮ (ਪ੍ਰਸ਼ਾਸਕ ਆਥ) ੩- ੩੦੦

ਵੀਅਮੀ ਅਨ੍ਹੀ : ੧੯੭੬-੧੯੩੦ ੩, ੧੫੦

ગુજરાતી સાહિત્ય પરિષદ રજૂ કરે છે  
પુસ્તક ૨૦૦૭-૨૦૧૧ ૩. ૭૫ | ત સીડી ક્રિયર બર્ચ ૩. ૨૫

प्राप्तिस्थानः

## પ્રસાર : પુસ્તકોની નાનકડી દુનિયા

૧૮૮૮ આતાભાઈ એવન્ય. ભાવનગર-૩૬ ૪૦૦૧ ફોન : ૦૨૭૮-૩૪૬ ૮૪૫૨ prasarak@dataone.in

## રણાદેની જાહેરાત